



યોજના

જાન્યુઆરી-૨૦૧૭

વિકાસને સમર્પિત માસિક

₹ ૨૨


આપત્તિ વ્યવસ્થાપન

આપત્તિ-વ્યવસ્થાપનમાં સેન્ડાઈ ખાતેની વિશ્વપરિષદ પછી ભારતની નવતર પટેલ
કિરણ રીજીશ્રુતુ

ભારતમાં ટકાઉ વિકાસ માટે આફ્ટોનાં જોખમોનું વ્યવસ્થાપન
ડૉ. પી. જી. ઘાર ચક્રવર્તી

આપત્તિ વ્યવસ્થાપન : તાલીમ અને કામતાનિમણિએ
શ્રી આર. કે. ઝેલ અને ડૉ. બીરકુમાર

કેમિકલ ઉદ્યોગમાં આપત્તિઓ : કારણો, નિવારણ અને ચાહત-ભચાવનાં પગાં
એમ. સૂરીયાનારાયણન



ખાસ લેખ

આપત્તિ નિવારણ: તાંકાલિક - ટ્રોમા કેરની ભૂમિકા અને મહત્વ
ડૉ. અમિત ગુપ્તા, મંદુલ લી, મિશ્ર

ફોકસ લેખ

વિકાસ અને આપત્તિનાં જોખમોમાં ઘટાડો : સેન્ડાઈ ફેમવર્ક
સત્તીપ કુમાર

શું તમે જણો છો?


યુનાઇટેડ નેશન્સ ડિગ્રાસ્ટર એસેસમેન્ટ એન્ડ કોઓર્ડિનેશન (યુઅનડીએસી)

યુનાઇટેડ નેશન્સ ડિગ્રાસ્ટર એસેસમેન્ટ એન્ડ કો-ઓર્ડિનેશન (યુઅનડીએસી) આકતો માટે આંતરરાષ્ટ્રીય કટોકટી પ્રતિસાદ વ્યવસ્થાનો ભાગ છે. દુનિયામાં કોઈ પણ ભાગમાં આકત આવ્યાના ૧૨થી ૪૮ કલાકની અંદર ત્યાંની સરકારની વિનંતી પર ઓફિસ ફોર પ્લે કો-ઓર્ડિનેશન ઓફ હુમેનિટેરિયન અફેર્સ (ઓસીએચએ) યુઅનડીએસીની ટીમને આપણી-નિવારણ માટે મોકલે છે. આકત એકાબેંક આવ્યા પછી યુઅનડીએસી ટીમ ટેકનિકલ સેવાઓ પ્રદાન કરે છે, જેની કામગીરી મુખ્યત્વે નુકસાન, આકારદી તથા દુર્ઘટના, સ્વધાર પર સંકલન અને માહિતીના આદાનપ્રદાન જેવી હોય છે.

યુઅનડીએસીની રૂચના ૧૯૯૭માં રાષ્ટ્રીય સ્તરે, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ પ્રયાસો વચ્ચે જોડાજાને સુલભ કરવાના ઉદ્દેશ સાથે યાઈ હતી. જ્યારે ઉચ્ચિત લાગે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય રાહતનું સંકલન કરવા આપણિગ્રસ્ત દેશમાં સ્થાનિક સત્તામંડળને મદદ કરવા ઓનસાઈટ ઓપરેશન્સ કો-ઓર્ડિનેશન સેન્ટર (ઓએસઓસીસી) સ્થાપિત પણ કરે છે. યુઅનડીએસી ૩૦થી વધારે સત્ત્યો અને સહભાગી દેશો પરાવે છે, જેમાં ઓસીએચએ અને સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ સહિત ૧૯ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓમાંથી કર્મચારીઓ કાર્યરત છે.

ઉપરાંત ઓસીએચએએ સંકલિત રીતે માનવતાવાદી સહાય પ્રદાન કરવા બિનસરકારી સંસ્થાઓ જેવી સંયુક્ત રાષ્ટ્ર સિવાયની સંસ્થાઓ સાથે સંયુક્તપણે કામ કરવા સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ માટે માળખાગત કલસ્ટર્સ પણ સ્થાપિત કર્યું છે. આ પ્રકારનાં ૧૧ અલગઅલગ કલસ્ટર્સ છે, જે દરેક ચોક્કસ પ્રકારના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક કલસ્ટરનું નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્રની એક કે બે સંસ્થાઓ કરે છે. યુઅનડીએસી ટીમ અને ઓસીએચએ કલસ્ટર્સ એમ બંને સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંકલનકર્તા અને આકતમાં અસરગ્રસ્ત દેશમાં યુઅન હુમેનિટેરિયન સંકલનકર્તા સાથે તેમના પ્રયાસોનું સંકલન કરે છે.

જ્યારે મોટા ભાગનાં કલસ્ટર્સ પ્રતિસાદના તબક્કા દરમિયાન કાર્યરત થાય છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર વિકસ-કાર્યક્રમ (યુઅનડીપી) એ અલ્લા રિકવરી કલસ્ટરની સ્થાપના કરી છે, જે સુધારા સાથે સંબંધિત જરૂરિયાત ધરાવતી લાંબા ગાળાની ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કલસ્ટર મારકતે યુઅનડીપી વિકસલકી કાર્યો સાથે માનવતાવાદી પ્રયાસોનો સમન્વય કરે છે. આ કલસ્ટરનો ઉદ્દેશ માનવતાવાદી કાર્યોના કાયદાને આપણિમાં સ્વાધી સુધારામાં પરિવર્તિત કરવાનો, તકોનું નિર્માણ કરવાનો અને વિકસાવવાનો છે.



આગામી આકર્ષણ

LESS CASH ECONOMY | ઓછી રોકડવાળી અર્થવ્યવસ્થા
ફેબ્રુઆરી-૨૦૧૭

જાન્યુઆરી-૨૦૧૭

મુખ્ય તંત્રી : દીપિકા કચ્છલ
તંત્રી : અજય ઈન્ડ્રેકર



આયોજન અને વિકાસને સમર્પિત

વર્ષ : ૪૪ અંક : ૧૦ સર્ટિફિકેશન અંક : ૭૮૩

યોજના

યોજના કાર્યાલય

લોગ લાઈફ હોસ્પિટલ બિલ્ડિંગ, યુ.કો. બેંક ઉપર,

પાલડી ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૭

ફોન : ૨૬૪૮ ૮૬૬૮, ૨૬૪૮ ૧૪૫૦

E-mail Address : yojanagujarati@gmail.com

Website : www.yojana.gov.in

વિષયસૂચિ

આપત્તિ-વ્યવસ્થાપનમાં સેન્ટાઇ ખાતેની	
વિશ્વાસિદ્ધ પદ્ધી ભારતની નવતર પહેલ	
કિરણ રિજ્લ્યુઝન	૪
ભારતમાં ટકાઉ વિકાસ માટે આફિલોનાં જોખમોનું વ્યવસ્થાપન	
ડૉ. પી. જી. ધાર ચક્રવર્તી	૮
આપત્તિ વ્યવસ્થાપન : તાતીમ અને ક્ષમતાનિર્માણ	
શ્રી આર.કે. જૈન અને ડૉ. થીરુકુગામ્ય	૧૧
કેમિકલ ઉદ્યોગમાં આપત્તિઓ : કારણો, નિવારણ અને	
રાહત-બચાવનાં પગલાં	
એમ.સૂરીયાનારાયણન	૧૫
આપત્તિ નિવારણ : તાત્કાલિક - ટ્રોપા કેરની ભૂમિકા અને મહત્વ	
ડૉ. અમિત ગુપ્તા, મહેશ સી. મિશા	૧૬
વિકાસ અને આપત્તિનાં જોખમોમાં ઘટાડો : સેન્ટાઇ ફેમવર્ક	
સંતોષ કુમાર	૨૪

ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટ : આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષયમાં	
કમલ કિશોર	૨૮
કૈવિક આપત્તિઓ: કારણો અને ભવિષ્ય	
ડૉ. અર્યના સ્કૂલ	૩૨
આપત્તિ વ્યવસ્થાપનમાં અસરકારક કોમ્યુનિકેશનની ભૂમિકા અને મહત્વ	
સી. કે. નાયક	૩૯
માનસિક પ્રાથમિક ઉપચાર: હતાશામાંથી હળવા થવાનો માર્ગ	
ડૉ. હરિંદ્રનાન અને અંબરીન ખાન	૩૬
આપત્તિ વ્યવસ્થાપન : હકીકત અને આયોજન	
ડૉ. તુપાર હાથી	૪૨
ગુજરાતમાં 'આપત્તિ વ્યવસ્થાપન'	
ડૉ. લીલાબેન સ્વામી	૪૬
આપત્તિ-સંચાલન અને ૧૩માં નાણાંપંચની ભલામણો	
ડૉ. વંદના બિરેદી	૫૧

ટાઈટલ

● આવરણ ડિઝાઇન	: —	૧
● શું તમે જાણો છો?	: —	૨
● યુવાનો માટે મોબાઈલ અને ડિજિટલ બેંકિંગ ઈન્ડ્રેક્શન અભિયાન	: —	૩
● પ્રકાશન વિભાગનાં પુસ્તકો	: —	૪

છૂટક નાકલ : રૂ. ૨૨-૦૦, વાર્ષિક લવાજમ : રૂ. ૨૩૦-૦૦, બે વર્ષ : રૂ. ૪૩૦-૦૦, તૃષ્ણ વર્ષ : રૂ. ૬૧૦-૦૦
લવાજમની રકમ “S.B.I. A/c. No. ૫૧૫-૦૮-૧૦, Yojana (Guj.)”ના નામે મનીઓર્ડર/ચેક/બેંક ટ્રાફિટથી મોકલી શકાશે.
યોજના તથા કુરુક્ષેત્રનું લવાજમ હવે ઓનલાઈન ભરી શકાશે. www.yojana.gov.in

આયોજન અને વિકાસને વાચ્યા આપતું આ માસિક ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, આસામી, તામિલ, તેલુગુ, બંગાળી, મલયાલમ, ઉર્દૂ, હિન્દી, કષ્ણ, પંજાਬી અને ઉદ્ધિયા ભાષામાં પ્રકાશિત થાય છે.
યોજનામાં પ્રગટ થતા લેખોમાંના મંતવ્યો લેખકોના પોતાનાં છે. તેની સાથે તંત્રી સહમત છે એમ માની લેવું નહીં.




યોજના

તંત્રીલેખ

આફ્ટોનો સામનો કરવા માટે અગાઉથી તેની તૈયારી અને આયોજન અતિ મહત્વપૂર્ણ

સમય સતત વહેતો પ્રવાહ છે, એટલે કુદરતી કે માનવસર્જિત - કોઈ પણ પ્રકારની આફ્ટો માનવસમાજની ઉત્કાંતિનો ભાગ છે. સૈદ્ધાંતિક રીતે માનવામાં આવે છે કે માનવજીતના આગમન અગાઉ પૃથ્વી પર વિચરતા ડાયનાસોર, સાયબેરિયાના વાધ જેવા કેટલીક મહાકાય પ્રજ્ઞાતિઓ આબોહવામાં ફેરફાર, રહેણાક ગુમાવવાના કારણે કે ઉલ્કાપાત જેવી કેટલીક કુદરતી આફ્ટોને કારણે લુમ્પ્રાય થઈ હતી. સિંહઘાટીની સંસ્કૃતિના રહસ્યમય રીતે પતન માટે પણ ઈતિહાસકારો કેટલીક આફ્ટોને જવાબદાર ઠેરવે છે - નદીના પ્રવાહમાં ફેરફાર થવો, દુષ્કાળ કે રોગચાળો, પૂર જેવી કુદરતી આફ્ટોમાંથી પ્રજ્ઞાતિઓને બચાવવા માટે બનાવવામાં આવી હતી.



ભારતીય મહાયંડ દુનિયામાં આફ્ટનું સૌથી વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાંનો એક છે. દેશમાં ધરતીકંપના હાલના જોન મુજબ, ભારતનો પણ ટકા જમીનવિસ્તાર ધરતીકંપનું મધ્યમથી અતિ જોખમ ધરાવે છે. કુલ ઉરદુ મિલિયન હેક્ટાર (એમએચેમે) ભૌગોલિક વિસ્તારમાંથી ૪૦ એમએચેમેથી વધારે વિસ્તાર પૂરનું જોખમ ધરાવે છે. પૂરના કારણે દર વર્ષે સરેરાશ ૭૫ લાખ હેક્ટાર જમીનને અસર થાય છે, ૧૬૦૦ લોકો જીવ ગુમાવે છે તથા પાક, મકાનો અને જાહેર યુટિલિટીને રૂ. ૧૮૦૫ કરોડનું નુકસાન થાય છે.

એટલે માનવજીત માટે આફ્ટો કોઈ નવીન ઘટના નથી. દુષ્કાળો, પૂર, રોગચાળો, ધરતીકંપ, સુનામી - આ તમામ પ્રકારની આફ્ટો માનવજીતે અનુભવી છે. અને છતાં આપણે આપણું અસ્તિત્વ ટકાવી શક્યાં છીએ. આ જ માનવ-અસ્તિત્વનો ચમત્કાર છે - જે આપણી સ્થિતિસંજોગો સાથે અનુકૂલન સાધવાની અને મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કરવાની ક્ષમતાનો પુરાવો છે. તાજેતરમાં ચેનાઈમાં આવેલા પૂર દરમિયાન આ સારી રીતે સાબિત થયું છે, જેમાં લોકોએ માનવતાને કાજે એકબીજાને સાથસહકાર આપ્યો હતો. જોકે આપત્તિનું વ્યવસ્થાપન કરવાની જવાબદારી માનવીય પ્રયાસો પર જ છોડી ન શકાય. હડીકતમાં આપત્તિઓનું નિવારણ કરવા તૈયારી અને આયોજનના કેટલાંક પાસાં સરકાર અને સમુદ્ધાય એમ બંને પણે જરૂરી છે, કારણ કે જીવારે આપત્તિ આવે છે, યારે તૈયારી કરવાનો સમય મળતો નથી. એટલે જ રાષ્ટ્રીય આપત્તિ-નિવારણ સંસ્થા અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ સત્તામંડળ જેવી સંસ્થાઓને આપત્તિ-નિવારણનું પૂર્વાયોજન કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં શહેરીકરણમાં વધારો થયો છે, વસતિમાં વધારો થયો છે અને પર્યાવરણને નુકસાન વધુ ને વધુ થઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં વર્ષોથી આપત્તિના કારણે જીનમાલના નુકસાનમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ ૧૯૮૮માં ભોપાલ કરુંઝાંતિકા, વર્ષ ૨૦૧૩માં ઉત્તરાંદ્રાં પૂર, વર્ષ ૨૦૧૧માં કુકુરીમા દાઈથી પરમાણૂ-દુર્ઘટના સર્જીદી હતી - આ તમામ દુર્ઘટનાઓ માનવસર્જિત હતી, જેને ટાળી શકાઈ હોત, જેમાં અનેક લોકોના મૃત્યુ થયો હતાં.


કુદરતી આપત્તિઓ ચેતવણી આપ્યા વિના એકાએક ગ્રાટકે છે - જેમ કે સુનામી ભારતીય દરિયાકિનારા પર એકાએક આવ્યું હતું અને તેમાં મોટાપણે જીનમાલની હાનિ થઈ હતી. કુદરત આ આફ્ટો મારફતે માનવજીતને પોતાની તાકાતનો પરિયય આપે છે. તેમનું સંચાલન કરવું પડ્યો. એટલે આપત્તિ પછી ઉચ્ચિત પ્રતિસાદની જરૂર છે. દુર્ઘટનાસ્થળે પહોંચતી દુક્કીઓ કોઈ પણ પ્રકારની કટોકટીનો સામનો કરવા સારી રીતે તૈયાર હોવી જોઈએ. તથીબોની ટીમો કટોકટીની સ્થિતિનું સંચાલન કરવા દોડીને પહોંચવી જોઈએ. અત્યારે પોસ્ટ ટ્રોમાકેર અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જીવન અને મૃત્યુ વચ્ચે સૌથી મોટો ફરક પેદા કરી શકે છે. દુર્ઘટનાસ્થળે પોતાના પ્રિયજનોને ઓળખવાં અને શોધવા સૌથી મોટું ચિંતાજનક પરિબળ છે. નેશનલ ડિઝસ્ટર રિસ્પોન્સ ફોર્સની સ્થાપના આ આવશ્યક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે થઈ છે.

કેટલીક વખત થોડી કે નાની જાણકારી આફ્ટનાં નુકસાનકારક પરિણામોને લાંબાગાળે નિવારી શકે છે, એટલે લોકો વચ્ચે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આફ્ટનું જોખમ ધરાવતા વિસ્તારોમાં લોકોને આફ્ટની અગમયેતી આપવા અને આફ્ટ ખરેખર આવે, તો તેનો સામનો કરવાની તાલીમ આપી શકાશે. એટલે અસરકારક સંચાલન મહત્વપૂર્ણ છે. ઓડિશામાં તાજેતરમાં આવેલું પૂર આફ્ટના વ્યવસ્થાપનમાં સુઆયોજિત સંચાર-વ્યૂહરચના કેવી રીતે ઉપયોગી પુરવાર થાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે.

એટલે મૂળ વાત આફ્ટનો સામનો કરવાની છે. આપણે આફ્ટને અટકાવી ન શકીએ, પણ તેની અસરને ઘટાડી શકીએ અને પોતાની જાતને જાણકારી સાથે સજજ કરી શકીએ, જેથી અનેક જીવન બચાવી શકાશે. બેન્જામિન ફેન્કલિને કહ્યું છે કે, ‘સમસ્યાનાં સમાધાન કરતાં તેનું અગાઉથી નિવારણ વધારે કીંમતી છે.’

આપત્તિ-વ્યવસ્થાપનમાં સેન્ડાઈ ખાતેની વિશ્વપરિષદ પદ્ધી ભારતની નવતર પહેલ

કિરણ રિજજુ



આપત્તિ હોનારત વગેરેમાંથી ઉભા થતા જોખમો ઘટાડવા માટે વિશ્વસંસ્થા યુનોની ગ્રીજ વિશ્વપરિષદ દરમિયાન ૧૮મી માર્ચ, ૨૦૧૫ના જે દિવસે ભારત સહિત વિશ્વના ૧૮૮ દેશો-યુનોના સભ્ય દેશોએ ૧૫ વર્ષની યોજના અપનાવી, એ દિવસ એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. જ્યાનના સેન્ડાઈ શહેરમાં યોજાયેલી પરિષદમાં અપનાવાયેલી આ યોજના ‘સેન્ડાઈ ફેમવર્ક’ તરીકે ઓળખાય છે. રસપ્રદ બાબત એ છે કે આ યોજના ૨૦૧૫ પદ્ધીના વિકાસ-એજન્ડા અંગે યુનોનો સૌ પ્રથમ મહત્વનો મોટો કરાર છે જેમાં ચાર મુખ્ય અગ્રતાકમ અને સાત લક્ષ્યો છે, જે ૨૦૩૦ સુધીમાં સિદ્ધ કરવાનાં છે. આ ફેમવર્ક કે યોજના અપનાવવા પાછળની અપેક્ષા, આપત્તિનાં નવાં જોખમો ઊભાં થતાં અટકાવવાની તથા આપત્તિનાં પ્રવર્તમાન જોખમોમાં ભારે ઘટાડો કરવાની છે. સેન્ડાઈ ફેમવર્કના, અગ્રતાકમ ધરાવતા ચાર ક્ષેત્રોમાં, (૧) જોખમો સમજવાં (૨) જોખમોના વ્યવસ્થાપનની કામગીરી સુદ્રદ કરવી (૩) આપત્તિમાંથી ઝડપથી બહાર આવવા માટેનાં પગલાંમાં મૂડીરોકાણ કરવું તથા (૪) આપત્તિના મુકાબલા માટેની શક્તિ વધારવી તથા આપત્તિ પદ્ધી પુનઃ નિર્માણ માટેની ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે.

આ

પત્તિ હોનારત વગેરેમાંથી ઉભા થતા જોખમો ઘટાડવા માટે વિશ્વસંસ્થા યુનોની ગ્રીજ વિશ્વપરિષદ દરમિયાન ૧૮મી માર્ચ, ૨૦૧૫ના જે દિવસે ભારત સહિત વિશ્વના ૧૮૮ દેશો-યુનોના સભ્ય દેશોએ ૧૫ વર્ષની યોજના અપનાવી, એ દિવસ એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. જ્યાનના સેન્ડાઈ શહેરમાં યોજાયેલી પરિષદમાં અપનાવાયેલી આ યોજના ‘સેન્ડાઈ ફેમવર્ક’ તરીકે ઓળખાય છે. રસપ્રદ બાબત એ છે કે આ યોજના ૨૦૧૫ પદ્ધીના વિકાસ-એજન્ડા અંગે યુનોનો સૌ પ્રથમ મહત્વનો મોટો કરાર છે જેમાં ચાર મુખ્ય અગ્રતાકમ અને સાત લક્ષ્યો છે, જે ૨૦૩૦ સુધીમાં સિદ્ધ કરવાનાં છે. આ ફેમવર્ક કે યોજના અપનાવવા પાછળની અપેક્ષા, આપત્તિનાં નવાં જોખમો ઊભાં થતાં અટકાવવાની તથા આપત્તિનાં પ્રવર્તમાન જોખમોમાં ભારે ઘટાડો કરવાની છે. સેન્ડાઈ ફેમવર્કના, અગ્રતાકમ ધરાવતા ચાર ક્ષેત્રોમાં, (૧) જોખમો સમજવાં (૨) જોખમોના વ્યવસ્થાપનની કામગીરી સુદ્રદ કરવી (૩) આપત્તિમાંથી ઝડપથી બહાર આવવા માટેનાં પગલાંમાં મૂડીરોકાણ કરવું તથા (૪) આપત્તિના મુકાબલા માટેની શક્તિ વધારવી તથા આપત્તિ પદ્ધી પુનઃ સેન્ડાઈ ફેમવર્કમાં આપત્તિને

કારણે થતાં વ્યાપક નુકસાનમાં મોટો ઘટાડો કરવા માટેના લક્ષ્યાંકો નક્કી થયા છે, જેમાં આપત્તિમાં થતી જાનછાની, અસરગ્રસ્ત લોકોની સંખ્યા, આર્થિક નુકસાન તથા આંતરમાળખાના નુકસાનનો સમાવેશ થાય છે. આની સાથોસાથ, રાષ્ટ્રીય અને સ્થાનિક વ્યૂહરચના તથા આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા આપત્તિ અંગે વહેલી ચેતવણી-વ્યવસ્થા ઉભી કરવા ઉપર તેમજ એનો લાભ મેળવવા ઉપર ખાસ ભાર મુકાયો છે. આ નવું માળખું ઘડાયું એ પહેલા ર૨૦૦૫માં હ્યોગો ફેમવર્ક ફોર એક્શન અપનાવાયું હતું અને એ પદ્ધીના દાયકામાં આપત્તિ દરમિયાન થયેલા નુકસાનને નજરમાં રાખી નુકસાન ઘટાડવા માટેની દિશામાં વધુ પ્રગતિ અંગે નક્કર સંકેતો આપવા નવા માળખામાં જણાવાયું છે. સેન્ડાઈ ફેમવર્ક કે માળખામાં અગાઉના ૨૦૦૫ના માળખા હેઠળ વિવિધ દેશો વગેરેએ શરૂ કરેલી કામગીરી ચાલુ રહે અને એમાં જરૂરી સુધારાવધારા થાય, એનું ખાસ ધ્યાન રખાયું છે. ભારતે સેન્ડાઈ ફેમવર્ક હેઠળ આપત્તિનાં જોખમો ઘટાડવા માટેની આપણી પ્રતિબદ્ધતા દોહરાવી છે તેમજ આપત્તિ પદ્ધી ઝડપથી બેઠા થવા માટે તાકીદનાં પગલાંની વ્યવસ્થા ઊભી કરવાનો સંકલ્પ કર્યો છે.

મહત્વની પહેલ

સેન્ડાઈ ફેમવર્ક પરતેની આપણી પ્રતિબદ્ધતાને આગળ ધ્યાનવા ભારત

સરકારે સેન્ડાઈ ઘોખણા પછી કેટલીક મહત્વની પહેલ કરી છે. સૌ પ્રથમ તો સેન્ડાઈ પરિષદમાં સ્વીકાર્ય મુજબ ભારતે નવેમ્બર, ૨૦૧૬માં આપત્તિ-ઘટાડા અંગે એશિયાઈ દેશોના મંત્રીઓની પરિષદનું સફળ આયોજન કર્યું હતું, જેમાં નવી દિલ્હી ઘોખણા અને સેન્ડાઈ ફેમવર્કના અમલ માટે પ્રાદેશિક કાર્યઘોજના ને બહાલી આપવામાં આવી હતી, સેન્ડાઈ ફેમવર્કમાં સૂચવ્યા મુજબ નવી દિલ્હી ખાતેની મંત્રીકષાની પરિષદમાં, એશિયા અને પેસિફિકમાં ફેમવર્કના અમલ માટે, આપત્તિ વ્યવસ્થાપનમાં રસ ધરાવતી અનેકવિધ સંસ્થાઓને ભેગા ભળી અમના ચોક્કસ પ્રદાન માટેની તક પૂરી પાડવામાં આવી હતી નવી દિલ્હી પરિષદની ફળશુતિ એશિયા અને પેસિફિકસ સેન્ડાઈ ફેમવર્કનો અમલ કરવામાં માર્ગદર્શક બનશે તથા અમલમાં ઝડપ લાવશે. આ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશમાં આપત્તિનાં જોખમો ઘટાડવા માટેના પ્રયત્નો બમણા વેગથી અમલી બનાવવા દસ પોઇન્ટનો એક એજન્ડાની રૂપરેખા રજૂ કરી હતી.

બીજું, ભારત સરકારે, સેન્ડાઈ ફેમવર્ક ૨૦૧૫-૨૦૩૦નાં ધ્યેય, લક્ષ્ય અને અગ્રતાકમોના આધારે, તમામ રાજ્ય સરકારોને અગ્રતાકમના આધારે હાથ ધરવાનાં કાર્યોની સૂચિ પૂરી પાડી છે. ભારત સરકારે નવી દિલ્હી પરિષદ દરમિયાન, એશિયાઈ પ્રદેશમાં આપત્તિનાં જોખમો ઘટાડવા માટે સેન્ડાઈ ફેમવર્કના અસરકારક અમલ માટે, યુનિવર્સિટીઓને દસ લાખ ડોલરની ગ્રાન્ટ પૂરી પાડી છે.

ફરતું ભંડોળ

ગીજુ પહેલ હેઠળ, સેન્ડાઈ ફેમવર્કના ચોથા અગ્રતાકમ મુજબ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળને સુદૃઢ કરવા માટે

તથા વ્યાવસાયિક રીતે સુસજજ કરવા ઉત્કૃષ્ટ તાલીમ પૂરી પાડવા તથા સાધનસામગ્રી સજજ કરવાનાં પગલાં લેવાયાં છે. વધુમાં ભારત સરકારે રૂ. ૨૫૦ કરોડના ફરતાં ભંડોળ મારફત રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ રીજર્વ અનામત ભંડોળ ઊભું કરવાની બહાલી આપી છે, જેનું સંચાલન રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ હસ્તક રહેશે. આ ફરતું ભંડોળ, રાષ્ટ્રીય આપત્તિ-પ્રતિસાદ દળને, આપત્તિ પણીના રાહતકાર્ય માટે આવશ્યક, તંબુઓ, ખાદ્યચીજો, દવાઓ તેમજ તાકીદની સાધનસામગ્રીનો એકધારો પુરવઠો જાળવી રાખવામાં સહાયક બનશે.

ચોથું, કેન્દ્ર સરકારે આપત્તિ પણીની બચાવ અને રાહત-કામગીરીમાં ભારતની નિષ્ણાત સેવા અને જાણકારીનો લાભ અન્ય દેશોને પૂરો પાડવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. ભારતે ૨૦૧૧માં જપાનના ધરતીકંપ અને ૨૦૧૫માં નેપાળના ધરતી કંપ દરમિયાન એ જ આ સેવા પૂરી પાડી હતી. ભારત સરકારે સાર્ક દેશો વચ્ચે આપત્તિના વ્યવસ્થાપન અંગે પ્રાદેશિક સહકાર વધારવા સાર્ક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું યજમાન બની છે. દિલ્હીમાં ૨૦૧૫માં યોજાયેલી સાર્ક આપત્તિ વ્યવસ્થાપન કવાયતે આ કેન્દ્ર ભારતના અનુભવ અને નિષ્ણાત જ્ઞાન-સેવાના અન્ય દેશોને લાભ પૂરો પાડવા અનુકૂળ પ્લેટફોર્મ પૂરું પાડયું હતું. ભારતે સાર્કદેશોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે પ્રાદેશિક સહકાર વધારવા સંસ્થાકીય ગોઠવણાને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજ પ્રમાણે હૈદ્રાબાદ ખાતેનું મહાસાગર માહિતીસેવા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર માત્ર ભારત જ નહીં, પણ મહાસાગરનાં કેન્દ્રમાંના ૨૮ દેશોને આપત્તિ અંગે વહેલી તકે ચેતવણી પૂરી પાડે છે.

સંશોધનકેન્દ્ર

પાંચમું આપત્તિ વ્યવસ્થાપનના કેન્દ્ર સુસજજતા અને સેવા વધારવાના એક પ્રયાસ રૂપે ઓગસ્ટ, ૨૦૧૫માં આપત્તિ વ્યવસ્થાપનની રાષ્ટ્રીય સંસ્થાએ જવાહરલાલ નહેદું યુનિવર્સિટી સાથે એક સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ આ યુનિવર્સિટી, એના સંકુલમાં આપત્તિ સંબંધી સંશોધન અને આપત્તિમાંથી બહાર આવવાની શક્તિનું નિર્માણ કરવા માટેનું કેન્દ્ર ઊભું કરવા નાણાંકીય સહાય તથા શૈક્ષણિક સહકાર પૂરાં પાડશે તથા આ કેન્દ્ર ઉચ્ચશિક્ષણ અને સંશોધન માટે વિવિધ વિધાશાખાનું માળખું ઊભું કરવામાં આવશે આ ઉપરાંત સંસ્થાકીય સુદૃઢતા વધારવા ભારત સરકારે નાગપુર ખાતેની નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એકેડેમીની રચના કરી છે, જે આપત્તિવ્યવસ્થાપન વગેરેમાં પ્રવૃત્ત લોકોને ખાસ તાલીમ પૂરી પાડશે. ભારત સરકારે નેશનલ ફાયર સેફ્ટી કોલેજને એક અત્યંત અધ્યતન સાધનસગવડોની સજજ સંસ્થા બનાવવા માટે એને સુદૃઢ કરી અપગ્રેડ કરવા રૂ. ૨૦૫ કરોડની ફાળવણી કરી છે. આંતરમાળખાના વિકાસકાર્યના મુખ્ય પ્રવાહમાં ડીઆરઆરને જોડવા આંતરમાળખાના વિકાસ સાથે સંકળાયેલી એજન્સીઓ, ખાસ કરીને ટેકરાળ રાજ્યોમાં પ્રવૃત્ત આવી સંસ્થાઓને આપત્તિ નિવારણના પાયાનાં વ્યવહારું પાસાં અંગે તાલીમ પૂરી પાડવાની વ્યવસ્થા ઊભી કરવા વિચારણા થઈ રહી છે.

વધુમાં સરકારે ૧૪માં નાણાપંચની ભલામણોનો અમલ કરી દેશનાં વિવિધ રાજ્યો માટેના રાજ્ય આપત્તિ પ્રતિસાદ ફડ ધી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફડ માટે રૂ. ૬૧,૨૨૦ કરોડની ફાળવણી

(રૂ. ૪૭,૦૨૮.૫૦ કરોડ કેન્દ્રનો હિસ્સો અને રૂ. ૧,૪૮૦.૫૦ કરોડ રાજ્યોનો હિસ્સો મંજૂર કર્યો છે. આ ફાળવણી ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ના સમયગાળા માટેની છે, જે ૧૩માં નાણાંપંચની ૨૦૧૦-૧૧ થી ૨૦૧૪-૧૫ના ગાળા માટેની રૂ. ૩૩,૫૮૦.૮૩ કરોડની ફાળવણી કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ ફંડમાંથી આપત્તિના પ્રસંગોએ થતી નાણાંકીય ફાળવણી ઉપરાંત આ માટેના રાષ્ટ્રીય ફંડ-એન્ડીઆરએફમાંથી પણ ગંભીર આપત્તિના પ્રસંગોએ જરૂરિયાત અનુસાર વધારાનું ફંડ પૂરું પાડવામાં આવે છે. દેશનાં વિવિધ રાજ્યોને વિવિધ પ્રકારની આપત્તિના મુકાબલા માટે, ૨૦૧૫-૧૬ના વર્ષમાં કુલ રૂ. ૧૭,૭૪૮.૧૮ કરોડની (જે માં એન્ડીઆરએફના રૂ. ૫,૨૮૭.૨૨ કરોડનો સમાવેશ થાય છે) રકમ પૂરી પાડવામાં આવી હતી.

પરસ્પર સહકાર

છેલ્લે આપત્તિનું જોખમ ઘટાડવામાં પ્રાથમિક ભૂમિકા સંબંધિત રાજ્યની હોવા ઉપર પુનઃ ભાર મૂક્તાં સેન્ડાઈ ફેમવર્કમાં ખાનગી ક્ષેત્ર સહિત હિત ધરાવતી અન્ય સંસ્થાઓ વગેરેને પણ આપત્તિના મુકાબલાની તૈયારી આપત્તિ ઘટાડવાનાં આયોજન તથા બચાવ અને રાહત કામગીરીમાં પણ સક્રિય સહયોગ પૂરો પાડવાની અપીલ કરવામાં આવી છે. આપત્તિનાં જોખમો ઘટાડવાનું મિશનમાં, આવાં જોખમો ઘટાડવાની કાર્યપદ્ધતિને વધુ મજબૂત કરવા, આ માટેની શક્તિ વધારવા વિશ્વસનીય અને પરવરી શકે એવી અધતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અને એની અન્ય સાથે વહેંચણી કરવામાં જાહેર તથા ખાનગી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ પરસ્પર સહકાર સહયોગ કરે, એ આવશ્યક છે.

ભારત સરકાર એવું માને છે કે આપત્તિના મુકાબલા માટેના ટકાઉ આંતરમાળખાની વ્યવસ્થામાં ઝડપી શહેરીકરણને પરિણામે ઊભા થતાં ગૌણ જોખમો સહિત તમામ પરિબળને ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. નવેમ્બર ૨૦૧૬માં નવીદિલ્હીમાં યોજાયેલી આપત્તિમાં ઘટાડા અંગેની એશિયાઈ દેશોના મંત્રીઓની પરિષદ્ધના અંતે બહાર પાડવામાં આવેલા ફળશુદ્ધિરૂપ દસ્તાવેજો આપત્તિના મુકાબલા માટે પ્રાદેશિક સહકાર સહયોગની રાજકીય પ્રતિબદ્ધતાનું પુનઃ સમર્થન છે. આ દસ્તાવેજો અને સમર્થનનું પુનરુચ્યારણ આપત્તિનાં જોખમો શોધી કાઢવામાં તથા પડકારોના મુકાબલામાં ભવિષ્યની વ્યૂહરચના ઘડી કાઢવામાં સહયોગ બનશે. આ ઉપરાંત આ માટે દુર્લભ સાધનોની સમાન વહેંચણીમાં પણ એ મદદરૂપ થશે અને અંતિમ તબક્કે ટકાઉ વિકાસનાં ધ્યેય હાંસલ કરવામાં ફાળો આપશે.

આપત્તિનાં જોખમો ઘટાડવા માટે પ્રધાનમંત્રીનો ૧૦ મુદ્દાનો એજન્ડા

- વિમાનમથકો, રસ્તા, નહેરો, હોસ્પિટલો, શાળાઓ, પુલ વગેરે તમામ વિકાસ-પ્રોજેક્ટો આપત્તિમાં ટકી શકે એવા યોગ્ય ધોરણસર બંધાય એનું ધ્યાન રાખો અને જે લોકોની સેવા માટે એનું નિર્માણ થાય છે, એ લોકો આપત્તિમાંથી ઝડપી બહાર આવી શકે, એવી વ્યવસ્થામાં ફાળો આપે એ સુનિશ્ચિત કરો. આપત્તિમાંથી બહાર આવી શકાય એવા આંતરમાળખાને માટે વ્યાપક ટેકો ઊભો કરો.
- ગરીબ કુટુંબોથી શરૂ કરી નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો અને બહુરાષ્ટ્રીય કોપરેશનોથી માંડી રાજ્યો-દેશ એમ તમામ માટે જોખમોને આવરી લેવાના પ્રયાસો કરો.
- આપત્તિનાં જોખમોના વ્યવસ્થાપન માં મહિલાઓની આગેવાની તેમજ એમને વધુ પ્રમાણમાં સાંકળી લેવા ઉત્તેજન આપો.
- તમામ જોખમો માટે વૈશ્વિક ધોરણે નકશા તૈયાર કરવામાં મૂડીરોકાશ કરો.
- આપત્તિનાં જોખમોના વ્યવસ્થાપનના આપણા પ્રયાસોની ક્ષમતા વધારવા માટે ટેક્નોલોજીનો સાધન તરીકે ઉપયોગ કરો.
- આપત્તિની સમસ્યાઓમાં કામગીરી માટે યુનિવર્સિટીઓનું એક નેટવર્ક વિકસાવો.
- સોશીયલ મીડિયા અને મોબાઇલ ટેક્નોલોજીએ પૂરી પાઢેલી તકોનો ઉપયોગ કરો.
- સ્થાનિક શક્તિ અને પહેલના આધારે આગળ વધો-વધુ પગલાં ઘડો.
- આપત્તિ ઉપરથી પદાર્થપાઠ શીખવાની તક વેડફાઈ ન જાય એ સુનિશ્ચિત કરો, આપત્તિ પછી ઘરોનાં પુનઃ બાંધકામ માટે ટેક્નિકલ ટેકો પૂરો પાડવા એક સગવડ ઊભી કરો.
- આપત્તિના મુકાબલામાં આંતરરાષ્ટ્રીય પ્રતિભાવમાં વધુ સહકાર-સહયોગ રચો.

લેખક ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન છે.

ભારતમાં ટકાઉ વિકાસ માટે આફ્ઝતોનાં જોખમોનું વ્યવસ્થાપન

ડૉ. પી. જી. ધાર ચક્રવર્તી




ભારત પણ વૈજ્ઞાનિક તથા પરંપરાગત જ્ઞાનનો સારો એવો ખજાનો છે તથા આફ્ઝતના જોખમની કુદરતી અને અન્થ્રોપોલોજીનિક પ્રક્રિયાની ઘણી સમજણું, પરંતુ તેનાથી હંમેશાં સામાજિક અને આર્થિક વિકાસ, કાયકર્મ, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણમાં મદદ મળતી નથી. આફ્ઝતના જોખમને ટાળવા માટેના પ્રોજેક્ટનાં પરિણામ મહત્વમાં ફાયદકારક હોતાં નથી અને કેટલીક વખત આ પ્રોજેક્ટની પરોક્ષ ક્રીડટ રીતે આફ્ઝતનાં નવાં જોખમ પેદા થાય છે અથવા વર્તમાન આફ્ઝતનાં જોખમો વધારે ઉગ્ર બને છે.

ભારતે જરૂરી આર્થિક વૃદ્ધિનો માર્ગ પકડ્યો છે, જે તાજેતરમાં શરૂ કરવામાં આપેલી કેટલીક પદેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ક્રિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિવ્યાન, સ્માર્ટસિટી મિશન વગેરેથી આગળ વધવાની શક્યતા છે. કદાચ એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે આગામી દોષ દાયકરણ ભારતમાં સામાજિક અને આર્થિક વિકાસમાં આહેર અને ખાનગી રોકાણ છેલ્લાં ચાર કે પાંચ દાયકરણ કરવામાં આવેલા રોકાણ કરતા અનેક ગણ્યું વધારે હશે. તેના કારણે વિવિધ સેક્ટરમાં વિકાસ-પ્રોજેક્ટના પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને અમલીકરણ માટે તક પૂરી પાડવામાં આવે છે, જેનાથી જોખમ વધે નહીં, પરંતુ આફ્ઝતના જોખમને ટાળવાની મક્કિયામાં મદદ મળે.



આસ્ટર મેનેજમેન્ટ (આફ્ઝતનું વ્યવસ્થાપન)ની કામગીરીમાં ઘણો વિકાસ થયો છે અને તે આફ્ઝતની ઘટનાના વ્યવસ્થાપનથી લઈને આફ્ઝતના જોખમના વ્યવસ્થાપન સુધી પહોંચ્યું છે. આફ્ઝતો માટે જોખમના વ્યવસ્થાપનના વલણનો અર્થ એ થયો કે કુદરતી અથવા એન્થ્રોપોલોજીનિક (માનવ-પ્રવૃત્તિથી પ્રદૂષણને લગતાં) જોખમો અને નબળાઈઓને સમજવી, તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો અને જોખમ પેદા થતાં જ અટકાવી શકાય તે માટેના આવશ્યક પગલાં લેવાં.

આફ્ઝતિ ૧ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટ



તેનો અર્થ એ પણ થયો કે વિવિધ માળખાકીય અને બિનમાળખાકીય પગલાં લઈને વર્તમાન જોખમોમાં ઘટાડો કરવો, જેમાં જોખમની વહેંચણી અને જોખમના વીમાના ઈનોવેટિવ મિકેનિઝમનો સમાવેશ થાય છે. બાકીનાં જોખમો, જેમને અટકાવી શકતાં

નથી અથવા ઘટાડી શકતાં નથી કે વીમો ઉત્તરાવી શકતો નથી, તેમના માટે વધારે સારી તૈયારી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આફ્ઝતો સામે તૈયાર થવું, એટલે આફ્ઝત ત્રાટ્કે ત્યારે તેનો સામનો કરવા માટે પૂરી રીતે સજ્જ રહેવું, જેથી લોકોના જીવ બચાવી શકાય અને લોકોની પરેશાની શક્ય એટલી ઓછી કરી શકાય, જેમાં લોકોને અન્યત્ર ખસેડવા, શોધખોળ અને બચાવ કામગીરી, આવાસ અને રાહત જેવી માનવીય સહાય વગેરેનો સમાવેશ થાય છે. તૈયારી કરવી એટલે વધારે સાંચું જીવન ફરીથી રચવા, મકાનો બાંધવાં અને ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે નીતિ, સ્ટ્રેટેજ અને ખોત તૈયાર રાખવાં.



આફ્ટિ ર આફ્ટની અસર (૧૯૮૫-૨૦૧૫)

ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટ ટકાઉ વિકાસમાં એક મહત્વાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, કારણ કે નુકસાનને ધ્વાતદ્વારા માટે ઠગલાબંધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં નુકસાન અને ખોટમાં સતત વધારો થયો છે. યુએન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિડક્શન (યુએનઆઈએસડીઆર)ના અંદાજ પ્રમાણે છેલ્લાં બે દાયકામાં વિવિધ આફ્ટોના કારણે લગભગ ૧૩ લાખ લોકો માર્યા ગયા છે, ૪.૪ અબજ લોકો અસર પામ્યા છે અને આફ્ટોના કારણે બે લાખ કરોડનું નુકસાન ગયું છે.

ભારતે પણ આફ્ટોના કારણે ઘણું નુકસાન અને ખોટ વેઠી છે. વિશ્વબેન્કના અંદાજ પ્રમાણે નેવુંના દાયકાના અંતમાં અને ચાલુ સદીના પ્રારંભમાં આફ્ટોના કારણે આર્થિક પ્રવૃત્તિને થયેલું નુકસાન છીટીપીના લગભગ બે ટકા જેટલું હતું, જ્યારે દેશમાં જાહેર આરોગ્ય માટે આટલી રકમ ખર્ચવામાં આવી ન હતી.

આફ્ટ અને વિકાસ

આફ્ટિ ર આફ્ટ-વિકાસના સંબંધનાં ત્રિપરિમાણ



આફ્ટો ત્રિપરિમાણીય જોડાણ દ્વારા વિકાસ સાથે સંકળાયેલી છે. પ્રથમ, વર્ષો અને દાયકાઓ સુધી મહેનત કરીને મેળવેલા વિકાસને ડિઝાસ્ટર (આફ્ટ) નાના નાને છે. બીજું, વિકાસના અભાવે નબળા સમુદ્ધાયોને આફ્ટ વખતે સૌથી વધારે ફિટકો લાગે છે. ત્રીજી બાબત અને વક્તા એ છે કે આફ્ટોના કારણે બીજી આફ્ટ આવવાનો

યોજના જાન્યુઆરી-૨૦૧૭

ખતરો વધી જાય છે. જેમકે જોનિગ અને બિલ્ડિંગના નિયમોનું પાલન કર્યા વગર મકાનો અને માળાખું સ્થાપવામાં આવે, તો તે નબળાં રહે છે. પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં ખાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવાથી આફ્ટો સામેના કુદરતી બદ્દર ખતમ થાય છે. જ્યારે ફોસ્િલ ફ્યુન્શન આધારિત ઉત્પાદન અને વપરાશથી પર્યાવરણને લગતી આફ્ટોના જોખમાં વધારો થાય છે.

૨૦૧૫ ગતિ (મોમેન્ટમ્)

આફ્ટોનો સામનો કરી શકે તેવા ટકાઉ વિકાસ માટે વધતી ચિંતાને ૨૦૧૫માં એક નવી દિશા અને ગતિ મળી હતી, જ્યારે આગામી દોઢ દાયકા અને તેનાથી આગળના સમય માટે વિકાસનો એજન્ડા નક્કી કરવા માટે ત્રાણ સમાંતર, પરંતુ એકબીજા પર આધારિત પ્રક્રિયાઓનો સમન્વય થયો. તેમાં પ્રથમ હતું સેન્ડાઇ ફેન્ડમર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ૨૦૧૫-૨૦૩૦ જેને માર્ય ૨૦૧૫માં જ્યાન ખાતે સ્વીકારવામાં આવ્યું હતું. સેડાઇ ફેન્ડમર્કમાં પ્રથમ વખત આફ્ટોના જોખમાં ઘટાડો કરવા માટે સાત પરિણામ આધારિત વૈશ્વિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં આફ્ટથી થતા મોત અને અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવો અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન અટકાવવાનો તથા આફ્ટો સામે અગાઉથી ચેતવણી આપતી સિસ્ટમ વિકસાવવી અને આફ્ટોના વ્યવસ્થાપન માટે

અંતરરાષ્ટ્રીય સહકારનો સમાવેશ થતો હતો.

તેમાં સ્થાનિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે આફ્ટના જોખમાં ઘટાડો કરવા માટે કામગીરીની ચાર પ્રાથમિકતા નક્કી કરવામાં આવી હતી જે આ મુજબ હતી: (૧) આફ્ટના જોખમને સમજવું, (૨) આફ્ટના જોખમાં ઘટાડો કરવા માટે રોકાણ કરવું, (૩) આફ્ટોના વ્યવસ્થાપન માટે રિસ્ક ગવરનન્સ મજબૂત બનાવવું અને (૪) અસરકારક પ્રતિસાદ, રિકવરી, પુનઃવસવાટ અને પુનઃનિર્માણ માટે તૈયારીમાં વધારો કરવો.



યુએન જનરલ ઓસેભલી દ્વારા સપ્ટેમ્બર, ૨૦૧૫માં અપનાવવામાં આવેલ ૨૦૨૦ એજન્ડા ફોર સસ્ટેન્બલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)માંથી ૮ માટે નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં વિકાસના તમામ સેક્ટરમાં આફ્ટોસામે પ્રતિકારની યોજનાનો સમાવેશ થતો હતો.

ટકાવી શકાય તેવા વિકાસ-લક્ષ્યાંક	ડિઝાસ્ટર જોખમનો સામનો કરવાના લક્ષ્યાંક
લક્ષ્યાંક ૧ : દરેક સ્વરૂપમાં ગરીબી ખતમ કરવી.	લક્ષ્યાંક ૧.૫: ગરીબોને હવામાન સંબંધિત ઉત્ત્ર ઘટનાઓ અને આફ્ટોસામે રક્ષણ આપવું.
લક્ષ્યાંક ૨ : ભૂખ ખતમ કરવી, ફૂડ-સિક્યોરિટી મેળવવી અને ટકાઉ ખેતીને ઉત્સર્જન આપવું.	લક્ષ્યાંક ૨.૪ : હવામાનમાં ફેરફાર, વાતાવરણમાં તીવ્ર ફેરફાર, દુષ્કાળ, પૂર અને અન્ય આફ્ટો સામે ટકવાની ક્રમતા વધારવી.
લક્ષ્યાંક ૩ : તંદુરસ્ત જીવન સુરક્ષિત કરવું.	લક્ષ્યાંક ૩.૬: વહેલાસર ચેતવણીની પદ્ધતિ વિકસાવવી અને આરોગ્ય સંબંધિત આફ્ટોપોનું જોખમ ઘટાડવું.
લક્ષ્યાંક ૪: સમગ્રલક્ષી અને સમાન ગુણવત્તા-શિક્ષણ	લક્ષ્યાંક ૪થ: આફ્ટો સામે ટકી શકે તેવી સુરક્ષિત શૈક્ષણિક સુવિધાઓ સ્થાપવી અને અપગ્રેડ કરવી.

લક્ષ્યાંક ૮ : મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચરની સ્થાપના	લક્ષ્યાંક ૮.૧: ગુણવત્તા અને વિશ્વસનીય ઈન્ફાસ્ટ્રક્ચર વિકસાવવું જે આફ્ટોસામે ટકી શકે.
લક્ષ્યાંક ૧૧: શહેરો અને માનવ-વસવાટને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ બનાવવાં.	લક્ષ્યાંક ૧૧.૫: મૃત્યુની સંખ્યા, અસરગ્રસ્તોનાં પ્રમાણ અને આફ્ટોથી આર્થિક નુકસાન ઘટાડવું.
લક્ષ્યાંક ૧૩ : હવામાનના ફેરફાર અને તેની અસરનો સામનો કરવો.	લક્ષ્યાંક ૧૩.૧: હવામાન સંબંધિત જોખમો અને કુદરતી આફ્ટો સામે પ્રતિકારકમતા અને અનુકૂળનક્ષમતા વધારવી.
લક્ષ્યાંક ૧૫: નુકસાનગ્રસ્ત જમીન સુધારવી	લક્ષ્યાંક ૧૫.૩: દુષ્કાળ અને પૂરથી અસર પામેલી જમીનને ફરી સુધારવી.

ડિસેમ્બર, ૨૦૧૫માં સહી કરવામાં આવી હતી, તે પેરિસ એંગ્રીમેન્ટ ઓન કલાઈમેટ ચેન્જમાં આફ્ટ ઘટાડવા માટે સમજણ, એક્શન અને ટેકો વધારવા માટે આઈ વિશાળ ક્રેન નક્કી કરવામાં આવ્યા હતાં. તેમાં સામેલ છે: (અ) વહેલી ચેતવણી આપવાની સિસ્ટમ, (બ) ઈમરજન્સી સામે તૈયારી, (ક) પ્રારંભિક ઘટનાઓ ધીમી કરવી, (ડ) ફરીથી સુધારી ન શકાય તેવી કાયમી નુકસાન અને ક્ષતિને લગતી ઘટનાઓ, (ઇ) સંપૂર્ણ જોખમ-મૂલ્યાંકન અને વ્યવસ્થાપન, (એફ) જો ખમ વીમાસુવિધા, આફ્ટના જોખમનું પુલિંગ, (જ) બિન-આર્થિક નુકસાન અને (એચ) સમુદ્ધાર્યો, આજીવિકા અને ઈકોસિસ્ટમ ટકાવવી

ભારત માટે પડકારો અને તકો

૨૦૧૫ના તમામ ત્રણ વૈશ્વિક કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજો સૌથી મોટો વસતી ધરાવતો દેશ, છહું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતા મોટા અર્થતંત્ર હોવાના નાતે ભારતમાં વિશ્વમાં સૌથી વધારે ગરીબ, કુપોષણથી પીડાતાં બાળકો અને પુખ્ખ વયના નિરક્ષર લોકો પણ છે, તેથી વૈશ્વિક લક્ષ્યાંક અને હેતુઓ સિદ્ધ કરવામાં તથા ટકાઉ વિકસ અને આફ્ટ સામે લડતમાં ભારત મુખ્ય સ્થાન પણ ધરાવે છે.

ભારતે વિવિધ સ્તરે કાનૂની અને સંસ્થાકીય મિકેનિઝમ લાગુ કર્યું છે અને આફ્ટના જોખમના વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિકલ ક્ષમતા મેળવી છે, જે જીવનના નુકસાન પર સ્પષ્ટ અસર

પાડે છે. તાજેતરમાં ચકવાતની મોટી આફ્ટો (સાઈક્લોન ફેઇલિન અને હૂડુડૂડ) વખતે તે સાબિત થયું હતું. જોકે હાઈડ્રોલોજિકલ આફ્ટો જેમકે પૂર અથવા વાદળ ફાટવાની ઘટના (ઉત્તરાખંડ, શ્રીનગર અને ચેનાઈ) અથવા જિયોલોજિકલ આફ્ટો જેમ કે જમીન ધર્સી પડવી (મેલિન અને ઉત્તર સિક્કમ) માં આવાં પરિણામ જોવા મળ્યાં ન હતાં. ટેક્નોલોજિકલ આફ્ટો જેમકે ઔદ્યોગિક અથવા રોડ, અક્સમાતોમાં વધારો થયો છે. બાયોલોજિકલ આફ્ટો જેમ કે રોગચાળા અને ગંભીર બીમારીના ફેલાવાનો ખતરો જણું બેચેનું છે. પર્યવરણીય આફ્ટો જેમ કે ઝડપથી વૃદ્ધિ કરતા શહેરી વિસ્તારોમાં પાણીના ખોતમાં ઘટાડો થવો અને વાયુપ્રદૂષણમાં વધારો થવો એ મુખ્ય ચિંતાનાં કારણો છે. કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભૂકૂપ બાદ ભૂકૂપના જોખમના વ્યવસ્થાપનમાં ભારતની ક્ષમતાનું હજુ સુધી પરીક્ષણ થયું નથી અને નિષ્ણાતોએ ચેતવણી આપી છેકે ગીય વસતી ધરાવતા શહેરી વિસ્તારોમાં મોટો ભૂકૂપ ત્રાટકશે, તો તેની ભયાનક અસર પડશે.

ભારત પાસે વૈજ્ઞાનિક તથા પરંપરાગત જ્ઞાનનો સારો એવો ખજાનો છે તથા આફ્ટના જોખમની કુદરતી અને એન્થ્રોપોલેજિક પ્રક્રિયાની ઘણી સમજણ છે, પરંતુ તેનાથી હંમેશાં સામાજિક અને આર્થિક વિકસ, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણમાં મદદ મળતી નથી. આફ્ટના જોખમને ટાળવા માટેના પ્રોજેક્ટનાં પરિણામ મહત્વમાં ફાયદાકારક હોતાં નથી અને કેટલીક વખત આ પ્રોજેક્ટથી

પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આફ્ટનાં નવાં જોખમ પેદા થાય છે અથવા વર્તમાન આફ્ટનાં જોખમો વધારે ઉત્ત્ર બને છે.

ભારતે ઝડપી આર્થિક વૃદ્ધિનો માર્ગ પકડું છે, જે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી કેટલીક પહેલ જેમ કે મેક ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટસિટી મિશન વગેરેથી આગળ વધવાની શક્યતા છે. કદાચ એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે આગામી દોઢ દાયકમાં ભારતમાં સામાજિક અને આર્થિક વિકસમાં જાહેર અને ખાનગી રોકાણ છેલ્લાં ચાર કે પાંચ દાયકમાં કરવામાં આવેલા રોકાણ કરતા અનેક ગણું વધારે હોશ. તેના કારણે વિવિધ સેક્ટરમાં વિકસ-પ્રોજેક્ટના પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને અમલીકરણ માટે તક પૂરી પાડવામાં આવે છે, જેનાથી જોખમ વધે નહીં, પરંતુ આફ્ટના જોખમને ટાળવાની પ્રક્રિયામાં મદદ મળે.


વિકસના દરેક પાસામાં આફ્ટના જોખમને ઘટાડવાનો સમાવેશ એજન્ડા તરીકે કરવામાં આવ્યો છે અને કેટલાંક સમયથી તે ડિઝાસ્ટર મેનેજમેન્ટના એજન્ડાનો હિસ્સો છે. પરંતુ આ દિશામાં બહુ સિદ્ધ મળી નથી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મેન્ઝનસ્ટ્રીમિંગ વિશે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા રચી નથી તેમ જ કેન્દ્ર કે રાજ્ય સરકારના સેક્ટર મુજબ મંત્રાલયોએ અથવા વિભાગોએ પોતપોતાના સેક્ટરમાં આફ્ટોનો સામનો કરવા માટે કોઈ નક્કર યોજના ઘરી નથી. ટકાઉ વિકસ લક્ષ્યાંક અને પેરિસ કલાઈમેટ એંગ્રીમેન્ટ સાથે સેન્ટાઈ ફેમવર્કને સાથે મળીને લાગુ કરવાથી ભારતમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટના અત્યાર સુધી ઉપેક્ષિત પરંતુ પડકારજનક એવા કાર્ય માટે તક મળે છે.

લેખક એન્ડિએમએના સેકેટરી, એનાયારીએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સાર્કિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના સ્થાપક ડિરેક્ટર અને સેન્ટ્રલ ઈમરજન્સી રિસ્પોન્સ ફંડ પર યુએન સેકેટરી જનરલના સલાહકાર જૂથના સભ્ય છે.

(E-mail:dharc@nic.in)

આપણિ વ્યવસ્થાપન : તાલીમ અને ક્ષમતાનિર્માણ

શ્રી આર.કે. જૈન અને ડૉ. થીરુહુંગાજ



ક્ષમતાનિર્માણ એ માત્ર એક જ વખત હાથ ધરવાની પ્રવૃત્તિ નથી. તે એક સતત પ્રક્રિયા છે. જોખમો ગતિશીલ હોવાથી ક્ષમતાનિર્માણની કામગીરી પણ બદલતી અને બહેતર બનવી જોઈએ. અગાઉ દર્શાવ્યા મુજબ આ માટે તમામ લાભાર્થીઓની જવાબદારી રહે છે. તમામ લાભાર્થીઓનાં લાંબા ગાળાના ક્ષમતાનિર્માણ માટે સાતત્યપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરાવી જોઈએ. દેશમાં વિવિધ સંસ્થાઓ વચ્ચે ક્ષમતાનિર્માણ અંગે આંતરિક અને બાહ્ય નેટવર્ક સ્થપાય તે પણ આવશ્યક છે. કાર્યક્રમો, પ્રોજેક્ટ્સ અને ક્ષમતાનિર્માણની તાલીમોનું સતત મૂલ્યાંકન કરીને તેમને યોગ્ય અને સુસંગત બનાવવી જોઈએ. કાર્યક્રમોનાં પરિણામો અને તેની અસરોનું આકલન કરી દસ્તાવેજકરણ કરવું જોઈએ. લાયિક તેટા એકત્ર કરવો જોઈએ અને અહેવાલ તૈયાર કરવાના હેતુથી તેનું વગીકરણ કરવું જોઈએ તેમજ તેમાં ગુણવત્તા સ્થપાય તેની સતત ખાત્રી રાખવી જોઈએ. જે નિર્દેશકો તૈયાર થાય તેમાં જ્ઞાન, અભિગમ અને લાભાર્થીઓએ હાથ ધરવાની પ્રવૃત્તિનો સમાવેશ થવો જોઈએ.

ક્ષ

મતાની વ્યાખ્યા એવી થાય છે કે વ્યક્તિઓ, સંસ્થાઓ, સરકારો અને સમુદ્યોની નિશ્ચિત જોખમોને વિવિધ સ્તરે પહોંચી વળવાની ટેકનિકલ, નાણાંકીય અને વહીવટી ક્ષમતાઓ જરૂરી બને છે. આ ફેમવર્કમાં ક્ષમતા મજબૂત બનાવવાની તથા જોખમ ઘટાડવાનાં પગલાંના અમલની વાત કરાઈ છે. ક્ષમતાનિર્માણમાં સામાન્યપણે એક એવી પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે અંદરથી ગતિશીલ બને છે અને પ્રવર્તમાન ક્ષમતા અસ્ક્યામતોથી શરાંસ્ત કરે છે. (UNDP n.d.) સેન્ડાઇઝ ફેમવર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મહિલાઓના ક્ષમતાનિર્માણ ઉપર અને ડિઝાસ્ટરના જોખમને અસરકારક રીતે પહોંચી વળવાની ક્ષમતાનો ઉલ્લેખ કરાયો છે. જોખમ ઘટાડવા માટે તથા વિકાસના સાતત્યપૂર્ણ ધ્યેય (SDGs)ને હાંસલ કરવા માટે પણ ક્ષમતાનિર્માણ આવશ્યક છે.

સરળ શબ્દોમાં કહીએ તો જો ક્ષમતા એ ક્ષમતાવિકાસનું આયોજન કરીને તે હાંસલ કરવાની તેમજ ક્ષમતાનિર્માણની કામગીરી (યુએનડિપી) હોય, તો ક્ષમતાવિકાસમાં સંસ્થાઓ, મિકેનિઝમ્સ અને ક્ષમતાના તમામ લાભાર્થીઓને તમામ સ્તરે આવરી લઈ મજબૂત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજ ફોર ડિઝાસ્ટર રિસ્કશન (UNISDR) ક્ષમતાનિર્માણની ડિઆરઆર (ડિઝાસ્ટર રિસ્કરિડફ્શન) માટે નીચે મુજબ વ્યાખ્યા કરે છે:

એક એવી પ્રક્રિયા કે જેના વડે લોકો સંસ્થાઓ અને સમાજ પદ્ધતિસર પોતાની ક્ષમતાને સતેજ કરે અને વિકસાવે તથા સમય જતાં જ્ઞાનમાં સુધારો, કૌશલ્ય, સિસ્ટમ્સ અને સંસ્થાઓનાં સામાજિક અને આર્થિક ધ્યેય વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક ક્ષમતાદાયક વાતાવરણમાં હાંસલ કરે. (યુનાઇટેડ નેશન્સ, ૨૦૦૮)

ક્ષમતાનિર્માણ એ ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવામાં રોકાણ કરતો મહત્વનું ઘટક છે.

સેન્ડાઇઝ ફેમવર્ક ભારપૂર્વક જગ્યાવે છે કે ડિઝાસ્ટર રિસ્કમેનેજમેન્ટના ક્ષેત્રમાં, સંસ્થાઓ, સરકારો અને સમુદ્યોની નિશ્ચિત જોખમોને વિવિધ સ્તરે પહોંચી વળવાની ટેકનિકલ, નાણાંકીય અને વહીવટી ક્ષમતાઓ જરૂરી બને છે. આ ફેમવર્કમાં ક્ષમતા મજબૂત બનાવવાની તથા જોખમ ઘટાડવાનાં પગલાંના અમલની વાત કરાઈ છે. ક્ષમતાનિર્માણમાં સામાન્યપણે એક એવી પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે અંદરથી ગતિશીલ બને છે અને પ્રવર્તમાન ક્ષમતા અસ્ક્યામતોથી શરાંસ્ત કરે છે. (UNDP n.d.) સેન્ડાઇઝ ફેમવર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મહિલાઓના ક્ષમતાનિર્માણ ઉપર અને ડિઝાસ્ટરના જોખમને અસરકારક રીતે પહોંચી વળવાની ક્ષમતાનો ઉલ્લેખ કરાયો છે. જોખમ ઘટાડવા માટે તથા વિકાસના સાતત્યપૂર્ણ ધ્યેય (SDGs)ને હાંસલ કરવા માટે પણ ક્ષમતાનિર્માણ આવશ્યક છે.

ક્ષમતાનિર્માણના પ્રકારો અને સત્તર

ક્ષમતાનિર્માણના ત્રણ સત્તર છે, જેમાં વ્યક્તિગત, સંસ્થાકીય અને યોગ્ય વાતાવરણ પેદા કરવાનો સમાવેશ થાય છે. યોગ્ય વાતાવરણ ઊભું કરવાના સ્તરે નીતિઓ, કાયદા, સંસ્થાકીય વ્યવસ્થાઓ, નેતૃત્વ, રાજકીય પ્રક્રિયાઓ, સત્તા સાથેના સંબંધો અને સામાજિક ધોરણોને ધ્યાનમાં લેવાં પડે છે. ક્ષમતાના સંસ્થાકીય સત્તરમાં આંતરિક નીતિઓ, પ્રણાલીઓ અને વ્યૂહરચનાઓ, વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ અને સંસ્થાના

સંચાલનમાં તથા તેનાં ધ્યેયો પાર પાડવામાં વ્યક્તિગત ક્ષમતાઓને સાંકળીને સાથે મળી ધ્યેય હાંસલ કરવાનો સમાવેશ થાય છે. વ્યક્તિગત સ્તરમાં લોકો, સમુદાયો અને જૂથોમાં પૂરેલાં કૌશલ્ય અને જ્ઞાનનો તથા ટીમ્સનો સમાવેશ થાય છે.

ક્ષમતા વધારવાના બે પ્રકારો છે - કાર્યલક્ષી અને ટેક્નિકલ. કાર્યલક્ષી ક્ષમતાઓની જરૂરિયાત નીતિઓ, વ્યૂહરચનાઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સના ઘડતર, અમલીકરણ અને સમીક્ષા એવો થાય છે. (UNDP 2008) ટેક્નિકલ ક્ષમતાઓ, ખાસ કરીને જરૂરિયાતના ક્ષેત્રો અને થીમની ચોક્કસ ક્ષેત્રની જરૂરિયાત આધારિત હોય છે.

અહીં માત્ર માનવસંસાધન વિકાસ ઉપર ભાર મુકાયો નથી, પણ જોખમ ઘટાડવાની આવશ્યક માળખાગત સુવિધાઓ તથા સંસ્થાકીય ક્ષમતા અને ઉપર ભાર મુકાયો છે, અને આથી ક્ષમતાનિર્માણ માત્ર રાજ્યની જવાબદારી બનતી નથી. સેનાઠ ફેમવર્ક જણાવે છે તે મુજબ આપણે સમગ્ર સમાજને આવરી લેતો અભિગમ અપનાવવાનો છે. ટૂંકમાં કહીએ તો રાજ્યનાં સંગઠનો, સમુદાયો, વવસાયીઓ, નિઝાંતો, ખાનગી ક્ષેત્ર, સૈચિછક સંસ્થાઓ અને અન્ય નોનસ્ટેટ કાર્યકરોને આવરી લેવાની જરૂરિયાત દર્શાવે છે.

ડીઆરઆર (ડિઝાસ્ટર રિસ્ક રિડક્ષન) માટેની ક્ષમતાનિર્માણ માટે લાભાર્થીઓ અને ખાસ કરીને સમુદાયોને સાંકળવાની જરૂરિયાત ઊભી થાય છે. સાંકળવાની આ પ્રક્રિયા પ્રવર્તમાન ક્ષમતા, જરૂરિયાતો તથા ઊષાપોને સમજવા માટે જરૂરી બને છે. ટૂંકમાં, ક્ષમતા માટે ઔપચારિક અને અનૌપચારિક રીતે ઉપર દર્શાવિલા વિવિધ સ્તરે સંકળાવું જરૂરી બને છે. આથી ક્ષમતાનિર્માણનો કાર્યક્રમ જરૂરિયાતના

આંકલનના આધારે ઘડવો જોઈએ. વિવિધ સહયોગીઓમાં રહેલી ઊષાપો પારખ્યા પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તેમની ભૂમિકાને આધારે તાલીમ-કાર્યક્રમો વિકસાવવા જોઈએ. વર્ગાંડમાં અપાતી તાલીમ ઉપરાંત ઓન-જોબ-ટ્રેનિંગ, ઈમર્સન પ્રોગ્રામ્સ, નેટવર્કિંગ, વિનિમય કાર્યક્રમો, એકેડેમિક અભ્યાસક્રમો, અન્ય સંસ્થાઓ સાથે સંલગ્ન બાબતો, મોક કવાયતો, જોઈન્ટ ડ્રિલ્સ વગેરેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ.

ક્ષમતાનિર્માણ માટેની રાષ્ટ્રીય નીતિ અને તેનું આયોજન

ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની રાષ્ટ્રીય નીતિમાં તમામ લાભાર્થીઓની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત દર્શાવાઈ છે. નોશનલ પોલિસીમાં નોંધવામાં આવું છે કે ક્ષમતાનિર્માણમાં જોખમ રોકવા તથા તેને હલ કરવા માટે 'યોગ્ય માળખાકીય ફેમવર્ક, મેનેજમેન્ટ સિસ્ટમ્સ તથા સાધનોની ફાળવણીને કાર્યક્રમ રીતે રીતે સાંકળવાનો સમાવેશ થાય છે.' ઉપર દર્શાવિલી વિચારધારા મુજબ નોશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટપ્લાન (NDMP) ક્ષમતાનિર્માણના વિષયને ગ્રાન્ટ વ્યાપક કેટેગરીમાં તાદૃશ કરે છે : જોખમ ઘટાડવા માટે તેને રોકવું અને નિવારણ કરવું, અસરકારક તૈયારી દાખવવી તથા યોગ્ય પ્રતિભાવ આપી તેમાંથી બહેતર બનીને બહાર આવવું. તેના આયોજનમાં ક્ષમતાનિર્માણની તેમજ ક્ષમતાનિર્માણ કરવા માગતી એજન્સીની નિશ્ચિત જોખમ આધારિત જરૂરિયાતો દર્શાવવામાં આવી છે.

ભારતમાં ક્ષમતાનિર્માણ માટેની સંસ્થાકીય ગોઠવણો

ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પણ મુખ્ય ભૂમિકા ભજવવાની રહે છે. કેન્દ્ર સરકારની ભૂમિકા

સહયોગ આપવાની તથા પૂરક હોય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પદ્ધતિઓમાં તફાવત જણાય છે. દરેક રાજ્યોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી હોવા છતાં રાહતની કામગીરી મુખ્યત્વે રિલીફ કમિશનરે બજાવવાની રહે છે. ઘણાં રાજ્યોએ ડિઝાસ્ટર રિસ્પોન્સફોર્મની સ્થાપના કરી છે, છતાં ઘણાં રાજ્યો હજુ અભિનશમન અને ઈમરજન્સી રિસ્પોન્સ સર્વિસીસ ઉપર આધાર રાખે છે. અભિનશમન અને ઈમરજન્સી રિસ્પોન્સ સર્વિસીસની વ્યવસ્થામાં પણ રાજ્ય મુજબ અલગ-અલગ પરિસ્થિતિ જોવા મળે છે. મોટા ભાગનાં રાજ્યોમાં મધ્યરથ અભિનશમન અને ઈમરજન્સી રિસ્પોન્સ સર્વિસીસ હોય છે તો કેટલાંકમાં તેની વ્યવસ્થા મ્યુનિસિપલતંત્ર સંભાળે છે. તેનાં માળખાને આધારે ક્ષમતાનિર્માણ બાબતે પણ દરેક રાજ્યમાં અલગ-અલગ પરિસ્થિતિ જોવા મળે છે. ગુજરાત અને ઓડિશા જેવાં કેટલાંક રાજ્યોએ પૂર્ણ સ્તરની સંસ્થાઓ સ્થાપી છે અથવા તો તે સ્થાપવાની પ્રક્રિયામાં છે, જ્યારે બાકીનાં રાજ્યો મૂળભૂત રીતે તેમની તાલીમ-સંસ્થાઓ ઉપર આધાર રાખે છે.

રાજ્ય સરકારોને સહાયરૂપ થવા ભારત સરકારે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ક્ષમતાનિર્માણની વિવિધ કામગીરીઓ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એકંદર સંકલનની કામગીરી ગૃહ મંત્રાલય (MHA) સંભાળે છે. સલામતી અંગેની કેબિનેટ કમિટી (CCS) અને નોશનલ કાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ ઉચ્ચ સ્તરે નિર્ણય લેવા માટેની મહત્વની સમિતિઓ છે, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચસ્તરના નિર્ણયો લે છે.

વર્ષ ૨૦૦૫માં સ્થપાયેલી નોશનલ ડિઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ભારતમાં નોશનલ ડિઝસ્ટર મેનેજમેન્ટ માટેની નોડલ એજન્સી તરીકે કામ કરે છે. તેનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે. તે નીતિ, આયોજનો અને માગરિખાઓ નક્કી કરે છે. પરિસ્થિતિને વધુ કાર્યસાધક બનાવવા માટે એન્ડિએમએ દ્વારા કેટલાંક ચોક્કસ જોખમો માટેની માગરિખાઓ અને અહેવાલો બહાર પાડવામાં આવ્યા છે. એન્ડિએમપી દ્વારા પણ કેટલાંક જોખમોની ઓળખ વ્યક્ત કરીને કેટલાંક જોખમો અંગે ક્ષમતાનિર્માણનાં પગલાં ભરવામાં આવ્યાં છે.

આ બધાં ઉપરાંત એન્ડિએમએ પણ સંસ્થાઓ અને સમુદ્ધાયો માટે ક્ષમતાનિર્માણનાં કેટલાંક સીધા પગલાં હાથ ધરે છે. એન્ડિએમએ રાજ્ય સરકારોની પ્રતિભા આપવાની ક્ષમતા સુધારવા માટે મોક ડ્રિલ્સ અને સિસ્યુલેશન કવાયતો જિલ્લા, રાજ્ય અને પ્રાદેશિક સ્તરે હાથ ધરે છે. નોશનલ સાયકલોન રિઝ્લ મિરીગેશન પ્રોજેક્ટ એ દેશમાં હાથ ધરાયેલો સૌથી મોટો સાયકલોનનું જોખમ નિવારવાનો પ્રોજેક્ટ છે અને હાલમાં તે અમલીકરણ હેઠળ છે. તેનો ઉદ્દેશ સરકારોનું સશક્તિકરણ કરવાનો તો છે જે, પણ સાથે-સાથે મહદ્દ અંશે સમુદ્ધાયો અને ખાસ કરીને મહિલાઓનાં સશક્તિકરણની કામગીરી કરે છે. આ પ્રોજેક્ટને દેશમાં હાથ ધરાયેલ સૌથી મોટા સામુદ્ધાયિક ક્ષમતાનિર્માણના પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. એક વધુ મહત્વની પહેલ નોશનલ સ્કૂલ સેક્ટરી પ્રોગ્રામ છે, જેમાં બહેતર સજ્જતા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સશક્તિકરણ કરાય છે. એન્ડિએમએ અન્ય મંત્રાલયોને પણ ડિઝસ્ટર મેનેજમેન્ટના આયોજનોમાં સહાય કરે છે.

એન્ડિએમએ મુખ્યત્વે સંસ્થાઓના ક્ષમતાનિર્માણની કામગીરી કરે છે, જ્યારે નોશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ડિઝસ્ટર મેનેજમેન્ટ

(એનઆઈડીએમ) પણ તાલીમની સાથે સાથે સંશોધન, દસ્તાવેજકરણ અને રાષ્ટ્રીય સ્તરે માહિતી ઉપલબ્ધ કરી દસ્તાવેજકરણનું કામ કરે છે. તે જ્ઞાન આધારિત અન્ય સંસ્થાઓ સાથે ટ્રેઇનિંગ, ડિઝસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને અન્ય લાભાર્થીઓ માટે ટ્રેનિંગના કાર્યક્રમોનું આયોજન કરે છે. એનઆઈડીએમ ડિઝસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ બનવા માટે પ્રયત્નશીલ છે. તે ડિઝસ્ટર મેનેજમેન્ટ માટેના નોશનલ તાલીમ કાર્યક્રમના વિકાસ તથા અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. નોશનલ ડિઝસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન્ડિઆરએફ) એ એક નોશનલ લેવલનો પ્રોફેશનલ અને સર્વે એન્ડ રેસ્ક્યુ ફોર્સ છે. તે પણ તાલીમ કાર્યક્રમ સાથે સંકળાયેલી સંસ્થા છે. એન્ડિઆરએફ માત્ર સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફોર્સિસને જ નહીં, પણ વિવિધ સમુદ્ધાયોને પણ તાલીમ આપે છે. ઉપર દર્શાવેલી એજન્સીઓ ઉપરાંત લાલબહાદુર શાસ્ત્રી નોશનલ એકેડેમી ઓફ એડ્મિનિસ્ટ્રેશન, ઇન્ડિયન પોલિસ એકેડેમી અને રાષ્ટ્રીય સ્તરની અન્ય સંસ્થાઓ પણ ડિઝસ્ટર મેનેજમેન્ટનાં વિવિધ પાસાં અંગે તાલીમ આપે છે.

અગાઉ દર્શાવ્યા મુજબ ઘણી સંસ્થાઓ રાજ્ય સ્તરે તાલીમ અને ક્ષમતાનિર્માણની કામગીરી કરે છે. રાજ્યોની ડિઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ડિઝસ્ટર મેનેજમેન્ટ સેલ, તમામ વહિવટી તાલીમ સંસ્થાઓ, પોલીસ એકેડેમી, ગ્રામ વિકાસની રાજ્યકષણી સંસ્થાઓ અને ઇન્સ્ટિટ્યુટ્યુન્નોફ લોકલ સેલ ગવર્નર્મેન્ટ્સ પણ ડિઝસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ પૂરી પાડે છે. આ તાલીમ-કાર્યક્રમોમાં જિલ્લાઓ, મ્યુનિસિપાલિટીઓ અને પંચાયતો જેવા સરકારનાં ક્ષેત્રોની નીચેના સ્તરે ક્ષમતાનિર્માણનું કામ કરે છે અને ખાસ કરીને ઇમજર્ન્સી રિસ્પોન્સની કામગીરી સાથે સંકળાયેલા ઓફિસરો તથા કર્મચારીઓને ડિઝસ્ટર

મેનેજમેન્ટની તાલીમ આપે છે.

આગણો માર્ગ

ડિઝસ્ટર મેનેજમેન્ટ માનવ જાત જેટલું જ જૂનું છે. માનવજાતનો ઈતિહાસ એ ડિઝસ્ટરને પહોંચી વળવાનો કે તેમાં નિષ્ફળ જવાનો ઈતિહાસ દર્શાવે છે. માત્ર ૨૦૧૫ના વર્ષમાં જ ઉદ્ઘાટન નોંધાયા હતા, જેમાં ૨૨,૭૭૩ લોકોનાં મોત થયાં હતાં અને ૮,૮૬ કરોડ લોકોને માઠી અસર થઈ હતી. આ કિસાઓમાં અંદાજે કુલ ૬૬.૫ અબજ ડોલર જેટલું નુકસાન થયાનો અંદાજ છે (સીઆરડી ૨૦૧૬). ડિઝસ્ટરને કારણે થતા મૃત્યુનો આંક ઘટતો જતો હોવા છતાં આર્થિક ખોટ વધતી જાય છે. આવું થવાનાં શહેરીકરણ, જોખમી વિસ્તારોમાં નિવાસ, ટેક્નોલોજી ઉપર નિર્ભર જીવન, ડિઝસ્ટરની સીધી અસર નહીં ધરાવતા વિસ્તારોમાં ગૌણ આર્થિક પ્રત્યાઘાતો, જલવાયુ પરિવર્તનની અસરો અને વધતી જતી વસતિ જેવાં કેટલાંક કારણો છે. (COPPOLA 2015) આથી ડિઝસ્ટર મેનેજમેન્ટ બાબતે ખાસ કરીને લાંબા ગાળાનાં જોખમો ઘટાડવા માટે તમામ લાભાર્થીઓનું તમામ પાસાંઓમાં ક્ષમતાનિર્માણ થાય તે જરૂરી છે.

જોખમ-નિવારણ હંમેશાં સ્થાનિક સ્તરે થતું હોય છે. સરકારને લગતાં જોખમ અટકાવવાના અને નિવારવાનાં પગલાંઓમાં જમીનના ઉપયોગનું આયોજન, ટાઉન ડેવલપમેન્ટ, બાંધકામમાં સલામતી અને બિટિંગા કોડ અમલમાં મૂકવાની કામગીરી લોકલ સેલ્સ ગવર્નર્મેન્ટની રહે છે. કટોકટીના સમયમાં જાહેર સંસ્થાઓમાં તે સૌપ્રથમ પ્રતિભાવ આપે છે. આ કારણે તેમનું માનવ સંસાધન, સાધનો અને તાલીમ બાબતે સશક્તિકરણ થાય તે આવશ્યક છે. લોકલ સેલ્સ ગવર્નર્મેન્ટની સંસ્થાઓનું સશક્તિકરણ થાય તે પણ જરૂરી છે. પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ (યુઅલબી)ના

અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓને એ પ્રકારે તાલીમ આપવી જોઈએ કે તે કટોકટીના સમયમાં સક્ષમ રીતે કામગીરી હાથ ધરી શકે અને ડિઝાસ્ટર અંગે સજ્જતા દાખવી શકે. જે કોઈ ચેતવણીઓ આપાઈ હોય તેનો યોગ્ય ઉપયોગ કરી સર્ચ, બચાવ, રાહત અને તબીબી-સહાયની કામગીરી ગોઠવી જોખમનું આકલન કરી શકે. તેમને ડિઝાસ્ટર પછીના પુનઃવસનની જરૂરિયાતો અંગે પણ સબજ સમજ હોવી જોઈ. સ્થાનિક નેતૃત્વ તમામ સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ક્ષમતાનિર્માણનો ઉદ્દેશ સ્થાનિક સંસ્થાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં તમામ પાસાંઓમાં સજ્જતા વધારવાનો ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની કામગીરીના મુખ્ય પ્રવાહમાં રહેવાનું અને ડિઝાસ્ટર રોકવા તથા ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાનાં પગલાંની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. (એનીએમપી ૨૦૧૬)

નેશનલ ખાનમાં સમુદાયોને તાલીમ આપવા બાબતે પણ ભારપૂરક કહેવાયું છે. આવા સમુદાયો ડિઝાસ્ટર અંગે સૌપ્રથમ પ્રતિભાવ આપતાં હોવાથી તેમની ક્ષમતા વધારવી જરૂરી છે અને આ બાબત ક્ષમતાનિર્માણની પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે. સેન્ટાઇફિન્ફર્મ્સમાં નોંધવામાં આવ્યું છે કે નાગરિક સમાજ, સમુદાયો અને ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા કામ કરતા સ્વયં સેવકોમાં જ્ઞાનનું નિર્માણ કરવું જરૂરી છે. ક્ષમતાનિર્માણમાં જ્ઞગૃહિત, સંવેદના, કાર્ય પ્રેરણા તથા સમુદાયોમાં તથા સમુદાયના નેતાઓમાં કૌશલ્ય વિકાસની જરૂર છે. નેશનલ ખાનમાં ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા અંગે ક્ષમતાનિર્માણના ક્ષેત્રો અને એજન્સીઓ નિર્ધારિત કરાયાં છે. આ માટે વહેલી ચેતવણી, પ્રચાર અને ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર તથા જોખમ સમયે વહીવરી કામગીરી મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

તમામ પ્રકારનાં ડિઝાસ્ટરસમાં તમામ

સ્તરે સર્ચ અને બચાવક્ષમતા વધારવા સરકાર સ્વૈચ્છિક ફાયર અને રેસ્કયુ સર્વિસ માટે સ્વયં સેવકો તૈયાર કરી શકે છે. પશ્ચિમના દેશોમાં સ્વૈચ્છિક ફાયર-સર્વિસીસનાં કેટલાંક મોડેલ્સ ઉપલબ્ધ છે. કેટલાંક રાજ્યોએ પૂરમાં બચાવની કામગીરી માટે સ્વયંસેવકોને તાલીમ આપવાની શરૂઆત કરી છે. એનીએમએ દ્વારા પણ પૂરમાં બચાવ માટે સ્વયંસેવકોની તાલીમની નવી યોજના હાથ ધરાઈ છે. આ ઉપરાંત ખાનગી મેડિકલ પ્રેક્ટિશનર્સ અને ઓન્જિનિર્સ જેવા ખાનગી વર્ગોને અનુકૂળ મેડિકલ રિસ્પોન્સ અને ડિઝાસ્ટરનો સામનો કરી શકે તેવા બાંધકામ માટે તાલીમ આપવી જોઈ એ. ખાનગી સંસ્થાઓનું પણ ક્ષમતાનિર્માણ થવું જોઈ એ, કે જેથી તે આસપાસના સમુદાયોને જરૂરિયાતના સમયે સહાયરૂપ બની શકે. ઈમર્જન્સી રિસ્પોન્સ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકસમાજને તાલીમ આપવી જોઈ એ, જેથી તે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટવિકાસમાં સહાયરૂપ બની શકે.

લોકલ સેલ્ક-ગવર્નમેન્ટની સંસ્થાઓને ફાયર રેસ્કયુ સર્વિસીસ માટે પૂરતું ક્ષમતાનિર્માણ થઈ શકે તે માટે માનવ સંસાધનો અને સાધનો પૂરાં પાડવાં જોઈ એ.

ઉપસંહાર

ક્ષમતાનિર્માણ એ માત્ર એક જ વખત હાથ ધરવાની પ્રવૃત્તિ નથી. તે એક સતત પ્રક્રિયા છે. જોખમો ગતિશીલ હોવાથી ક્ષમતાનિર્માણની કામગીરી પણ બદલાતી અને બહેતર બનવી જોઈ એ. અગાઉ દર્શાવ્યા મુજબ આ માટે તમામ લાભાર્થીઓની જવાબદારી રહે છે. તમામ લાભાર્થીઓના લાંબા ગાળાના ક્ષમતાનિર્માણ માટે સાતત્યપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરાવી જોઈ એ. દેશમાં વિવિધ સંસ્થાઓ વચ્ચે ક્ષમતાનિર્માણ અંગે આંતરિક અને બાહ્ય નેટવર્ક સ્થપાય તે પણ આવશ્યક છે. કાર્યક્રમો, પ્રોજેક્ટ્સ અને ક્ષમતાનિર્માણની તાલીમોનું સતત મૂલ્યાંકન

કરીને તેમને યોગ્ય અને સુસંગત બનાવવી જોઈ એ. કાર્યક્રમોનાં પરિણામો અને તેની અસરોનું આકલન કરી દસ્તાવેજકરણ કરવું જોઈ એ. લક્ષ્યિત ડેટા એકત્ર કરવો જોઈ એ અને અહેવાલ તૈયાર કરવાના હેતુથી તેનું વર્ગિકરણ કરવું જોઈ એ તેમજ તેમાં ગુણવત્તા સ્થપાય તેની સતત ખાત્રી રાખવી જોઈ એ. જે નિર્દેશકો તૈયાર થાય તેમાં જ્ઞાન, અભિગમ અને લાભાર્થીઓએ હાથ ધરવાની પ્રવૃત્તિનો સમાવેશ થવો જોઈ એ : કેટલાંક સંશોધનનાં તારણોમાં જણાયું છે કે ઉપરથી શરૂ કરીને નીચેની તરફ ક્ષમતાવૃદ્ધિના મોડેલને અનુસરવું જોઈ એ. આથી ભવિષ્યમાં ક્ષમતાનિર્માણના પ્રયાસો આ સંદર્ભમાં માંગ આધ્યારિત તથા સમુદાયો અંગેની સમજ આધ્યારિત હોવા જોઈ એ. આવા પ્રયાસોમાં સહભાગીદારી અને સશક્તિકરણ દ્વારા જોખમ ઘટાડવાના સાતત્યપૂર્ણ પ્રયાસો થવા જોઈ એ. સેન્ટાઇફિ ફેન્વર્કમાં ભારપૂરક જણાવ્યા મુજબ મહિલાઓની ક્ષમતા વિકસાવવા માટેના પ્રયાસો થવા જોઈ એ અને દયનિય સ્થિતિ ધરાવતી વસ્તિમાં પણ ક્ષમતાનિર્માણ દ્વારા સામાજિક સમાવેશિત હાંસલ થવી જોઈ એ. આ રીતે સમયસર અને યોગ્ય ક્ષમતાનિર્માણથી ડિઝાસ્ટરનો પ્રતિકાર કરી શકે તેવી ક્ષમતા ઉભી થશે.

આર કે જૈન એનીએમએના સભ્ય છે અને ભારત સરકારના સચિવ સહિત વિવિધ વરિષ્ઠ હોદા પર કામ કરી ચુક્યાં છે.

(E-mail: secretary@ndma.gov.in)

ડૉ. થીરુંગાજ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદ - રાષ્ટ્રીય પુનર્નિર્માણ સત્તામંડળના વરિષ્ઠ સલાહકાર છે. તેઓ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જીએસીએમએ)ના અગાઉ સંયુક્ત સીઈઓ હતા. તેઓ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સલાહકાર તરીકે કામ કરી ચુક્યાં છે.

કેમિકલ ઉદ્યોગમાં આપત્તિઓ

કારણો, નિવારણ અને રાહત-બચાવનાં પગલાં

એમ.સૂરીયાનારાયણન



કેમિકલ ઉદ્યોગમાં મોટી આપત્તિઓ-અકસ્માતો એના વિકાસને ખોરવી નાંથે છે અને આ આપત્તિઓ અટકાવી શકાય એવી છે. કેમિકલ આપત્તિઓ ખાના/પ્રોસેસના જીવનચકના ગમે તે તબક્કે અને ચાલુ કરવા સમયે, સ્ટોરેજ દરમિયાન, મેન્યુફર્કચરિંગ, મેઇન્ટેનાન્સ, નિકાલ-સાફ્ટસૂફી અને ફેરફાર દરમિયાન સર્જાઈ શકે છે. જોખમી કેમિકલ્સને નિયંત્રણમાં રાખતી સામગ્રી ખૂટી પડવાથી, આગ, ઘડાકા ઝેરી ગેસ વગેરેનો ફેલાવો અથવા આ તમામ જોખમો ઊભાં થઈ શકે છે. કેમિકલ ઉદ્યોગોની આસપાસ વસ્તીની ગીયતા તથા વધુ ને વધુ રહેણાકોની કોલોનીઓ ઊભી થવાની પરિસ્થિતિમાં જો કોઈ ખાનામાં મોટી દુર્ઘટના સર્જાય, તો આજુબાજુની વસ્તી તથા વાતાવરણ-પર્યાવરણ માટે મોટું જોખમ ફેલાઈ શકે છે. આગ અને ઘડાકાના જોખમ ઉપરાંત ઝેરી કેમિકલ્સ હવામાં ફેલાતાં જેને દૂરસ્ત ન કરી શકાય એવું નુકસાન થઈ શકે છે, જેને લીધે લોકોને તથા પર્યાવરણને લાંબા ગાળા સુધી સહેવું પડે છે.

મુ

રતીય કેમિકલ ઉદ્યોગ છેલ્લાં પાંચ વર્ષમાં એના ઉત્પાદન અને એની વિકાસની સંભાવનાના જોરે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જરીપીમાં ૨.૧૧ ટકાનો ફાળો આપ્યો છે અને વિદેશમાંથી ૧૦.૪૮ અબજ ડોલરનું સીધું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે. એક અંદાજ મુજબ, ભારતીય કેમિકલ ઉદ્યોગ વાર્ષિક ૧૧ ટકાના દરે વૃદ્ધિ પામશે અને ૨૦૨૦ સુધીમાં એનું મૂલ્ય ૧૫૪ અબજ ડોલર ઉપર પહોંચશે. ગમે એમ પણ કેમિકલ ઉદ્યોગમાં મોટી આપત્તિઓ-અકસ્માતો એના વિકાસને ખોરવી નાંથે છે અને આ આપત્તિઓ અટકાવી શકાય એવી છે. કેમિકલ આપત્તિઓ ખાના/પ્રોસેસના જીવનચકના ગમે તે તબક્કે અને ચાલુ કરવા સમયે, સ્ટોરેજ દરમિયાન, મેન્યુફર્કચરિંગ, મેઇન્ટેનાન્સ, નિકાલ-સાફ્ટસૂફી અને ફેરફાર દરમિયાન સર્જાઈ શકે છે. જોખમી કેમિકલ્સને નિયંત્રણમાં રાખતી સામગ્રી ખૂટી પડવાથી, આગ, ઘડાકા ઝેરી ગેસ વગેરેનો ફેલાવો અથવા આ તમામ જોખમો ઊભાં થઈ શકે છે. કેમિકલ ઉદ્યોગોની આસપાસ વસ્તીની ગીયતા તથા વધુ ને વધુ રહેણાકોની કોલોનીઓ ઊભી થવાની પરિસ્થિતિમાં જો કોઈ ખાનામાં મોટી દુર્ઘટના સર્જાય, તો આજુબાજુની વસ્તી તથા વાતાવરણ-પર્યાવરણ માટે મોટું જોખમ ફેલાઈ શકે છે. આગ અને ઘડાકાના જોખમ ઉપરાંત ઝેરી કેમિકલ્સ હવામાં ફેલાતાં જેને દૂરસ્ત ન કરી શકાય એવું નુકસાન થઈ શકે છે, જેને લીધે લોકોને તથા પર્યાવરણને લાંબા ગાળા સુધી સહેવું પડે છે.

દૂરસ્ત ન કરી શકાય એવું નુકસાન થઈ શકે છે, જેને લીધે લોકોને તથા પર્યાવરણને લાંબા ગાળા સુધી સહેવું પડે છે.

દેટાબેઝનો અભાવ

પણ્ણીમની સરખામણીએ ભારતમાં એક મોટી ઉણપ, અકસ્માતો અંગે તપાસ કરનારી એજન્સીઓ તેમજ માત્ર કેમિકલ અકસ્માતોના ડેટાબેઝનો અભાવ છે. આવો ડેટા ભૂતકાળ ઉપરથી પદાર્થપાઠ લેવામાં, અકસ્માતોના મૂળ કારણોની તપાસ કરવામાં તથા અકસ્માતોનું પુનરાવર્તન નિવારવામાં ખૂબ જ ઉપયોગી બને છે. કેમિકલ અકસ્માતો-આપત્તિઓ સામાન્ય રીતે ઘણી બધી નિષાયિક બાબતોની નિષ્ફળતાને પરિણામે સર્જાય છે અને કઈ નિષાયિક બાબતો-પરિબળોને કારણે છેવટે આપત્તિ સર્જાઈ હતી, એ સમજવું ખૂબજ જરૂરી છે.

કેમિકલ આપત્તિઓના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રાલય મુખ્ય ચાવીરૂપ મંત્રાલય છે અને રાષ્ટ્રીય આપત્તિ-વ્યવસ્થાપન સત્તાતંત્ર-નોશનાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-ટૂકમાં એન્ટીએમઓર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માટેની યોજનાઓ ઘડવા માટે, મંત્રાલયો, વિભાગો અને સરકારી સત્તાવાળાઓ માટે માર્ગદર્શિકા - ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી છે ભોપાળની ૧૯૮૪ની ભયાનક ગેસ દુર્ઘટના પછી ઉદ્યોગમાં સલામતીની જાળવણી સંબંધમાં સરકારના અભિગમમાં ઉદાહરણ

રૂપ બદલાવ આવ્યો છે અને પરિસ્થિતિનો માત્ર પ્રતિકાર કરવાના સ્થાને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી સલામતી સુનિશ્ચિત કરવાનું વલણ અપનાવાયું છે. આ લેખનો ઉદ્દેશ લોકો-વાચકો, ડેમિકલ આપત્તિઓ માટેનાં કારણરૂપ પરિબળો સમજે, એને કેવી રીતે અટકાવી શકાય એ જાણે અને જો ડેમિકલ આપત્તિ સર્જય, તો એવા સમયે લેવાનાં જરૂરી પગલાં વિશે સમજ કેળવે એ જોવાનો છે.

કારણરૂપ પરિબળો

ભારતીય ડેમિકલ ઉદ્યોગમાંના જૂનાં, સમયમર્યાદા વટાવી ચૂકેલા પ્રોસેસિંગ પ્લાન્ટ તથા આધુનિક ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા માટેનાં પૂરતાં પગલાંના અભાવને કારણે ડેમિકલ એકમોમાં આપત્તિ અક્સમાતોની સંભાવના વધી છે. ડેમિકલ ઉદ્યોગમાં વિવિધ સાધનસામગ્રીની હેરફેર, સંગ્રહ તથા પ્રોસેસિંગ દરમિયાન સંખ્યાબંધ કારણો, જેવાં કે, ઉષ્ણતાપમાન અને દબાણમાં અનિયંત્રિત વધઘટ, પ્રોસેસિંગમાં ક્ષતિ, ઉતાવળી પ્રતિક્રિયા, વિરોધી સામગ્રીનું ભિશણ, રિએક્ટર, સંગ્રહનાં સાધનો, પાઈપલાઇન વગેરેમાં ભયજનક ભંગાણ, લીકેજ, હાર્ડવેર સિસ્ટમની નિષ્ફળતા, રિએક્ટર વેન્ટની અયોગ્ય ડિઝાઇન, પ્રોસેસિંગનાં જોખમોતું અપૂરતું પૃથક્કરણ વગેરેને પરિણામે આગ, ઘડાકો ઝેરી ગેસ વગેરેનો હવામાં ફેલાવો થવો વગેરે જેવી દુર્ઘટનાઓ થઈ શકે છે.

ડેમિકલ ઉદ્યોગમાં આગ અને ઘડાકાનું સૌથી સામાન્ય મૂળ સેન્ટ્રીય સોલવન્ટ છે. આગ અને ઘડાકા વચ્ચેનો મુખ્ય તફાવત એનો વેગ - એમાંથી બહાર નીકળતી ઊર્જાનું પ્રમાણ છે. આગના સંજોગોમાં વિનાશક ઊર્જા-વેગ ધીમે-ધીમે હવામાં પ્રસરે છે, જ્યારે ઘડાકાના કિસ્સામાં ઊર્જા ખૂબ જ ઝડપથી-માઈકોસેકન્ડમાં બહાર ફેલાઈ જાય છે. આગ

ક્યારેક ઘડાકાને કારણે લાગી શકે છે અને ક્યારેક આગને કારણે ઘડાકા પણ થઈ શકે છે. ઘડાકાની તીવ્રતાનો આધાર દબાણમાં વધઘટ ઉપર તથા ‘શોકવેવ’ ઉપર રહેલો છે અને એનું વગ્ગાકરણ ‘ડિટોનેશન’ અથવા ‘ડિફેનેગરેશન’ તરીકે થાય છે. સીમિત વિસ્તારમાંના ઘડાકા સંબંધિત મકાનમાંના રહીશેને ઈજા પહોંચાડે છે અને ભારે નુકસાન સર્જે છે, જ્યારે અસીમિત-વિશાળ વિસ્તારમાં થતા ઘડાકા સામાન્ય રીતે, હવામાં ફેલાઈ જતાં અને જવલનશીલ પદાર્થના સંપર્કમાં આવતાં પ્રજવલિત થઈ જાય એવો ગેસ કે પ્રવાહીના નિયંત્રણમાં મળેલી નિષ્ફળતાનું પરિણામ હોય છે. આને લીધે આવા ઘડાકા, જે સ્થળેથી ગેસ કે પ્રવાહીનું લીકેજ થયું હોય, ત્યાથી દૂરના વિસ્તારમાં પણ ભારે નુકસાન કરી શકે છે અને આવા ઘડાકાને “અનકન્ફાઇન્ડ વેપર કલાઉડ” ઘડાકા કહેવામાં આવે છે, ઘન સ્વરૂપમાં ડેમિકલ્સની ધૂળ જેવી રજકણો પણ જ્યારે જવલનશીલ પદાર્થના સંપર્કમાં આવે છે, ત્યારે એનાથી ઘડાકો થાય છે. ઘણીવાર આગ અને ઘડાકાની દુર્ઘટના સમયે, પર્યાવરણમાં ઝેરી ગેસ પણ ઠલવાય છે.

માનવીય ભૂલો

મોટા ભાગના ઔદ્યોગિક અક્સમાતો, કારખાનામાં અમલમાં હોય એવી ધોરણસરની સંચાલન કાર્યપદ્ધતિનો અમલ ન કરવાને પરિણામે થતી માનવીય ભૂલોને લીધે સર્જય છે. ‘પીપર આલ્ફા’ અક્સમાત માનવીય ભૂલ કેવી રીતે ડેમિકલ આપત્તિ સર્જે છે, એનું એક સૂચક ઉદાહરણ છે. આ અક્સમાતમાં, એક ફેલટરીમાં મેઠનેનન્સ હેઠળનો સેફ્ટી વાલ્વ વગરનો એક પંપ એક કામદારે અક્સમાતે ચાલુ કરતાં ગેસ લીક થયો હતો અને પ્રયોગ ઘડાકો થતાં મોટી આપત્તિ સર્જાઈ હતી. યંત્રો વગેરેની ડિઝાઇનમાં ખામી, પ્રોસેસ દરમિયાન ચેતવણીનો સંકેત મજ્યા છતાં ઉપાયકારક પગલાં લેવાની

પ્રમાણભૂત વ્યવસ્થાનો અભાવ તથા ફેલટરીમાં વિવિધ વિભાગો વચ્ચે નબળા સંકલનને કારણે પણ ડેમિકલ આપત્તિઓ સર્જાઈ છે. આ બધી બાબતો ઉપરાંત ત્રાસવાદી પ્રવૃત્તિઓ તથા ભાંગફોડને કારણે આપત્તિ ઊભી થવાનો ભય વધતો જાય છે. ડેમિકલ ઉદ્યોગમાં પૂર અને ભૂંક્યું જેવી કુદરતી હોનારતોથી પણ મોટી આપત્તિ ઊભી થવાના દાખલા છે.

ડેમિકલ આપત્તિમાં પરિણામનું એક અન્ય સામાન્ય કારણ, સાધન સામગ્રીની અયોગ્ય જાળવણી છે. વિવિધ સાધનસામગ્રી સરળતાથી અને સલામત રીતે કામ આવે, એ માટે એના મેન્યુઝ્કયર્સ દ્વારા થયેલી ભલામણ મુજબ નિયમિત સમયના અંતરે એની યોગ્ય સંભાળ, નિયમિત મેઠનેનન્સ આવશ્યક છે, જ્યારે કોઈ યંત્ર કે સાધનના એકાદ હિસ્સાની યોગ્ય જાળવણી નથી થતી, ત્યારે સમગ્ર યંત્રની કામગીરી કથળી જાય છે અને એથી અંતિમ સ્વરૂપે વિનાશક ઘડાકો થવાનો ભય રહે છે. ‘ફિલક્સબરો’ દુર્ઘટના યંત્ર સામગ્રીની અયોગ્ય જાળવણીના ગંભીર પરિણામનું મોંઢું ઉદાહરણ છે, જેમાં દુર્ઘટનાને કારણે ૨૮ જૂનાં માર્યા ગયાં હતાં અને બીજા ઘણા લોકોનો ઈજા થઈ હતી.

જોખમી ડેમિકલ્સ એકથી બીજા સ્થળે લઈ જવા દરમિયાન માર્ગમાં આકસ્મિક દુર્ઘટના નિવારવા માટેની ‘ઈમરજન્સી’ ટીમના અભાવને પરિણામે પણ ભારતમાં કેટલાંક સ્થળોએ મોટી આફ્તો સર્જાઈ છે. નકામા-જોખમી પદાર્થો - ઔદ્યોગિક કચરાના





પ્રોસેસિંગ તેમજ એના યોગ્ય નિકાલ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આવી કામગીરી દરમિયાન આગ લાગવાની, ઘડાકા થવાની અને પર્યાવરણમાં ઝેરી ગેસ વગેરે ફેલાવાની સંભાવના રહેલી છે.

આપત્તિ-નિવારણ અને પ્રતિસાદ

૧. ઉદ્યોગોની ભૂમિકા

કેમિકલ અક્સમાતોને લાગેવળું છે, ત્યાં સુધી અને નિવારવા અટકાવવાનો અભિગમ, અક્સમાત પછીનાં પ્રતિસાદરૂપ પગલાં કરતાં વધુ આવકાર્ય - ચઠિયાતો છે. અક્સમાત - આપત્તિ નિવારવામાં, કેમિકલ ઉદ્યોગમાં રસ-હિત ધરાવતી નીચેની તમામ સંબંધિત પાર્ટીઓની આગવી ભૂમિકા તેમજ જવાબદારી રહેલી છે.

એ. જોખમી પ્રવૃત્તિઓનો ક્યાસ કાઢવો

ઔદ્યોગિક કામકાજની સલામતીનાં પાસાં વિશેનું સારું જ્ઞાન અક્સમાતો અટકાવવામાં અને એના નિયંત્રણમાં મદદરૂપ બનશે.

ઉદ્યોગ-કારખાનામાં રોજબરોજની પ્રવૃત્તિઓ માંથી ઊભા થતાં ભય અને જોખમોનો ક્યાસ કાઢવા માટે યોગ્યતા



ધરાવતા વ્યાવસાયિકોની એક જાણકાર અને સમર્પિત એવી ટીમ આવશ્યક છે. જોખમો શોધી કાઢવાં એનો ભાગ મેળવવા માટેનાં સાધનો જેવી કે ચેકલિસ્ટ પૃથક્કરણ, સેફ્ટી ફ્લોપ ઓડિટ, એક્ટીએ ઈટીએ એફએમઈએ અને એલાઓપીએ, જોખમો ઘટાડવામાં સહાયક બનશે.

ઉપરના અત્યારસનો આધારે સલામતી-નિયંત્રણોની ક્રમવાર - મહત્વ પ્રમાણેની ગોઠવણી કેમકે જોખમી પ્રવૃત્તિઓ નાબૂદ કરવી, જોખમી, કેમિકલ્સના સ્થાને વધુ સલામત કેમિકલ્સનો ઉપયોગ જોખમ ઊભાં કરે એવી પ્રવૃત્તિ અલગ પાડવી અને એન્જિનિયરિંગ નિયંત્રણો ઊભા કરવાથી કેમિકલ આપત્તિઓને આકાર લેતી અટકાવવાનું સુનિશ્ચિત કરી શકાશે.

બ. પ્લાન્ટની યોગ્ય જાળવણી

પ્લાન્ટમાંની તમામ સાધન સામગ્રી અને મશીનરીની યોગ્ય જાળવણી મેઠન્ટેનન્સ-માટે નિયમિત સમયાંતરે પગલાં ભરવા.

પ્લાન્ટમાંની વિવિધ સગવડો સલામત છે અને બધી જ મશીનરી - સાધન સામગ્રી અપેક્ષિત રીતે કામ કરી રહી છે એ સુનિશ્ચિત કરવા પ્લાન્ટના સ્થળે સલામતી અને દુરસ્તી અંગે નિયમિત ઈન્સ્પેક્શન હાથ ધરવું જરૂરી છે.

સી. વરાળ/ગેસ ડિટેક્શન સીસ્ટમ ઊભી કરવી.

ગેસ નિકાલનું લીકેજ થાય તો એ

શોધી કાઢવા ખતરાની ધંટી - એલાર્મ વગાડતી યોગ્ય વ્યવસ્થા છેક નીચેના સ્તરથી ગોઠવવી આવશ્યક છે કે જેથી લીકેજ રોકવા વહેલી તકે પગલાં ભરી શકાય.

ડ. નિયમો અને નિયમનોનું પાલન

એક મજબૂત - ટકાઉ અને સલામત પ્રોસેસ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બહાર પાડેલાં વિવિધ નિયમો અને નિયમનોનું કડક પાલન થવું જોઈએ.

૩. માનવ-સંસાધન વ્યવસ્થાપન વિકાસ

માનવસંસાધનોનું વ્યવસ્થાપન ધારું જરૂરી છે અને આ માટે કામદારોની પ્રવૃત્તિઓનું એકધારું મોનિટરીંગ તથા વર્તણું આધારિત સલામતી વિષયક કાર્યક્રમનો અમલ કરવો જોઈએ.

કેમિકલ ઉદ્યોગમાં સલામતીની સિસ્ટમ સુધારવા માટે ટોચના અધિકારીઓની બનેલી એક મજબૂત માનવ સંસાધન વ્યવસ્થાપનટીમની રચના થવી જોઈએ.

ટોચના મેનેજમેન્ટના અધિકારીઓ અને કામદારો વચ્ચે મુક્ત વિચારવિર્મશ માટે અનુકૂળ વાતાવરણ રચવું જોઈએ કે જેથી કામદારો પ્લાન્ટમાંની ઊતરતા ધોરણની કાર્યપદ્ધતિઓ અને અન્ય જોખમો વિશે માહિતી પૂરી પાડી શકે.

એફ. તાકીદની તૈયારીઓ

આપત્તિ અંગે ખોટા પ્રચારને ડામવા માટે ઉદ્યોગમાં કંપનીમાં તાકીદનાં પગલાં ભરે એવી એક ટીમ હોવી જોઈએ.

કટોકટીભરી પરિસ્થિતિમાં ભરવાનાં પગલાં અંગે કામદારોને પૂરતા પ્રમાણમાં સાબદા રાખવા માટે વારંવાર પ્રયોગરૂપ કાર્યક્રમો - મોકફીલનું આયોજન થવું જોઈએ.

૨. સરકારની ભૂમિકા

એ. અક્સમાત તપાસબોર્ડ અને કેમિકલ અક્સમાત ટેટાબેઝની સ્થાપના

કેમિકલ આપત્તિની તપાસ કરવા અને પ્રત્યેક નાની-મોરી આકસ્મિક ઘટના ઉપરથી શીખવા મળેલા પદાર્થપાઠ આધારિત ગાઈડલાઈન્સ તૈયાર કરવા માટે અમેરિકાના કેમિકલ ઉદ્યોગમાં ર્યાતાં કેમિકલ સેફ્ટી બોર્ડની જેમ જ - એ જ લાઈન ઉપર - ભારતમાં અક્સમાત તપાસ બોર્ડની સ્થાપના કરવી જરૂરી છે. આવી વ્યવસ્થા આપત્તિનું પુનરાવર્તન રોકવામાં મદદરૂપ બનશે. આ જ પ્રકારની પહેલ, અક્સમાતોનો હેવાલ તૈયાર કરવાની સિસ્ટમ ઉભી કરવા તથા માત્ર કેમિકલ અક્સમાતોના કેસોનો ટેટાબેઝ ઊભો કરવા માટે આવશ્યક છે. ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા ઊભી થાય તો એ કેમિકલ ઉદ્યોગોને દુનિયાભરના નિષ્ણાતોની મદદથી એમની વ્યાપક સમસ્યાઓ ઉલ્લાસમાં સહાયક બનશે અને પ્લાન્ટના સંચાલન દરમિયાન કોઈ પણ અભૂતવૃત્ત પરિસ્થિતિ દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થશે.

બી. જાગૃતિ-અભિયાન

કેમિકલ આપત્તિમાંથી ઊભાં થતાં જોખમો વગેરે અંગે સરકાર કામદારોમાં તથા લોકોમાં જાગૃતિ ફેલાવી શકે. જો કામદારોને ખૂદને આપત્તિના જોખમો અંગે સારી જાણકારી હોય, તો એ એમને બિન-સલામત કામગીરી હાથ ધરતાં રોકવામાં અને જો આપત્તિ સર્જય તો એવા સંજોગોમાં એના પ્રતિકારનાં પગલાં ભરવામાં મદદરૂપ બનશે.

સી. સંશોધન અને વિકાસ

કેમિકલ ઉદ્યોગોની આડ પેદાશોમાંના ઝેરી તત્ત્વો મહત્તમ પ્રમાણમાં ઘટાડી શકે એવી નવી અધતન ટેકનોલોજી આપનાવવા સંબંધમાં સરકાર જાતેજ સંશોધન અને વિકાસની પહેલ કરી શકે. ઓછાં ઝેરી તત્ત્વો સાથેની બનાવટો તૈયાર કરવા માટે ઉત્પાદનની નવી પદ્ધતિઓ અંગેનું સંશોધન જો કોઈ અક્સમાત થાય તો એની પ્રતીકૂળ અસરોને સારા એવા પ્રમાણમાં ઘટાડી શકે.

યોજના જાન્યુઆરી-૨૦૧૭

ડી. ઓફસાઇટ ઈમરજન્સી પ્લાનિંગ

કેમિકલ ઉદ્યોગ- કારખાનાથી દૂરના અન્ય સ્થળે આપત્તિના પ્રતિકાર માટે તાકીદના પગલાંનું આયોજન એટલે કે ઓફસાઇટ ઈમરજન્સી પ્લાનિંગનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સ્થાનિક સત્તા જ્યાં આવા ઉદ્યોગો ઊભા થયા હોય એવાં સ્થળોમાં મોટા અક્સમાતના સંજોગોમાં, લોકો તથા પર્યાવરણ ઉપર એની ઓછામાં ઓછી અસર થાય, એ માટે જરૂરી પગલાં ભરી એની ફરજ બજાવે. આ માટેનું આયોજન આપણાં નિયમો અને નિયમનો અનુસાર થવું જોઈએ. જોખમો અને એનાં પરિણામો અંગે લોકોમાં જાણકારી ફેલાવવાનું ખૂબ જ મહત્વનું છે કે જેથી લોકો જોખમો ઘટાડવામાં તેમજ આપત્તિ ઊભી થવાના સંજોગોમાં એના પ્રતિકારની કામગીરીમાં એમનો ફાળો આવી શકે.

ઇ. જોખમી કેમિકલ્સની હેરફેર

જોખમી કેમિકલ્સની ફેરફાર દરમિયાન આપત્તિ સર્જય એવા સંજોગોમાં એના પ્રતિકાર માટે ઉપાયકારક પગલાં અંગે જરૂરી અને સમયસર તાકીદની મદદ મળી જાય, તો એ જોખમો ઘટાડવામાં અને આસપાસના લોકોના બચાવમાં ખૂબ જ સહાયક બને, તાજેતરમાં ઇન્ઝિન્યુન કેમિકલ કાઉન્સિલે “નાઈસરગલોબ” (નાઈસરગલોબ ઇન) નામનો એક કાર્યક્રમ શરૂ કર્યા છે. જેમાં, જોખમી કેમિકલ્સની હેરફેર કરતી ટ્રૂકોને એ કેમિકલ્સ લઈને નીકળે ત્યારથી શરૂ કરી નિર્ધારિત સ્થળે પહોંચે ત્યાં સુધી “જીપીઆર એસ ટ્રેડિંગ”ની સગવડ પૂરી પાડવામાં આવે છે. નાઈસરગલોબનું પ્લેટફોર્મ - વ્યવસ્થા - તાકીદના સંજોગોમાં મદદ માટેની ગોર્ડવણ સાથે મજબૂત રીતે જોડાયેલી છે. કેમિકલ કંપનીઓને એમના જોખમી માલસામાનના રક્ષણ માટે ઇન્ઝિન્યુન કેમિકલ કાઉન્સિલની આ નવતર પહેલમાં જોડાવાની સલાહ છે.

૩. લોકોની ભૂમિકા

કોઈપણ કેમિકલ અક્સમાત સાથે સંકળાયેલાં જોખમો અંગેની સામાન્ય જાણકારી અક્સમાતના પરિણામે સર્જાતું નુકસાન ઘટાડવામાં મદદરૂપ બનશે.

જો કોઈ આપત્તિ સર્જય, તો એવા સંજોગોમાં સામાન્ય લોકોને એનો સામનો કરવા માટે સંગાઠિત કરવા તથા કોઈ કેમિકલના લીકેજના સંજોગોમાં ભરવાનાં જરૂરી પગલાં અંગે લોકોને સામાન્ય જાણકારી તથા તાલીમ પૂરી પાડવા માટે પરસ્પર સહાયનું એક જૂથ રસી શકાય.

ઉપસંહાર

કેમિકલ ઉદ્યોગમાં આપત્તિ જવલેજ સર્જય છે, પણ બેદરકારી અથવા કમનાસીબને પરિણામે સહેલાઈથી આપત્તિકારક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કોઈ એક મોટા અક્સમાતમાં થતી જાનહાનિ, પર્યાવરણને થતું નુકસાન, તેમજ પ્લાન્ટ અને આજુબાજુની ઈમારતો - મકાનો વગેરેને થતા નુકસાન ઉપરાંત ઉદ્યોગને પ્રતિષ્ઠાને થતું નુકસાન ન પૂરી શકાય એવું હોય છે. કોઈપણ કેમિકલ આપત્તિની અસરગ્રસ્ત લોકોની પેઢીઓની પેઢીઓ ઉપર માઠી અસર થાય છે જે મીટાવવી લગભગ અશક્ય છે તથા અસરગ્રસ્ત લોકોને જે સહેવું પડે છે, ભોગવાનું પડે છે, એની કલ્યના પણ થઈ શકે એમ નથી.

લેખક સીએસઆઈઆર - કેન્દ્રીય ચર્મ સંશોધન સંસ્થાના ઔદ્યોગિક સલામતી અને જોખમ વિશ્લેષણ માટે સેલના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ છે. તેમના સંશોધનમાં કેમિકલ પ્રોસેસ સેફ્ટી, રાસાયણિક પ્રક્રિયાના થર્મો કાઈનેટિક એનાલોસિસ, વ્યવસાયલક્ષી સલામતી અને સ્વાસ્થ્ય, અક્સમાતના ટેટાબેઝ, ચાર્જ ટ્રોન્સફર પોલીમરાઈઝેન્સ, ડ્રગ ડિલિવરી સિસ્ટમ અને બાયોકેલેરિમેટ્રી રસ ધરાવે છે. એમ. સૂરીયાનારાયણના સંશોધનો જરૂરિયામાં ૧૨૦ પ્રકાશિત થયા છે.

E-mail: msuril@vsnl.com

આપત્તિ નિવારણઃ તાત્કાલિક - ટ્રોમા કેરની ભૂમિકા અને મહત્વ

ડૉ. અમિત ગુપ્તા, મહેશ સી. મિશ્રા



સામુદ્દરિક દુર્ઘટનાઓમાં મોટા પાયે આનમાલની હાનિ સંકળાયેલી હોય તેવું બની શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓનું અસરકારક સંચાલન કરવા માટે તાલુકા સરે માળખું પર્યાપ્ત નથી. તાલુકા-હોસ્પિટલો અને જિલ્લા-હોસ્પિટલો ૧૦૦થી ૨૫૦ પથારીની સુવિધા ધરાવે છે અને તેમને ટ્રોમાકેર સહિત દ્વિતીય સ્તરની સારસંભાળ પ્રદાન કરવા માટે સજ્જ કરવાની યોજના છે. પણ રાજ્યોમાં જિલ્લા સ્તરીય હોસ્પિટલો દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાની વિવિધતા અને ગુણવત્તા વચ્ચે મોટાં ફરક છે. રાજ્યોની રાજ્યાનીઓ અને અન્ય મોટાં શહેરોમાં મેડિકલ કોલેજો છે કે અન્ય કેર સંસ્થાઓ છે, જેનું સંચાલન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કે મુનિસિપાલિટીઓ કરે છે. આ તમામ સંસ્થાઓ રોજિંદા કામગીરીના ભારણ હેઠળ દબાયેલી છે અને તેમની ક્ષમતામાં વધારો મધ્યાદિત છે.

“ હેવાય છે કે જે વ્યક્તિ ઈજાગ્રસ્ત વ્યક્તિને સૌપ્રથમ જુએ છે, એ જ તેનું ભવિષ્ય નક્કી કરે છે.” તેનો અર્થ એ છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચતાં અગાઉ પર્યાપ્ત સારસંભાળ મળવી જરૂરી છે અને ‘કટોકટીના સમયગાળા’માં ઉચિત ટ્રોમાકેર સુવિધામાં દર્દીને ઝડપથી પહોંચાડવા આવશ્યક છે. ‘કટોકટીનો સમયગાળા’ એટલે ઈજા થયા પછી એક કલાકનો ગાળો. ભારતમાં ઘણી વખત ઈજાગ્રસ્ત દર્દીઓ ઈજા થયાના રથી હ કલાક અને વધુ સમય પછી ઈમરજન્સી વિભાગમાં પહોંચે છે, તેવું કહીએ તો નવાઈ લાગવીન જોઈએ. આ કલાકોને ‘જોખમકારક ગાળો’ અને ‘અતિ જોખમકારક ગાળો’ કહું છું. આપણે ઈજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવે પછીના એક કલાકને ‘કટોકટીના સમયગાળા’માં પરિવર્તિત કરવાની જરૂર છે, ભલે ઈજાગ્રસ્ત

વ્યક્તિને ‘જોખમકારક કે અતિ જોખમકારક સમયગાળા’ સમયગાળામાં લાવવામાં આવી હોય. જો ઈજાગ્રસ્ત વ્યક્તિનું જીવન બચી જશે, તો એ સમાજ માટે કશું પ્રદાન કરી શકશે અને દેશના વિકાસ માટે ઉપયોગી કામગીરી કરી શકશે.

હુર્ઘટના એટલે: ‘સમાજની કામગીરીમાં ગંભીર વિક્ષેપ, જેના કારણે જાનમાલ કે પર્યાવરણ-સંપત્તિને વ્યાપક નુકસાન થાય છે, જેનો સામનો સમાજ પોતાના સંસાધનથી કરવા સક્ષમ હોતો નથી.’ જ્યારે આપત્તિ સમાજના નબળા વર્ગને નિશાન બનાવે છે, ત્યારે દુર્ઘટના સર્જય છે. જ્યારે કોઈ સમુદ્દરાય, માળખું કે વિસ્તાર કોઈ ખાસ આપત્તિ દ્વારા નુકસાન પામવાની શક્યતા ધરાવતો હોય, ત્યારે આ પ્રકારનો સમુદ્દરાય, માળખું, સેવા કે ભૌગોલિક વિસ્તાર બેદ્ય કે નબળો ગણાય છે.

ભારત વિવિધ પ્રકારનું જોખમ જુદા



જુદા પ્રમાણમાં ધરાવે છે. આપણો દેશ ઘણી બધી આપત્તિઓનું જોખમ ધરાવે છે. આપણો P.C. ૯ ટકાથી વિસ્તાર ધરતીકુંપનું મધ્યમથી વધારે જોખમ ધરાવે છે. કુલ જમીનનો ૧૨ ટકા હિસ્સો એટલે કે ૪૦ મિલિયન હેક્ટાર પૂર અને નદીના ધોવાણનું જોખમ ધરાવે છે.

૭. ૫૧૯ લાંબા દરિયાકિનારામાંથી ૫, ૭૦૦ કિમીની લંબાઈ ધરાવતો દરિયાકિનારો ચકવાત અને સુનામીનું જોખમ ધરાવે છે. પાક લઈ શકાય તેવો ૯૮ ટકા વિસ્તાર દુષ્કાળની સંભાવના ધરાવે છે. દેશના પવર્તીય વિસ્તારો જમીન ધસી પડવાનું જોખમ ધરાવે છે. ઉપરાંત ભારત રાસાયણિક, જૈવિક, રેન્ડિયોલોજીકલ અને પરમાણુ (સીબીઆરએન) આપત્તિનો ભોગ બનવાનું તથા અન્ય માનવસર્જિત સમસ્યાઓનું જોખમ ધરાવે છે.

સામાન્ય રીતે આપત્તિ-નિવારણ વ્યવસ્થાપન મુખ્યત્વે છ પાસાં ધરાવે છે : આપત્તિપૂર્વના તબક્કામાં નિવારણ, શમન અને તૈયારી સામેલ છે, તો આપત્તિ પછીના તબક્કામાં પ્રતિસાદ, પુનર્વસન, પુનર્નિર્મિણ અને સુધારો સામેલ છે.

આંકૃતિક ૧: આપત્તિ-વ્યવસ્થાપન ચક્ક. (સંદર્ભ: તમે તૈયાર છો? બૃહદ્દ હાંશેન-અવાજ ધરતીકુંપ આપત્તિમાંથી બોધપાઠ – આપત્તિ ઘટાડવા અને સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ માટેની પુસ્તિકા)



કેન્દ્રીય ગૃહમંત્રાલયે 'રાષ્ટ્રીય આપત્તિ નિવારણ સંસ્થા' અને સંરક્ષણ, આરોગ્ય અને પરિવારકલ્યાણ, રેલવે, પરમાણુ-ગીર્જા,

યોજના જાન્યુઆરી-૨૦૧૭


નાણાં, કૃષિ, પર્યાવરણ અને વન, ગ્રામીણ વિકાસ, ઊર્જા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અવકાશ અને ટેલિકોમ્યુનિકેશન્સ, જળસંસાધન તથા માર્ગપરિવહન અને રાજમાર્ગ જેવા વિવિધ મંત્રાલયોસાથે મોટા પાયે આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરી છે.

આપત્તિ-વ્યવસ્થાપન ધારો, ૨૦૦૫ બન્યા પછી રાષ્ટ્રીય આપત્તિ-નિવારણ સંસ્થા (એનડીએમએ)ની રચના થઈ હતી. એનડીએમએના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે, જે ઉપાધ્યક્ષ કે સેકેટરી અને નવ સભ્યો પણ ધરાવે છે. એનડીએમએની જવાબદારીમાં નીતિનિર્દ્દશો, યોજના અને માર્ગદર્શિકા બનાવવી, વિવિધ મંત્રાલયો અને રાજ્યો માટે કલેક્ટર કે મેજિસ્ટ્રેટ હોય છે.

યોજનાઓને મંજૂરી આપવી, નીતિનું સંકલન અને અમલીકરણ, શમન માટે ભંડોળની જોગવાઈની ભલામણ કરવી તથા દેશની અંદર અને અન્ય દેશોમાં જરૂર પડે, ત્યારે આપત્તિ કે દુર્ઘટના પર અસરકારક નિયંત્રણ માટે તૈયારી અને ક્રમતાનિર્મણ જેવાં અન્ય પગલાં સામેલ છે. આપત્તિ-વ્યવસ્થાપન ધારો, ૨૦૦૫ રાજ્ય અને જિલ્લા સ્તરે આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરે છે. જિલ્લા સ્તરની સંસ્થાઓ વાસ્તવિક સ્તરે કામ કરવા માટે મુખ્ય એજન્સી છે, જેના ચેરમેન જિલ્લા બનાવવી, વિવિધ મંત્રાલયો અને રાજ્યો માટે કલેક્ટર કે મેજિસ્ટ્રેટ હોય છે.

આંકૃતિક ૨: જિલ્લા સ્તરે આપત્તિનો સામનો કરવા માટેનું માળખું

District Disaster Response Incident Command



આપત્તિ સમયે તથીબી પ્રતિસાદ

ભારતમાં એનડીએમએ – સામૂહિક આપત્તિ-વ્યવસ્થાપનમાં તથીબી તૈયારી માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા (એનજી-એમપીએમસીએમ) મુજબ આપત્તિના સમયે ડીજાએચેસનાનું ઈમરજન્સી મેડિકલ પ્રતિસાદ ડિવિઝન મુખ્ય અમલીકરણ સંસ્થા છે, જે

ઈમરજન્સી સપોર્ટ ફંક્શન (ઈએસએફ – કટોક્ટીમાં સહાયરૂપ કામગીરી) યોજનાનો અમલ કરે છે, જેમાં સંકલન, આપત્તિ વ્યવસ્થાપન સમિતિ તથા હેડક્વાર્ટર્સ અને ફિલ્ડ સ્ટર્ટે તાત્કાલિક પ્રતિસાદ ટુકડી, સંશોધન માટે જરૂરી સાધનસામગ્રી વરેરે માટે નોડલ અધિકારીઓની ઓળખ કરવાની



પ્રક્રિયા સામેલ છે. નિર્ણયક સંસ્થા આરોગ્ય અને પરિવારકલ્યાણના સચિવ હેઠળ આપત્તિ-વ્યવસ્થાપન જૂથ છે, જેને ડીજાએચએસ હેઠળ ટેક્નિકલ સલાહકાર સમિતિ દ્વારા સલાહ આપવામાં આવે છે.

આપત્તિ-વ્યવસ્થાપન કાર્યક્રમને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરવાની જરૂર છે તથા આ લક્ષ્યાંક હાંસલ કરવા આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દેશમાં સામૂહિક આપત્તિ-તાલીમ કાર્યક્રમને સંસ્થાગત સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. કટોકટી દરમિયાન હોસ્પિટલમાં તૈયારી માટે ઈન્સ્ટ્રુક્ટર્સની તાલીમ હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધી ૧૦૦ ઈન્સ્ટ્રુક્ટર્સને તાલીમ આપવામાં આવી છે. હોસ્પિટલ આકાશીક આયોજન અને તાલીમ માટે મુખ્ય સંસ્થાઓ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા (એનઆઈડીએમ) અને રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ સંસ્થા (એનઆઈએચ એફડબલ્યુ) છે. આ ઈન્સ્ટ્રુક્ટર્સ રાજ્ય સરકારની હોસ્પિટલો કે મેડિકલ કોલેજોમાંથી મેળવવામાં આવે છે. આગામી તબક્કામાં મુખ્ય રોગચાળા અને જૈવિક કટોકટીઓ માટે ઈમરજન્સી હોસ્પિટલ મેનેજર્સને જિલ્લા સ્તરે તાલીમ આપવામાં આવશે. આ તાલીમ એનઆઈસીડી આપશે. એનઆઈસીડી કે આઈસીએમઆર સંસ્થાઓ શિક્ષણ, તાલીમ આપે છે, સંશોધન હાથ ધરે છે અને પ્રયોગશાળાનો ટેકો આપે છે. મોટા ભાગનાં

રાજ્યો આરોગ્ય અને પરિવારકલ્યાણ માટે પ્રાદેશિક અધિકારી ધરાવે છે તથા આપત્તિનાં સ્વાસ્થ્ય સંબંધિત પરિણામોના અસરકારક વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર સાથે પ્રાદેશિક ડિરેક્ટર સાથે ચર્ચાવિચારણ કરે છે.

આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે માર્ગ સલામતી અને આપત્તિ માટે કટોકટીની સુવિધાઓ વધારવા પસંદગીની સરકારી હોસ્પિટલો માટે વિવિધ પહેલો હાથ ધરી છે. ઉપરાંત દર ૧૦૦ કિમીના અંદર ટ્રોમા કેન્દ્રોની સ્થાપના અને સુવર્ણ ચતુર્ભૂજ નેટવર્કમાં રાજમાર્ગો પર દર ૫૦ કિમીના અંતરે એભ્યુલન્સની સુવિધા ઊભી કરવાની કામગીરી માગપરિવહન મંત્રાલય સાથે કરી છે. ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ટેકા સાથે કુલ ૨૬ પ્રથમ સ્તરની, આશરે ૨૫૦ બીજા સ્તરની ટ્રોમાકેર સુવિધાઓ સ્થાપિત કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.

એમ્સમાં ૨૦૦૬-૦૭માં જે પી એન એપેક્સ ટ્રોમાસેન્ટર ટ્રોમાના દર્દીઓની સારસંભાળ માટે ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રદાન કરવા સર્વોચ્ચ સંસ્થા છે, જેની સ્થાપના ટ્રોમાકેરમાં પ્રગતિશીલ પગલું છે. તેની કામગીરી દેશમાં અન્ય ટ્રોમાકેન્દ્રો માટે રોલમોડલ બનવાની છે. દર્દીઓને શ્રેષ્ઠ સારસંભાળ સુવિધાઓ પ્રદાન કરવા ઉપરાંત આ સર્વોચ્ચ ટ્રોમાકેન્દ્રની સર્વોચ્ચ સંશોધન અને તાલીમ સંસ્થા તરીકે કલ્પના કરવામાં

આવી છે, જે સમગ્ર દેશમાં ટ્રોમાકેર સુવિધાઓ સ્થાપિત કરવાનું માર્ગદર્શક કેન્દ્ર બનવા અગ્રેસર છે.

એપેક્સ ટ્રોમાસેન્ટર પ્રતિબદ્ધ ફંકલ્ટી અને ૨૪ કલાક કાર્યરત રેસિડન્ટ ટોક્ટર્સ સાથે ટ્રોમા સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ ધરાવે છે. અત્યારે તેને દર વર્ષે આશરે ૬૦,૦૦૦ દર્દીઓ મળે છે અને અત્યાર સુધી ૬૦૦૦ મોટી સર્જિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ આ કેન્દ્ર ૧૮૦ પથારી, ૩૭ આઈસીયુ પથારી, ૬ ઓટી અને ૩૫ પથારી ધરાવતો ઈડી ધરાવે છે. આગાળ જતાં ૧૬ આઈસીયુ બેડ, ૩ ઓટી, ૩૦ પથારી ધરાવતા ઈડી સાથે કુલ ૨૬૦ પથારી ધરાવશે. ઉપરાંત અહીં ખાનગી વૉર્ડ અને હેલિપેડ સાથે પેશન્ટ એટેન્ઝનર હોસ્ટેલ પણ સ્થાપિત થઈ રહી છે. આ એપેક્સ ટ્રોમાસેન્ટરની ક્ષમતા આગામી પાંચથી છ વર્ષમાં ૭૫૦ પથારી કરવાની યોજના છે, જે માટેની કામગીરી ચાલુ થઈ છે.

આપત્તિ-નિવારણ વ્યવસ્થામાં તબીબી સારવારને ટેકો આપવા આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે અગાઉથી તૈયાર રચના, સ્વનિયંત્રિત, કન્ટેઇનર આધારિત મોબાઇલ હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે, જે ખરીદીની પ્રક્રિયામાં તબક્કામાં છે. આ ૧૦૦ પથારી ધરાવતી કન્ટેઇનર આધારિત હોસ્પિટલને રેલ, રોડ કે હવાઈ માધ્યમથી દુર્ઘટના સ્થળે મોકલી શકશે. તે ઓપરેશન થિયેટર (ઓટી), આઈસીયુ, ઓપરેશન પછીની સારસંભાળ, જળશુદ્ધિકરણ એકમ, રસોડું, સેનિટરી યુનિટ અને પાવર બેકઅપ જેવી સુવિધાઓ ધરાવે છે.

સશક્ષણો કોઈ પણ આપત્તિ કે કુદરતી આફિતમાં સૌપ્રથમ સંગઠિત રીતે મદદ કરવા હાજર થાય છે. સશક્ષ દળની તબીબી સેવાઓ સુસજજ કર્મચારીઓ ધરાવે છે, જેઓ અતિ ઓછા સમયમાં કોઈ પણ આપત્તિમાં પ્રતિસાદ આપવા કુશળ છે. સમગ્ર દેશમાં પથરાયેલી તમામ સેવારત હોસ્પિટલોમાં ક્ષમતા કરતાં વધારે ભારણ છે અને તમામ



પ્રકારની આપત્તિને પહોંચી વળવા સુઆયોજિત આપત્તિ-વ્યવસ્થાપન યોજનાઓ બનાવવાની જરૂર છે. હોસ્પિટલોને આપત્તિ કે દુર્ઘટના સમયે ૩૦૦૦ પથારીઓ સુધીની સુવિધા કરવાની જરૂર છે. હાલનાં સંસાધનો સાથે મોટી આપત્તિનું વ્યવસ્થાપન કરવા આ વધારાની સુવિધા ઉપયોગી થઈ શકશે. આ પથારીઓની હુંમેશાં જાળવણી કરવી જોઈએ તથા આપત્તિ-નિવારણ માટે તૈયાર ઉપકરણ અને મેડિકલ સ્ટોરમાં સારી સ્થિતિમાં રાખવી જોઈએ, જેથી તમામ મેડિકલ યુનિટ અને હોસ્પિટલોમાં ટૂંકા ગાળામાં ઉપયોગ કરવા સરળતાપૂર્વક અલગ તારવી શકાય. પર્યાપ્ત પ્રમાણમાં ઈમરજન્સી મેડિકલ ઉપકરણ પણ સ્થળ પર સારવાર કરવા તૈયાર રાખવામાં આવશે.

આપણી પાસે મોબાઇલ ફિલ્ડ હોસ્પિટલો અને મોબાઇલ સર્જિકલ ટીમ પણ હોવી જોઈએ, જે ટૂંકા ગાળામાં જરૂર પડે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકશે. આ મોબાઇલ હોસ્પિટલો મેડિકલ સ્ટોર્સ, દવાઓ, ઉપકરણો, પથારીઓની દાખિએ સજજ હોય છે. તમામ મેડિકલ યુનિટમાં અધિકારીની ઓળખ થાય છે, જેથી તેઓ આપત્તિ સમયે ઘટનાસ્થળે સમયસર પહોંચી જાય છે. કટોકટીના સમયે પરિવહન માટે એભ્યુલન્સ અને પરિવહન સુવિધાઓની ઓળખ પણ કરવામાં આવે છે અને જરૂર પડે

યોજના જાન્યુઆરી-૨૦૧૭

તો સેનાના અન્ય એકમોમાંથી મેળવી શકશે.

આપત્તિ અને ટ્રોમાઇર વચ્ચે મહત્વપૂર્ણ ફરક

સ્વાસ્થ્ય એ રાજ્યનો વિષય છે. જ્યારે મોટી દુર્ઘટના થાય, ત્યારે તેમાં પીડિતોને સારવાર આપવાની મુખ્ય વહીવટી જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની હોય છે. સામાન્ય રીતે રાજ્યની આરોગ્યવ્યવસ્થાનું માળખું ત્રિસ્તરીય હોય છે. તેમાં આ ગ્રાન્થી સ્તર સામેલ છે:

- તાલુકા સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્યકેન્દ્ર.
- જિલ્લા સ્તરે જિલ્લા હોસ્પિટલ.
- રાજ્યની રાજ્યાનીમાં ટર્શરીકેર સંસ્થાઓ.

જોકે રાજ્યો સંસ્થાઓ કે વિભાગોની વિવિધતામાં મોટો ફરક ધરાવે છે, જે સ્થાનિક સંસ્થાઓ હેઠળ તબીબી સંસ્થાઓ, સરકારી આરોગ્યકેન્દ્રો, તબીબી સેવાઓ જેવી આ સંસ્થાઓનું સંચાલન કરે છે.

સામુદાયિક દુર્ઘટનાઓમાં મોટા પાયે જાનમાલની હાનિ સંકળાયેલી હોય તેવું બની શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓનું અસરકારક સંચાલન કરવા માટે તાલુકા સ્તરે માળખું પર્યાપ્ત નથી. તાલુકા-હોસ્પિટલો અને જિલ્લા-હોસ્પિટલો ૧૦૦થી ૨૫૦ પથારીની સુવિધા

ધરાવે છે અને તેમને ટ્રોમાઇર સહિત દ્વિતીય સ્તરની સારસંભાળ પ્રદાન કરવા માટે સજજ કરવાની યોજના છે. પણ રાજ્યોમાં જિલ્લા સ્તરીય હોસ્પિટલો દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાની વિવિધતા અને ગુણવત્તા વચ્ચે મોટાં ફરક છે. રાજ્યોની રાજ્યાનીઓ અને અન્ય મોટાં શહેરોમાં મેડિકલ કોલેજો છે કે અન્ય ટર્શરીકેર સંસ્થાઓ છે, જેનું સંચાલન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કે મ્યુનિસિપાલિટીઓ કરે છે. આ તમામ સંસ્થાઓ રોજિંદા કામગીરીના ભારણ હેઠળ દ્વારાયેલી છે અને તેમની ક્ષમતામાં વધારો મર્યાદિત છે.

ભારત જેવા વિકાસશીલ દેશોમાં મૃત્યુદર વધવા માટે વિવિધ મહત્વપૂર્ણ કારણો જવાબદાર છે, જેમાંનું એક મુખ્ય કારણ ટ્રોમા વ્યવસ્થાની અનુપલબ્ધતા છે. ટ્રોમાઇરમાં ઈજાગ્રસ્તને દુર્ઘટના સ્થળથી સારવારકેન્દ્રમાં લાવવાથી લઈને પુનર્વસન સુધીની સારવાર સામેલ છે. ટૂંકમાં, ટ્રોમાઇર વ્યવસ્થામાં “દર્દીને યોગ્ય સમયે યોગ્ય આરોગ્ય સારવાર કેન્દ્રમાં લાવીને ઉચિત સારસંભાળ પ્રદાન કરવાની પ્રક્રિયા સામેલ છે.”

અ. હોસ્પિટલ પહોંચતાં અગાઉની સારસંભાળ

(૧) ઘણાં રાજ્યોમાં આ સુવિધાઓનો અભાવ છે. કેટલાંક રાજ્યોમાં તો અતિ પ્રાથમિક અવસ્થામાં છે. તેમની પાસે અત્યાધુનિક એભ્યુલન્સ, તબીબી સારવારમાં તાલીમબદ્ધ કર્મચારીઓ અને યોગ્ય સંસ્થાઓ નથી. કેટલાંક રાજ્યોએ તો એભ્યુલન્સ, પોલીસ અને ફાયર એમ ગ્રાન્થી પ્રકારની સ્થિતિ માટે એક જ ઈમરજન્સી નંબર ૧૦૮ રાખ્યો છે. વર્તમાન વ્યવસ્થા જીપીએસ કે જીપીઆરએસ પર ચાલે છે, પણ કુશળ માનવ-સંસાધન અને સંસ્થાઓનાં અભાવ છે તેમજ યોગ્ય કાયદાકીય અને નિયમનકારી નિયમનકારી નિયમનકારી વ્યવસ્થા પણ તેભી થઈ નથી.



બ. હોસ્પિટલમાં ટ્રોમાકેર

- (1) માળખું : દ્વિતીયક (સામુદ્દરિક આરોગ્ય-કેન્દ્રો કે જિલ્લા-હોસ્પિટલો) અને તૃતીય (સાર્વનિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથેની હોસ્પિટલો) આરોગ્ય કેન્દ્રોનું માળખું વિવિધ પ્રકારની ઈજા પામેલા દર્દીઓની જરૂરિયાતોને સારવાર પ્રદાન કરવા સક્ષમ ન હોય તેવું બની શકે છે. સમગ્ર દેશમાં સુસજ્જ ઈમરજન્સી વિભાગોની ઊંઘાપ છે. ખાનગી હોસ્પિટલોના સુસજ્જ ઈમરજન્સી વિભાગ ઈજાગ્રસ્ત દર્દીઓની આર્થિક મર્યાદાઓના કારણે સંપૂર્ણ સારસંભાળ પ્રદાન કરતો નથી.
- (2) કુશળ માનવ-સંસાધન : કુશળ માનવ સંસાધનનો અભાવ છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળના તમામ સ્તરે (પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક) ગંભીર રીત ઈજાગ્રસ્ત દર્દીને અસરકારક રીતે સેવા પ્રદાન કરી શકે છે. હજુ આપણા દેશમાં ટ્રોમા સારવાર માટે ટીમનો જ્યાલ પણ પ્રવર્તતો નથી અને ઘણી વખત દર્દીઓની સારસંભાળ લેનાર વ્યક્તિઓ જીવન બચાવવા માટે જરૂરી પ્રક્રિયાઓમાં પૂરતી કુશળતા ધરાવતા નથી.
૧. ઈમરજન્સી વિભાગમાં કુશળ ડોક્ટર્સ અને નર્સનો અભાવ (સીએમઓ અને જીડીએમઓના)

2. ટ્રોમાસર્જનની ગેરહાજરી કે ટ્રોમામાં સર્જિકલ કુશળતા ધરાવતા ડોક્ટર્સની ઊંઘાપ
3. ઈજાગ્રસ્ત દર્દીની સારસંભાળ માટે વિવિધ ક્ષેત્રોમાં સુપર સ્પેશિયાલિસ્ટની અપૂરતી સંખ્યા (ન્યૂરોસર્જન, ટ્રોમા-ઈન્ટેન્સિવ કેર વગેરે)
4. હોસ્પિટલોમાં પુનર્વસન વ્યવસાયિકોની અપૂરતી સંખ્યા

આ સંસ્થાઓમાં ક્ષમતા વિકસાવવા માટે માનવ-સંસાધનનો સંપૂર્ણ વિકાસ જરૂરી છે તથા સુકેન્દ્રિત અને કાર્યરત ડીએમ તખીબી વ્યવસ્થાની સ્થાપના માટે માળખાની આવશ્યકતા છે. સંરક્ષણ-મંત્રાલય, રેલવે-મંત્રાલય, આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાલય, શ્રમ અને રોજગાર-મંત્રાલય અને બિનસરકારી સંસ્થાઓ ઉપલબ્ધ સંસાધનો વધારીને માળખું વિકસાવી શકાશે. તેમાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડિક્સ અને અન્ય સંસાધન વ્યક્તિઓ તેમજ ડીએમ માટે અન્ય ઓળખ કરેલાં સંસાધનો સહિત વિવિધ હિતધારકોની તાલીમને સામેલ કરવી જોઈએ.

જેપીએન એપેક્સ ટ્રોમાસેન્ટર દ્વારા રાષ્ટ્રીય સ્તરે ક્ષમતા-સંવર્ધન પ્રયાસો

એટીએલએસ, એયુટીએલએસ, એસિસીસી, એટીસીએન, પીએચીએલએસ સ્વરૂપે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો તથા સશક્ત દળો અને રાજ્ય સરકારના સર્વિસો

ડોક્ટર્સને તાલીમ સ્વરૂપે લાંબા ગાળાના અભ્યાસક્રમો લાંબા સમયથી ચાલી રહ્યો છે. તાજેતરમાં ટ્રોમાસર્જરી અને ગંભીર સારવારમાં એમસીએચ સ્વરૂપે સુપર સ્પેશિયાલિટી કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેનો ઉદેશ અમ્ભસને ભારતમાં ટ્રોમા સર્જરીમાં સર્જિકલ સ્પેશિયાલિસ્ટમાં તાલીમ આપવા માટે ઔપચારિક ડિગ્રી કોર્સ શરૂ કરનાર પ્રથમ સંસ્થા બનાવવાનો છે.

ભારતમાં એપેક્સ ટ્રોમાસેન્ટર એડવાન્સ ટ્રોમાલાઈફ માટે, ક્ષમતા સંવર્ધન માટે એનડીએમએના ટેકા સાથે પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જેમાં તૃજયોમાં મૂળભૂત અને આધુનિક ટ્રોમા લાઇફસપોર્ટમાં ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિક્સને તાલીમ આપવામાં આવી છે. તખીબી કર્મચારીઓ માટે એડવાન્સ ટ્રોમા લાઇફસપોર્ટ માટે ક્ષમતા સંવર્ધન પર વિસ્તૃત પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેનો ઉદેશ આગામી ૪ વર્ષમાં આશરે ૧૮૦૦ ડોક્ટર્સ અને નર્સને એડવાન્સ ટ્રોમાકેરની તાલીમ આપવાનો છે.

છેલ્લે, આપણે વારંવાર આપત્તિ કે દુર્ઘટનાનો ભોગ બનવાનું જોખમ ધરાવતા જાપાન જેવા દેશોમાંથી બોધપાઠ મેળવવાની જરૂર છે, જ્યાં હોસ્પિટલ પૂર્વે ટ્રોમાકેર અને આપત્તિ-વ્યવસ્થાપન માટે વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. કમાન્ડ સેન્ટર અને ઈમરજન્સી માહિતી વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂર છે, જેમાં તમામ હોસ્પિટલો મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અને કેટલી વ્યક્તિઓને સહાયની જરૂર છે, એ વિશે જાણકારી આપવી જોઈએ.

અમિત ગુમા જે પી એન એપેક્સ ટ્રોમા સેન્ટરના ટ્રોમા સર્જરી અને કિટિકલ કેરના ડિવિઝનના સર્જરીના પ્રોફેસર છે તથા નવી હિલ્સીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના જે પી એન એપેક્સ ટ્રોમા સેન્ટરના ચીફ પ્રવક્તા છે.


E-mail: amitguptaaiims@gmail.com

મહેશ સી મિશ્રા સર્જિકલ શાખા વિભાગના સર્જરીના ડિરેક્ટર અને પ્રોફેસર છે તથા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના જે પી એન એપેક્સ ટ્રોમા સેન્ટરના ચીફ પ્રવક્તા છે.

E-mail: mcmisra@gmail.com

વિકાસ અને આપત્તિનાં જોખમોમાં ઘટાડો : સેન્ડાઈ ફેમવર્ક

સંતોષ કુમાર



ડિઝાસ્ટર બાબતે રાષ્ટ્રો અને સમુદાયોમાં આફત સામે ટકી રહેવાની શક્તિના નિર્માણ માટેના લોગો ફેમવર્ક ફોર એક્શન (એચએફએ) ૨૦૦૫-૨૦૧૫: રાષ્ટ્રો અને સમુદાયો માટે ટકી રહેવાની શક્તિ (resilience) ના નિર્માણની ધોખણાના અનુગામી તરીકે સેન્ડાઈ ફેમવર્ક આવ્યું. ૧૯૮૮માં એક દાયક સુધી ઇન્ટરનેશનલ ફેમવર્ક ફોર એક્શન હેઠળ કુદરતી આફતોનાં જોખમ ઘટાડવાની એક દાયક સુધીના આયોજનની કામગીરી હાથ ધરાઈ હતી અને વધુ સલામત દુનિયાના ઉંડેશથી યોકોહમા વ્યૂહરચના દ્વારા કુદરતી આફતોના નિવારણ માટે માગરિખાઓ, સંજગતા તથા જોખમ નિવારણનાં પગલાં તથા એ માટેનો એક્શનનાયાન ૧૯૮૮માં ઘરી કાઢવામાં આવ્યો હતો અને ડિઝાસ્ટરનાં માઠાં પરિણામો ઘટાડવાની ઇન્ટરનેશનલ વ્યૂહરચના ૧૯૯૮માં ઘરી કાઢવામાં આવી હતી.

જે સતત થતું રહેછે, તે પરિવર્તન છે. સર્વત્ર ચીજો બદલાઈ રહી છે અને નવી મહેચ્છાઓ અને પડકારો ઊભા થઈ રહ્યા છે. એસી અને ૮૦ ના દાયકામાં હતું તે પ્રમાણે દુનિયામાં પર્યાવરણ, આર્થિક, સામાજિક અને રાજકીય વાતાવરણ એક્સરખું નથી હોતું. ટેક્નોલોજી અને કુદરતી વાતાવરણને કારણે વિકાસની વાતોને માર્ગદર્શન પૂરું પાર્યું છે. ૨૦૧૫નું વર્ષ ખૂબ જનોધ્યપાત્ર હતું, જે દરમિયાન ત્રણ મહત્વના વૈશ્વિક કરારો ઉપર હસ્તાક્ષર થયા. જેમાં સરસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG), જલવાયું પરિવર્તન અંગેનો પેરિસ કરાર-Cop ૨૧ અને સેન્ડાઈ ફેમવર્ક ડિઝાસ્ટર રિસ્કરિડક્શન ૨૦૧૫-૩૦નો સમાવેશ થાય છે. આ ગ્રાણે કરારોમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે કેટલાંક ધ્યેય અને લક્ષ્યાંકો હાંસલ કરવાની નિષ્ઠા વ્યક્ત કરી છે. આ તમામ દસ્તાવેજોમાં કેટલીક સમાન બાબતો છે, જે પરસ્પર એક કેન્દ્રભિંદુ તરફ વળે છે. ડિઝાસ્ટરને કારણે જે નુકસાન થયાં છે, તેના અભ્યાસોમાં જણાયું છે કે આપણે જો સાતત્યપૂર્ણ વિકાસનું ધ્યેય હાંસલ કરવું હશે, તો આપણે ડિઝાસ્ટરને કારણે થતાં નુકસાનને રોકવું પડશે. આપણે અતિશય નુકસાન કરતી ઘટનાઓ અને જલવાયુ-પરિવર્તનને રોકવાના ઉપાયો કરવા પડશે. વિકાસ, ડિઝાસ્ટરનાં જોખમો અને જલવાયુ પરિવર્તન પરસ્પર એકબીજાં સાથે જોડાયેલાં છે અને આથી જ ઉપાયો પણ એકબીજા સાથે સંકલિત હોય તે આવશ્યક છે.

ડિઝાસ્ટર અને સાતત્યપૂર્ણ વિકાસ(SDG)ના પડકારો

ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની બાબત વિકાસનાં ઘડાં ક્ષેત્રો અને પાસાંને આવરી લે છે. ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા માટેના રૂપ લક્ષ્યાંકોમાથી સાતત્યપૂર્ણ વિકાસનાં ૧૭માંથી ૧૦ ધ્યેયનો સમાવેશ થાય છે, જે વિકાસની મુખ્ય વ્યૂહરચનામાં ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની બાબતને દફાખે સુસ્થાપિત કરે છે. દાસુણ ગરીબીની નાબૂદીનું ધ્યેય હાંસલ કરવા માટે ડિઝાસ્ટર સામે સ્થિતિસ્થાપકતા (ટકી રહેવાની ક્ષમતા) હાંસલ કરવી તે ખૂબ જ મહત્વની બાબત છે. ડિઝાસ્ટરનાં જોખમોને માર્ગ મળે, તો તે આર્થિક અને સામાજિક દુર્બળતા તરફ દોરી જાય છે, જોખમોની સ્થિતિ ગરીબીમાં નોંધપાત્ર પ્રદાન કરે છે અને તેના કારણે સાતત્યપૂર્ણ વિકાસની પ્રગતિ માટે વધુ મર્યાદા ઊભી થાય છે. વિવિધ ઉદાહરણોમાં એવું જણાયું છે કે વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોમાં મહામહેનતે હાંસલ થયેલા વિકાસના લાભને ડિઝાસ્ટરથી માઠી અસર થતી હોય છે અને ખાસ કરીને ગરીબ તથા દાસુણ હાલતમાં જીવતા લોકોને વધુ દયનીય હાલતમાં મુકાઈ જઈ ગરીબીની ગતમાં ધૂકેલાઈ જાય છે. આ રીતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉર્પ મિલિયન લોકો ગરીબીની ગતમાં ધૂકેલાયેલા હશે અને ખાસ કરીને સંબંધિત કાના આફિકાના તથા દક્ષિણ એશિયાના દેશોના પ્રકારનાં જોખમો તથા જલવાયુ, પરિવર્તનનો ભોગ બનેલા હશે. આ બાબત દર્શાવી છે કે ગરીબ સમુદાયોને

ભવિષ્યની ડિઝાસ્ટરની ઘટનાઓની અસરથી દૂર રાખવા માટે અને વધુ લોકોને ગરીબીની ગત્તામાં ધેલાતાં અટકાવવા અને તેમની આજીવિકાતથા અસ્ક્રયામતોની સુરક્ષા હાંસલ થાય તથા તેમને દારુણતાની સ્થિતિમાંથી બહાર લાવવા ટકી શકવાની સબળ ક્ષમતા ઉભી કરવાની જરૂર છે.

નેપાળના ગોરખા ધરતીકુપમાં ડિઝાસ્ટર પછી જે નુકસાન અને હાનિ થઈ તેના અભ્યાસમાં સ્પષ્ટપણે ઉત્ખેખ કરાયો છે કે આ ભૂકુપ વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૮૩૮ ટકા નેપાળી લોકોને ગરીબીમાં ધેલી દેશે. તેનાથી વધુ ૭ લાખ લોકો ગરીબીમાં ધેલાયા અને ૭ અબજ યુએસ ડોલરનું નુકસાન થયું. આ અભ્યાસ દર્શાવે છે કે ઓછામાં ઓછો માનવવિકાસ ઈન્ડેક્સ (HDI) ધરાવતા ધોલાખા, સિધુપલ ચોક, ગોરખા, નૂવાકોટ, રસૂવા અને ધિંગ જેવા હ જિલ્લાઓમાં નિવાસ કરતી અતિ ગરીબ વસતિને ડિઝાસ્ટરની અસરથી વ્યક્તિત્વ દીઠ ૧૩૦,૦૦૦ એનપીઆરથી વધારે નુકસાન થયું છે, જે પુરવાર કરે છે કે અતિ ગરીબ અને અતિ દારુણ સ્થિતિમાં જવતા લોકો સામાન્ય રીત ડિઝાસ્ટરની અતિ માઠી અસરોનો ભોગ બને છે.

સાતત્યપૂર્ણ આર્થિક-સામાજિક વિકાસ હાંસલ કરવાના આપણા વિઝનને ડિઝાસ્ટરની માઠી અસર થતી હોય છે. આર્થિક નુકસાન અને ખોટનો અંદાજ અબજો ડોલરનો મુકાય છે અને એ કારણે વિસ્તારની સમૃદ્ધિના ધ્યેયમાં પ્રથીએ કરવી પડે છે. દરેક ડિઝાસ્ટરને કારણે ખેતી, આવાસ, આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ જેવાં વિકાસનાં વિવિધ ક્ષેત્રોને માઠી અસર થતી હોય છે.

વિરોધાભાસ એ છે કે ડિઝાસ્ટરની વધતી અસર અને લોકોની વધતી દારુણતાને કારણે ડિઝાસ્ટર પછી વિકાસ-પ્રવૃત્તિઓ જાળવી રાખવામાં મુશ્કેલી ઉભી થાય છે અને જમીનનો અયોગ્ય ઉપયોગ અને પર્યાવરણને માઠી અસર તરફ દોરી જાય છે. આપણા

વિવિધ વિસ્તારોમાં ડિઝાસ્ટરની અવારનવાર બનતી ઘટનાઓ અને વાપને કારણે આપણા દેશમાં વિવિધ સમુદ્ધાયો માટે મહત્વની માળખાગત સુવિધાઓની સાથે-સાથે સુરક્ષા અને વિકાસ માટેના સંકલિત ઉપયોગ પણ હાથ ધરવાની જરૂર છે.

વિકાસનું આયોજન અને વિશ્વેષણ થાય ત્યારે વર્તમાન અને ભવિષ્યના સામાજિક અને આર્થિક જોખમી પરિબળોનું આકલન કરી જોખમ ધટાડવું જોઈએ. જો, વિકાસ અને વૃદ્ધિના રાષ્ટ્રીય લક્ષ્યાકો-રોજગાર અને વેપાર સહિતના-હાંસલ કરવા હોય તો કટોકટીના વ્યવસ્થાપનને બદલે જોખમોના વ્યવસ્થાપનનો જાહેર નીતિઓના માળખામાં સમાવેશ થવો જોઈએ અને આયોજન અંગેની નિષ્ણય પ્રક્રિયામાં જોખમ રોકવા કે ધટાડવા માટે માહિતી આધારિત રોકાણો અને પ્રણાલીઓને અનુસરવું જોઈએ. આપત્તિ વ્યવસ્થાપન

યુનો દ્વારા ડિઝાસ્ટરની જે વ્યાખ્યા સ્વીકારવામાં આવી છે, તેને નેશનલ એક્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ-૨૦૦૫માં અનુસરવામાં આવેલ છે અને એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે ‘ડિઝાસ્ટર એ સમુદ્ધાયો અથવા તો સમાજની કામગીરીમાં ગંભીર વિક્ષેપ છે, જેનાથી વ્યાપક માનવીય, ભૌતિક, આર્થિક અને / અથવા પર્યાવરણલક્ષી હાનિ થતી હોય છે, જે સમાજ અથવા સમુદ્ધાયને તેનાં પોતાના સાધનો દ્વારા પહોંચી વળવાની ક્ષમતા કરતાં વિશેષ માઠી હાલત ઉભી કરે છે. કુદરતી આફિતોને કાળજીપૂર્વકનાં આયોજનો, તૈયારીઓ અને નિવારણનાં પગલાં દ્વારા માઠી હાલત અટકાવી શકાય છે.’

વિવિધ સહયોગીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટને અલગ રીતે સમજે છે. જે લોકો પ્રતિભાવ આપે છે, તેમના માટે તે રિસ્પોન્સ મેનેજમેન્ટ છે. જે લોકો રાહત અને તાત્કાલિક બેઠા થવાની કામગીરી સાથે સંકળાયેલા છે તેમના માટે તે માનવ-કટોકટી અને રાહત મેનેજમેન્ટ છે. બંને ડિઝાસ્ટર પછીની

પ્રવૃત્તિઓ છે. જોખમ ધટે તે માટે ડિઝાસ્ટર પૂર્વનું આયોજન, જોખમ નિવારણ અને સામનો કરવાની સજ્જતા એ ક્ષેત્રમાં કામગીરીના નવા નિયમો તરીકે ઓળખાય છે અને જે લોકો તેમાં માનતા હોય તેમના માટે તે ડિઝાસ્ટર પૂર્વના જોખમમાં ઘટાડો અને ડિઝાસ્ટર પછીનો રિસ્પોન્સ બંને છે. દુનિયાના મોટા ભાગમાં અને ખાસ કરીને દક્ષિણ એશિયા અને ભારતમાં પણ ડિઝાસ્ટર પૂર્વના પ્રતિભાવને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અત્યંત મહત્વની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આથી સંસ્થાકીય પદ્ધતિ, મેન્યુઅલ્સ, નીતિ, કાર્યક્રમો વગેરે એ રીતે ડિઝાસ્ટર કરવા જોઈએ, જેથી તે આ અંગેની ચિંતાનું નિવારણ કરી શકે. ડિઝાસ્ટર પછીની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર શાસનતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામમાં લાગી જાય છે, પરંતુ નસીબજોગે તે બાબત હવે ભૂતકાળ બની ગઈ છે. હવે છેલ્લાં એક્ષી દોઢ દાયકાથી ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પરિવર્તન આવ્યું છે અને નિયમિત અંતરે નવા અનુભવો સાથે તેની નવેસરથી વ્યાખ્યા કરી વર્ષ ૨૦૧૫ પના સેન્ડાઈઝ ફેમવર્કને અપનાવ્યા પછી નવેમ્બર ૨૦૧૬માં એશિયાના મિનિસ્ટરોની કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ડિઝાસ્ટરનું જોખમ ધટાડવા માટેનો અને મહદદંશે એશિયન અને પેસિફિક રાષ્ટ્રો માટે ડિઝાસ્ટરપૂર્વની પ્રવૃત્તિઓ અંગે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતના માનનીય વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને ડિઝાસ્ટરનું જોખમ ધટાડવા તથા તેની સામે ટકી શકવાની ક્ષમતા વિકસાવવા માટેના ૧૦ સિદ્ધાંતો આપ્યા હતા. જોખમ ધટાડવાની યોજના પહેલાં સેન્ડાઈઝ (જે જાપાનનું નાનું શહેર છે) માં માર્ચ ૨૦૧૫માં વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં વિશ્વના ૧૮૫ દેશોએ ડિઝાસ્ટરનું જોખમ ધટાડવા અંગેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેને સેન્ડાઈઝ ફેમવર્ક ઓફ એક્શન ૨૦૩૦ તરીકે ઓળખવામાં આવે છે. સહી કરનાર દેશોમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.

ડિઝાસ્ટર રિસ્પોન્સમાં ઉચ્ચ્ય

જવાબદેહિતા (Accountability) જોઈ શકાય છે, પણ દરેક વ્યક્તિ પ્રતિભાવ આપવાની ઈચ્છા ધરાવતી હોય છે. બીજુ તરફ, ડિઝાસ્ટર માટેની સજ્જતા અને જોખમમાં ઘટાડાના પ્રયાસો દ્રશ્યમાન થતા નથી અને તેના માઠાં પરિણામોની નોંધ લેવાતી નથી. દુનિયાભરમાં અનેક સંમેલનો અને ધોખણાઓ છતાં કશું વિશેષ થઈ શકશું નથી. અનેક ઉદાહરણોને આધારે દુનિયાના સમુદ્દરને ભાન થયું છે કે ડિઝાસ્ટર રોકવાનું લાભદાયી છે. ભારતમાં પણ આવાં ઉદાહરણો જોવા મળ્યાં છે. ૧૯૮૮ના ઓરિસ્સાના સુપર સાયકલોનની વાત કરીએ તો આપણે ૧૩,૦૦૦થી વધુ જીવ ગુમાવ્યા હતા અને મિલકતોને ભારે નુકસાન થયું હતું. આથી વિરુદ્ધ વર્ષ ૨૦૧૧માં જ્યારે ફાલિન વાવાઝોડાનો સામનો કરવાનો આથ્યો ત્યારે ૧૯૮૮ના વાવાઝોડાનું પુનરાવર્તન થયું હતું અને વાવાઝોડું લગભગ એટલી જ તીવ્રતાથી ગ્રાટકું હતું, પરંતુ તેની અસર ૧૯૮૮ કરતાં સમગ્રપણે વિપરીત જોવા મળી હતી. મૃત્યુનો આંક માત્ર ૨૨ સુધી સીમિત રહ્યો હતો, જો કે મિલકતોને અપાર નુકસાન થયું હતું. આ ઘટના વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓ માટે ઉદાહરણરૂપ છે, કારણ કે ભારત ટીક-ટીક પ્રમાણમાં મૃત્યુઆંક ઘટાડી શકશું હતું. તાજેતરમાં તામિલનાડુમાં ગ્રાટકેલા વરદા વાવાઝોડામાં પણ સમાન પ્રકારનાં પરિણામો જોવા મળ્યાં છે અને મૃત્યુઆંકને માત્ર ૧૪ સુધી સીમિત કરી શકાયો છે અને મિલકતોને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિ હુડહુડ વાવાઝોડામાં પણ જોવા મળી હતી. આથી એ બાબત સ્પષ્ટ છે કે નિષાપૂર્વક ક્ષમતાનિર્માણના કરેલા પ્રયાસોથી મૃત્યુઆંક ઘટાડવામાં હકારાત્મક પરિણામ મળે છે. હવે ચિંતાનો વિષય એ છે કે મિલકતો, માર્ગો, પૂલો, આવાસો, હોસ્પિટલ્સ, વીજતંત્ર તથા ઉત્પાદકીય અસ્કમતોને થતું નુકસાન કઈ રીતે નિવારવું?

ડીઆરઆર (Disaster Risk reduction)ના મુખ્ય પ્રવાહો

સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે

યોજના જાન્યુઆરી-૨૦૧૭

વિકાસ-પ્રક્રિયામાં જોખમ ઘટાડવાના મુખ્ય પ્રવાહો એક મહત્વનો અઝન્ડા બની રહે છે, પરંતુ તે અનેક પડકારો ધરાવતી સંકુલ બાબત બની રહે છે. આપણે ટકી શકીએ તેવા ભવિષ્યના નિર્માણ માટે આપણાં ભૂતકાળમાંથી શીખવું પડે છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સંભાળતા વ્યાપક સમુદ્દર માટે શાનનું આદાન-પ્રદાન હજુ પણ મહત્વની જરૂરિયાત બની રહે છે અને આપણે સરકારમાં નીતિ ઘડનાર સમુદ્દર અને વહીવટી સરોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કિયા-પ્રતિક્રિયા (interface) આવશ્યક બને છે.

આનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે ઘડતાં આયોજનોમાં જાગૃતિ નિર્માણમાં સંવાદિતા દાખવીને ડિઝાસ્ટર અંગે સ્થિતિસ્થાપકતાનું નિર્માણ થઈ શકે તેવા પેટા કાયદાઓ, જમીનના વપરાશનું ઝોન્નિંગ, સાધનોનું આયોજન, આગોતરી ચેતવણી મળે તેવી પદ્ધતિઓ અને ટેકનિકલ ક્ષમતા જરૂરી બને છે. આ બધું હાંસલ કરવા માટે નવાં વિજ્ઞાન અને ટેકનોલોજી કેત્રના સંશોધનો સહાયરૂપ બનવાં જોઈએ. આગોતરી ચેતવણી મળે તેવી પદ્ધતિ અને ક્ષમતાનિર્માણના સંકલન દ્વારા રાષ્ટ્રીય-પ્રાંતીય નીતિનું આયોજન થયું જોઈએ.

મોટા ભાગની સફળતાની ગાથાઓમાં કેટલાંક સમુદ્દરોએ ભવિષ્ય માટે બોધપાઠ મેળવવાનો રહે છે અને તેનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમગ્ર પ્રક્રિયાબદલાઈ શકે છે. ડિઝાસ્ટરપૂર્વે ડાહાપણપૂર્વક કરેલા રોકાણોમાં પ્રતિભાવ (response) અને રાહત માટે ધ્યાન આપવું જોઈએ. જોકે આ બાબત ભારત માટે નવી નથી.

૧૯૮૫માં ગુજરાતમાં અંજાર ખાતે આવેલા ભૂકંપની વાત કરીએ, તો ભૂકંપ પછી જોખમ ઘટાડવાની ઉત્તમ પ્રણાલીઓ અપનાવવામાં આવી હતી. રાજ્ય સરકારે અન્ય સ્થળે શહેરનું નિર્માણ કર્યું અને ડિઝાસ્ટર સામે ટકી શકે તેવાં બાંધકામ કર્યો. અદ્ધીસદી પછી આવેલા ૨૦૦૧ના ભુજના ભૂકંપમાં

૧૯૮૫માં અન્ય સ્થળે કરાયેલા બાંધકામ સિવાયના, અંજાર શહેરના મોટા ભાગનાં મકાનોને ભારે નુકસાન થયું હતું. આ બાબત દર્શાવે છે કે ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા માટેની ઉત્તમ પ્રણાલીને અનુસરાઈ હતી, છતાં સમય જતાં આ બાબત ભૂલી જવાય છે. આપણે દસ્તાવેજકરણ કરીને આપણાં ભૂતકાળના અનુભવોમાંથી શીખવું જોઈએ અને તેને આધારે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે ઊભી થતી દારુણતા નિવારવી જોઈએ. ગુજરાતમાં કચ્છ ખાતેનો વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી ડીઆરઆરના મુખ્ય પ્રવાહ તરીકે લાંબાગાળાના પુનઃનિર્માણના કાર્યક્રમો યોજાયા. આ એક મુખ્ય સિદ્ધાંત છે, જે બિલબેક બેટર (BUILD BACK BETTER) સિદ્ધાંત દ્વારા અપનાવાયેલો નોંધપાત્ર કાર્યક્રમ નુકસાન નિવારણ તરફ થાન ખેંચે છે. આ કાર્યક્રમને ઉત્તમ પ્રણાલી તરીકેનો યુઝેન સાસાકાવા એવોર્ડ એનાયત કરાયો હતો અને દુનિયાભરમાં તેનું બહુમાન થયું હતું.

ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા બાબતે ઘણાં આર્થિક અને નાણાંકીય અભ્યાસો થયા છે. યુનેસ્કોના અંદાજ મુજબ માનવતાવાદી ધોરણે ફાળવાયેલા દર ૧૦૦ ડોલરમાંથી માત્ર ૪ ડોલર જોખમ ઘટાડવા માટે વપરાય છે. સંશોધનોને આધારે ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવા માટેનાં પગલાં લેવાય છે અને ડિઝાસ્ટરથી થતું નુકસાન નિવારવા માટે નોંધપાત્ર રકમ ખર્ચવામાં આવે છે. માનવ પ્રવૃત્તિને થતી નકારાત્મક પર્યાવરણલક્ષી અસર ઘટાડવા માટે અને દારુણ જીવન જીવતી વસ્તિના ક્ષમતાનિર્માણ માટે તથા તેમને કુદરતી આફિતોથી સુરક્ષિત કરવા માટે ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની બાબતને, દુનિયાની ગરીબી ઘટાડવા તરફના પ્રયાસોનું મહત્વનું કદમ ગણવું જોઈએ અને તે આગામી વર્ષોમાં મહત્વની પહેલ બની રહેશે.

સેનાઈ ફેમવર્ક ૨૦૧૫-૩૦

ડિઝાસ્ટર બાબતે રાષ્ટ્રો અને સમુદ્દરોમાં આફિત સામે ટકી રહેવાની

શક્તિના નિર્માણ માટેના વ્યોગો ફેમવર્ક ફોર એક્શન (એચએફએ) ૨૦૦૫-૨૦૧૫ : રાષ્ટ્રો અને સમુદ્ધાયો માટે ટકી રહેવાની શક્તિ (resilience)ના નિર્માણની ઘોખણાના અનુગામી તરીકે સેન્ડાઈ ફેમવર્ક આવ્યું. ૧૯૮૮માં એક દાયકા સુધી ઈન્ટરનેશનલ ફેમવર્ક ફોર એક્શન હેઠળ કુદરતી આફિતોનાં જોખમ ઘટાડવાની એક દાયકા સુધીના આયોજનની કામગીરી હાથ ધરાઈ હતી અને વધુ સલામત દુનિયાના ઉદેશ્યી યોકેદોમા વ્યૂહરચના દ્વારા કુદરતી આફિતોના નિવારણ માટે માર્ગરિખાઓ, સજ્જતા તથા જોખમ નિવારણનાં પગલાં તથા એ માટેનો એક્શનાલ્યાન ૧૯૮૪માં ઘડી કાઢવામાં આવ્યો હતો અને ડિઝાસ્ટરનાં માઠાં પરિણામો ઘટાડવાની ઈન્ટરનેશનલ વ્યૂહરચના ૧૯૮૮માં ઘડી કાઢવામાં આવી હતી.

સેન્ડાઈ ફેમવર્કમાં રાજ્યો તથા અન્ય લાભાર્થીઓ દ્વારા એચએફએ હેઠળ થયેલી કામગીરીનું સાતત્ય જળવાઈ રહે, તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેમાં પરિમશ્શ અને વાતાવાટોને આધારે સંખ્યાબંધ ઈનોવેશન કરવામાં આવ્યાં હતાં. ધ્યાન વિવેચકોની નજરે એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને બદલે ડિઝાસ્ટરનાં જોખમો ઘટાડવા બાબતે સબળ ફેરફારો જણાયા હતા. ૭ ગ્લોબલ ધ્યેયોની વ્યાખ્યા, અપેક્ષિત પરિણામ તરીકે ડિઝાસ્ટરના જોખમમાં ઘટાડો, નવાં જોખમો રોકવા તરફનું ધ્યેય, વર્તમાન જોખમો ઘટાડવા અને તથા રાજ્યોનાં ડિઝાસ્ટરનું જોખમ રોકવા અને ઘટાડવાની કામગીરી ઉપરાંત સમગ્ર સમાજ તથા તમામ સંસ્થાઓની સામેલગીરી માટેની પ્રાથમિક કામગીરી તથા જોખમ સામે ટકી રહેવાની શક્તમતા ઊભી કરવા જેવાં ધ્યેય નક્કી કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ડિઝાસ્ટરનાં જોખમ ઘટાડવાની કામગીરીનો વ્યાપ વિસ્તૃત બનાવવામાં આવ્યો હતો. અને તેમાં કુદરતી તેમજ માનવસર્જિત તથા તે સંબંધી પર્યાવરણાલક્ષી, ટેક્નોલોજીલક્ષી તથા જીવશાસ્ત્રાલક્ષી જોખમો જેવા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર દસ્તાવેજમાં આરોગ્ય જાળવવાની બાબત

સબળપણે વ્યક્ત કરવામાં આવી હતી.

સેન્ડાઈ ફેમવર્કમાં નીચે દર્શાવેલી બાબતોની પણ અભિવ્યક્તિ કરવામાં આવી છે: એમાં ડિઝાસ્ટરના જોખમનાં તમામ પાસાં આવરી લેવાય તે પ્રકારની બહેતર સમજ, તે અંગેની જાણકારી, દારુણતા તથા જોખમોની લાક્ષણિકતા અંગે સમજ, નેશનલ પ્લેટફોર્મ સહિત ડિઝાસ્ટરના જોખમ અંગેના વ્યવસ્થાપનને મજબૂત કરવાની બાબત, ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટમાં જવાબદેહીતા, બિલ્ડ બેક બેટર (BUILD BACK BETTER) માટેની સજ્જતા, સહયોગીઓને નવા જોખમની ઓળખ, આરોગ્ય માટેની માળખાગત સુવિધાઓ, સાંસ્કૃતિક વારસો, અને કામનાં સ્થળોની જાળવણી આંતરરાષ્ટ્રીય સહયોગ તથા ગ્લોબલ પાર્ટનરશિપ તથા જોખમની માહિતી સાથે દાનની નીતિ તથા કાર્યક્રમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી નાણાંકીય સહયોગ તથા વિરાણો મેળવવા જેવી બાબતો આવરી લેવાઈ છે.

નવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાનમાં, ડિઝાસ્ટરનાં જોખમ ઘટાડવાની પ્રવૃત્તિનું સંકલન કરીને આપણો દેશ તમામ કેન્દ્રોમાં તમામ સત્તરે ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની મહત્તમ કામગીરીનું આપોજન કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાન (NDMP)માં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વૈશ્વિક પ્રવાહોને પણ ધ્યાનમાં લેવાં આવશે અને ભારતે જેમાં હસ્તાક્ષર કર્યા છે, તે સેન્ડાઈ ફેમવર્કમાંના ડિઝાસ્ટર રિસ્ક-રિડક્શન ૨૦૧૫-૨૦૩૦માં દર્શાવ્યેલા અભિગમને પણ અનુસરવામાં આવશે.

ઉપસંહાર

જે દેશો અને રાજ્યોમાં સાધનોની તંગી છે, ડિઝાસ્ટરની અસર ઘટાડવા માટે વાસ્તવિક પરિણામોને આધારે નહીં પણ આગાહીઓના આધારે વિકાસ-આયોજનોમાં રોકાણ થવું જોઈએ. જોખમ અંગે અંધ રહેવાને બદલે માહિતી આધારિત નિષ્ણયો

કરવા તે ઉધાપણ ધરાવતી પસંદગી ગણાય છે. ભવિષ્યમાં ડિઝાસ્ટરની વ્યાપક સંભાવના ધરાવતા વિસ્તારોમાં હાથ ધરાતા પ્રોજેક્ટ્સ માટે ડિઝાસ્ટર રિસ્ક ઓડિટ ફરજિયાત બનાવવું જોઈએ. ખાનગી મૂડીરોકાણ હોય કે જાહેર મૂડીરોકાણ તેમાં વિકાસના લાભની સુરક્ષા થઈ શકે અને ટકી રહેવાની કમતા હંસલ થાય, તેવા પાયાના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. ડિઝાસ્ટરના જોખમ માટે જોખમ અટકાવવાના વ્યાપક અને પ્રજાલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. ડિઝાસ્ટરનું જોખમ ઘટાડવાની પ્રણાલીઓ કાર્યક્ષમ અને અસરકારક બની શકે તે માટે સમાવેશી હોય તે જરૂરી છે. સરકારે સરકારે નીતિઓ, આયોજનો અને ધોરણો ડિઝાઈન કરવામાં તથા તેના અમલમાં સંબંધિત સહયોગીઓ અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની જરૂર છે. મહિલાઓને આગેવાના તરીકે સંકળવાની જરૂર છે. યુવાનો બાળકો અને નાગરિકસમાજ તેમજ શિક્ષણ આલભને સાથે રાખી આ કામગીરીને સમાવેશી બનાવી શકાશે. આ ઉપરાંત દરેક રાજ્યએ વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓને સાંકળીને બહેતર કામગીરી માટે તેમજ સહયોગની તકો ઊભી કરવા માટે વધુ ધનિષ્ઠતા દાખવવાની જરૂર છે. વિકાસના વ્યૂહાત્મક ધ્યેયો (SDG) હંસલ થઈ શકે તે માટે બિઝનેસ સાથે સંકળાયેલા સમુદ્ધાયે તેમની મેનેજમેન્ટની પ્રણાલીમાં ડિઝાસ્ટરનાં જોખમોને આવરી લેવાં જોઈએ.

લેખક નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. તેઓ લાંબા ગાળાના ડિઝાસ્ટર રિકવરી પ્રોગ્રામનું સંચાલન કરવામાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સત્તરે આપત્તિ નિવારણ માટે કાર્યમાળખું બનાવવામાં લાંબો અનુભવ ધરાવે છે.

E-mail: profsantosh@gmail.com

ડિઝાસ્ટર રિસ્ક-મોનેજમેન્ટ : આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં

કુમલ કિશોર



છેલ્લાં ૨૦ વર્ષથી વધુના સમયગાળામાં મોટી હોનારતોમાં અંદાજે ૧૩.૫ કરોડ લોકોનાં મોત નીપણ્યાં હતાં, જેમાંથી અડધાથી વધુ લોકોનાં મોત ભૂકુંપથી થયાં હતાં. જ્યારે બાકીના લોકોના મોત હવામાન અને કલાઈમેટ સંબંધિત આપત્તિઓના કારણે થયાં હતાં. આ મોતમાંથી અસમાન રીતે મોટી સંખ્યામાં મોત ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં થઈ છે. પ્રત્યેક મોટી હોનારત દીઠ અને પ્રત્યેક ૧,૦૦,૦૦૦ વસતી દીઠ મૃત્યુના આંકડાઓની દાખિએ સૌથી વધુ કિંમત ગરીબ રાષ્ટ્રોએ ચૂકવવી પડી છે.

એટલું જ નહીં, અત્યંત વિકસિત દેશો પણ મોટી હોનારતની અસરોથી અધૂત રહી શક્યા નથી. આપાનમાં ૨૦૧૧માં થયેલી પરમાણુ, ભૂકુંપ અને સુનામી જેવી હોનારતો, ૨૦૦૫માં ન્યૂ ઓર્લિયન્સમાં કેટરીના વાવાઝોડા અને ૨૦૦૩માં હિટવેસ્, કે જેણે યુરોપમાં ૭૦,૦૦૦ લોકોના જવ લીધા હતા, તે આ હકીકતની યાદ અપાવે છે.



હ્લા બે દાયકાથી એવી માન્યતા દૃઢ થતી જાય છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હાંસલ કરવાના આપણા પ્રયાસોને મોટી હોનારતોએ વ્યર્થ બનાવે છે. નીચેના આંકડાઓ આ બાબત પર પ્રકાશ પાડે છે:

છેલ્લાં ૨૦ વર્ષથી વધુના સમયગાળામાં મોટી હોનારતોમાં અંદાજે ૧૩.૫ કરોડ લોકોનાં મોત નીપણ્યાં હતાં, જેમાંથી અડધાથી વધુ લોકોનાં મોત ભૂકુંપથી થયાં હતાં જ્યારે બાકીના લોકોના મોત હવામાન અને કલાઈમેટ સંબંધિત આપત્તિઓના કારણે થયાં હતાં. આ મોતમાંથી અસમાન રીતે મોટી સંખ્યામાં મોત ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં થઈ છે. પ્રત્યેક મોટી હોનારત દીઠ અને પ્રત્યેક ૧,૦૦,૦૦૦ વસતી દીઠ મૃત્યુના આંકડાઓની દાખિએ સૌથી વધુ કિંમત ગરીબ રાષ્ટ્રોએ ચૂકવવી પડી છે.


એટલું જ નહીં, અત્યંત વિકસિત દેશો પણ મોટી હોનારતની અસરોથી અધૂત રહી શક્યા નથી. આપાનમાં ૧૯૬૬થી ૨૦૧૫ વર્ષેની આકસ્મિક પ્રકારની હોનારતોની સંખ્યા

શક્યા નથી. આપાનમાં ૨૦૧૧માં થયેલી પરમાણુ, ભૂકુંપ અને સુનામી જેવી હોનારતો, ૨૦૦૫માં ન્યૂ ઓર્લિયન્સમાં કેટરીના વાવાઝોડા અને ૨૦૦૩માં હિટવેસ્, કે જેણે યુરોપમાં ૭૦,૦૦૦ લોકોના જવ લીધા હતા, તે આ હકીકતની યાદ અપાવે છે.

મોટી હોનારતો જે-તે દેશો પર તીવ્ર આર્થિક બોજાનું કારણ બનેછે, જે પરવડે તેવો હોતો નથી. છેલ્લાં બે દાયકાઓમાં વારંવાર થતી મોટી હોનારતોના કારણે ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં સસ્ટેનેબલ વિકસ હાંસલ કરવાના પ્રયાસો સાથે સમાધાન સાધવું પડ્યું છે.

હોનારતોના જોખમની બદલાતી પ્રકૃતિ


વિશ્વ હવે ખરા અર્થમાં કલાઈમેટ ચેન્જની વાસ્તવિકતા સામે સંઘર્ષ કરી રહ્યું છે, જેના કારણે હોનારતોના પુનરાવર્તન અને પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. હોનારતોની સંખ્યા અંગેના આંકડાઓ (ઓત : ઈએમડીએટી, ૨૦૧૬)નું ૫૦ વર્ષનું વિશ્લેષણ આકૃતિ-૧માં દર્શાવાયું છે.



ઉપરનો ગ્રાફ ત્રણ મુખ્ય આકસ્મિક પ્રકારની - ભૂકૂપ, પૂર અને વાવાજોડા સંબંધિત હોનારતોની સંખ્યાનો ટ્રેન્ડ દર્શાવે છે. અહીં એ જોવા મળે છે કે છેલ્લાં ૫૦ વર્ષ (૧૯૬૬થી ૨૦૧૫)ના સમયમાં ભૂકૂપની

હોનારતોની સંખ્યા એકંદરે સમાન રહી છે ત્યારે પૂર અને વાવાજોડાની હોનારતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધારા માટે કલાઈમેટ સંબંધિત વધુ સારા આત્યંતિક અહેવાલોથી લઈને પર્યાવરણની કથળેલી

સ્થિતિ (જેમકે વરસાદના સમાન સ્તરથી કદાચ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે)થી લઈને પૂર અને વાવાજોડાના જોખમવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં લોકોનો વસવાટ જેવાં અનેક કારણો હોઈ શકે છે.




આકૃતિ ૨ : વિશ્વમાં ૧૯૬૬થી ૨૦૧૫ વર્ષે 'કુદરતી' હોનારત સંબંધિત મૃત્યુની સંખ્યા

આકૃતિ ૨ દર્શાવે છે કે હોનારતો સંબંધિત મૌતની સંખ્યા છેલ્લાં ૫૦ વર્ષ (૧૯૬૬થી ૨૦૧૫)ના સમયમાં બધી જ કુદરતી હોનારતોમાંથી જોવા મળે છે. તે દર્શાવે છે કે આ સમયમાં હોનારતોથી થતાં મૃત્યુની સંખ્યા એકંદરે સ્થિર રહે છે, પરંતુ પ્રત્યેક કેટલાંક વર્ષોમાં વ્યાપક સ્તર પર મોટી ઘટનાઓ ઘટે છે. જોકે, આ ટોચની સંખ્યા છેલ્લાં ૨૦ વર્ષમાં (૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૦) ૧૯૭૦ અને ૧૯૮૦ (૧૯૭૦, ૧૯૭૬, ૧૯૮૧)ના દાયકાની સરખામણીમાં ઘણી ઓછી છે. આપણે કુલ વસ્તીને ધ્યાનમાં

લઈને આ આંકડો જોઈએ, તો હકીકતમાં મૃત્યુદર ઘટ્યો હોઈ શકે છે. આ માટેનું કારણ વહેલા ચેતવણી-સિસ્ટમ્સ, વધુ સારી સંચાર સુવિધા અને સરકારનાં વધુ અસરકારક પગલાં હોઈ શકે છે. જોકે, તેનાથી આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી. આ ગ્રાફમાં છેલ્લાં ૨૦ વર્ષમાં દર્શાવાયેલા ત્રણ ટોચના મૃત્યુદર - ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં સુનામી, ૨૦૦૮માં ઘાંમારમાં નરગીસ વાવાજોડું અને ૨૦૧૦માં જાપાનમાં હેતિ ભૂકૂપે ખૂબ જ મોટી હોનારતો હતી, જેમાં પ્રત્યેકમાં ૧,૦૦,૦૦૦થી વધુ લોકોનાં મોત

નીપણ્યાં હતાં. આ હોનારતો દર્શાવે છે કે ૨૧મી સદીમાં પણ ઓછી ફિક્વન્સી, હાઈ-ઇમ્પેક્ટની હોનારતોથી મૃત્યુદરનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું છે. સરકારે આવી મોટી હોનારતોનું જોખમ ઘટાડવા અને સૌથી બરાબર પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની જરૂર છે.

આકૃતિ-૩ કુદરતી હોનારતોના કારણે વૈશ્વિક સ્તરે થયેલા કુલ આર્થિક નુકસાન તરફ આપણું ધ્યાન દોરે છે. આ ગ્રાફ સીઆરઈડી-ઇએમડીએટીમાંથી મેળવાયેલા આંકડાઓ પર આધારિત છે.



આકૃતિ ૩ : વૈશ્વિક હોનારતોમાંથી કુલ આર્થિક નુકસાન

આકૃતિ ઉસુચવે છે કે બધાં જ નુકસાનોને ૨૦૧૪ની કિંમતો સાથે એડજસ્ટ કરવામાં આવ્યા છતાં લાંબા ગાળે આર્થિક નુકસાનનો વધારાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ બાબત દર્શાવે છે કે કુદરતી હોનારતોનું જોખમ હોય તેવા વિસ્તારોમાં મોટા પાયે મૂડી અસ્કામતો તેમજ આર્થિક પ્રવૃત્તિની સંખ્યાનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. આ આકૃતિને આકૃતિ ૨ (મૃત્યુદર) સાથે જોડવામાં આવે, તો એવા સંકેત મળે છે કે વિશ્વમાં હોનારતોના કારણે મૃત્યુદરના પ્રમાણમાં કંપણઃ ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આર્થિક નુકસાન અને આજીવિકાના નુકસાનને અટકાવવામાં કોઈ સફળતા હંસલ થઈ નથી.

ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટનું ભાવી

વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં હોગો

ફેમવર્કના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પરના વૈશ્વિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૧૫માં જાપાનના સેન્ડાઇમાં વર્લ્ડ-કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં આંતરરાષ્ટ્રીય સમાજ એક મંચ પર આવ્યો અને વર્ષ ૨૦૧૫થી ૨૦૩૦ના સમય માટે સેન્ડાઇ ફેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એસએફ્ડી આરઆર) અપનાવ્યો છે.

અગાઉના સેક્શનમાં કેટલાંક વૈશ્વિક ટ્રેન્ડ્સ રજૂ કરીને એસએફ્ડીઆરઆરની માહિતી અપાઈ છે. હોનારતોના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડા, હોનારતોથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા, આર્થિક નુકસાન અને ઈન્ફાસ્ટ્રક્ચરને નુકસાનમાં ઘટાડાના લક્ષ્યાંકે

હંસલ કરવા માટે એસએફ્ડીઆરઆરની રચના કરવામાં આવી છે. ઉપરાંત તે આયોજન અને વ્યૂહરચનાઓ, આંતરરાષ્ટ્રીય સહકાર તથા વહેલા ચેતવણીની દસ્તિએ ડિઝાસ્ટર રિસ્ક-રિડક્શનક્ષમતા સંબંધિત લક્ષ્યાંકે પણ નિશ્ચિત કરશે.

એસએફ્ડીઆરઆરની સાથે વર્ષ ૨૦૧૫માં અપનાવવામાં આવેલા અન્ય આંતરરાષ્ટ્રીય પોલિસી ફેમવર્કમાં પણ ડિઝાસ્ટર રિસ્ક-રિડક્શનના મહાવરને અપનાવવામાં આવી છે. ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્દમાંથી ૧૦ લક્ષ્યાંકે ડિઝાસ્ટર રિસ્ક-મેનેજમેન્ટ સંબંધિત છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યાંકેમાં હોનારતોનું જોખમ ઘટાડતાં તત્વોનાં સારાંશ માટે બોક્સ ૧ જૂઓ.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્દમાં ડિગ્રાસ્ટર રિસ્ક-રિડક્શન

ગોલ ૧ : કોઈપણ જગ્યાએથી દરેક સ્વરૂપમાં ગરીબી નાબૂદી.

ગરીબોને સક્ષમ બનાવવા સંબંધિત ટાર્ગેટ ૧.૫ તીવ્ર ગરીબી નાબૂદી માટે એક મહાવ્યૂહી વિકાસ વ્યૂહરચના તરીકે ડિઝાસ્ટર રિસ્ક-રિડક્શનની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.

ગોલ ૨ : ભૂખમરાનો અંત, અન્ન સલામતી અને પોષણમાં સુધારા માટે કૃષિ ક્ષેત્રની સમર્થતા

ટાર્ગેટ ૨.૪ મુખ્ય પ્રવાહમાં ડિઝાસ્ટર રિસ્ક-રિડક્શનમાં તાત્કાલીક આગોત્રા પગલાં લેવાની અને સક્ષમ આજીવિકા, અન્ન ઉત્પાદન અને ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કૃષિ ક્ષેત્રમાં કલાઈમેટ અડેપ્શન માટે આયોજન અને રોકાણની જરૂરિયાત પર ભાર મૂકે છે.

ગોલ ૩ : બધી જ વયના બધા લોકો માટે સ્વસ્થ જીવન અને સુખાકારીની ખાતરી કરવી

ટાર્ગેટ ૩.૩ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યજોખમો ઘટાડવા અને વહેલા ચેતવણીની વ્યવસ્થા સંબંધિત છે, તે સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા વધુ પગલાંની તકો રજૂ કરે છે.

ગોલ ૪ : બધા માટે સમાવેશક અને ન્યાયપૂર્ણ રીતે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાની ખાતરી કરવી

ટાર્ગેટ ૪.૭ શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા તથા તેને અપગ્રેડ કરવા પર ધ્યાન આપવા પર કેન્દ્રિત છે.

ગોલ ૫ : બધા માટે જળ અને શૌચાલયની ઉપલબ્ધતા અને ટકાઉ સંચાલન વ્યવસ્થાની ખાતરી કરવી

ટાર્ગેટ ૬.૬ જળસંબંધિત ઈકોસિસ્ટમના રક્ષણ અને તેની પુનઃસ્થાપના સંબંધિત છે, તે જળ સંબંધિત હોનારતોમાંથી ઝડપથી બહાર નીકળવાની સક્ષમતાને મજબૂત બનાવશે.

ગોલ ૬ : સક્ષમ ઈન્ફાસ્ટ્રક્ચર વિકસાવવું, સમાવેશક અને સસ્ટેનેબલ ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવું તથા નવીનીકરણનું પોષણ કરવું

ટાર્ગેટ ૮.૧ ટકાઉ અને સમર્થ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના વિકાસ સંબંધિત છે અને તે માત્ર વર્તમાન ઈન્ફાસ્ટ્રક્ચરના રક્ષણ

માટે જ નહીં, પરંતુ ભવિષ્યના ઈન્ફાસ્ટ્રક્ચરનાં રોકાણો માટે પણ ખૂબ જ મહત્વનો છે.

ગોલ ૧૧ : શહેરો અને માનવ વસાહતોને સમાવેશક, સલામત, સમર્થ અને ટકાઉ બનાવવા

આ લક્ષ્યાંક ડેટાના એક્શન ટાર્ગેટ્સ (૧૧.૧, ૧૧.૩, ૧૧.૪, ૧૧.૫, ૧૧.૬ અને ૧૧.૮) સેન્ડાઈ ફેમવર્કને અનુરૂપ શહેરી ઝૂપડપદ્ધિઓને અપગ્રેડ કરવા, શહેરી આયોજનના એકીકરણ, હોનારતોના જોખમની સામાજિક અને આર્થિક અસરો ઘટાડવા, શહેરી ગરીબોને સક્ષમ બનાવવા, શહેરી નીતિઓ અપનાવવા અને તેનો અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં તે વર્તમાન અને ભાવી વિકાસની સંભાવનાઓના રક્ષણ તથા સમગ્ર વિશ્વમાં વધુ સમર્થ અને સલામત શહેરો ઊભાં કરવાની ક્ષમતા વધારવાની ખાતરી કરવા પર પણ ધ્યાન આપે છે.

ગોલ ૧૩ : કલાઈમેટ ચેન્જ અને તેની અસરો સામે લડવા તાત્કાલીક પગલાં લેવાં

આ લક્ષ્યાંક ડેટાના લક્ષ્યાંકિત પગલાંઓમાં સમર્થ અને નવી પરિસ્થિતિઓમાં પણ સાનુકૂળતા સાથી શકે તેવી ક્ષમતા મજબૂત બનાવવા અને કલાઈમેટ ચેન્જનો સામનો કરવા એકીકૃત નીતિઓ અને આયોજનો, કલાઈમેટ અપનાવવા અંગે લોકોમાં જાગૃતિ વધારવા, વહેલા ચેતવણી (ટાર્ગેટ્સ ૧૩.૧થી ૧૩.૩ અને ૧૩.૨૬થી ૧૩.૬૦)ની તકો પૂરી પાડવા અને બધા જ સ્તર પર વિકાસના વ્યાપક માર્ગનું રક્ષણ કરવા હોનારતો અને કલાઈમેટની સમર્થતા વચ્ચે એકીકરણને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

ગોલ ૧૪ : સસ્ટેનેબલ વિકાસ માટે મહાસાગરો, સમુદ્રો અને દરિયાઈ સંસાધનો ટકાવી રાખવાં

ટાર્ગેટ ૧૪.૨ સસ્ટેનેબલ મેનેજમેન્ટ અને સંરક્ષણ તેમજ દરિયાઈ અને દરિયાંઠાની ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે હોનારતોનાં જોખમ ઘટાડવામાં યોગદાન આપી શકે છે અને સ્વસ્થ દરિયાઈ તથા દરિયાંઠાની ઈકોસિસ્ટમ માટેની માંગની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

ગોલ ૧૫ : ધરતી પરની ઈકોસિસ્ટમના ઉપયોગ અને તેના સંરક્ષણ તથા તેને પ્રોત્સાહન આપવું, જંગલોની જાળવણી, ડિસર્ટિક્ટિકેશન સામેની લડત અને જમીનના ધોવાણને અટકાવવું તથા બાયોડાયવર્સિટી નુકસાનને અટકાવવું.

ટાર્ગેટ એક્શન ૧૫.૧થી ૧૫.૪ અને ૧૫.૮ જંગલોની જાળવણી અને તેનું રક્ષણ, જમીનના ધોવાણને અટકાવવાની લડત, પર્વતીય ઈકોસિસ્ટમ અને તેની બાયોડાયવર્સિટી તથા એકીકૃત ઈકોસિસ્ટમ તેમજ રાષ્ટ્રીય અને સ્થાનિક આયોજનોમાં બાયોડાયવર્સિટીનાં મૂલ્યોની જાળવણી, વિકાસ-પ્રક્રિયા, ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના આ બધા જ પરિબળો સમર્થતા વિકસાવવામાં યોગદાન આપે છે. આ લક્ષ્યાંકો પણ સેન્ડાઈ ફેમવર્કને અનુરૂપ છે, જે જોખમ-વિશ્લેષણ અને આયોજનમાં સમાવેશક ઈકોસિસ્ટમ મારફત પર્યાવરણના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આમ, ઉપરથી એ બાબત સ્યાદ થાય છે કે આંતરરાષ્ટ્રીય નીતિઓના ક્ષેત્રમાં આ પરિબળો હોનારત જોખમધટાડાને એક મહત્વપૂર્ણ વિકાસ વ્યૂહરચના તરીકે સ્થાપિત કરે છે. આપણે હવે હોનારતોના સંચાલનથી હોનારતોનું જોખમ ઘટાડવાના સંચાલન તરફ આગળ વધવાની જરૂર છે. આ માટે હોનારતોનું જોખમ ઘટાડવા તરફ દોરી જતી બધી જ વિકાસ-પ્રવૃત્તિઓના અમલની જરૂર છે.

૧ સ્નોત : ૨૦૧૫, સીઆરઈડી અને યુએનઅાઈએસીઆર, ‘ગરીબી અને મૃત્યુ : હોનારત મૃત્યુદર ૧૯૯૬-૨૦૧૫’

૨ અહીં એ દર્શાવવું ખૂબ જ મહત્વનું છે કે વૈશ્વિક ટેટાસેટ ઈએમ્ડીએટીમાં હોનારતો માત્ર

જોખમી ઘટના તરીકે નોંધવામાં આવતી નથી, પરંતુ મૃત્યુદર અને અસરગ્રસ્ત લોકોની સંખ્યા ચોક્કસ મર્યાદાથી વધે, ત્યારે જ તેની નોંધ લેવામાં આવે છે.

લેખક એનીએમએના સભ્ય છે અને આપત્તિ જોખમ ઘટાડા તથા ૨૨ વર્ષ માટે સુધારાની સમસ્યા પર કામ કરે છે. તેઓ અગાઉ યુએનીપીમાં કામ કરતાં હતાં અને બાંગલાદેશ, ભારત, ઈન્ડોનેશિયા, ઈરાન, મ્યાન્માર, પાકિસ્તાન, ફિલિપીન્સ અને શ્રીલંકામાં આફત પણી વ્યૂહાત્મક સલાહ, આકારણીની જરૂરિયાતો, કાર્યક્રમ વિકાસ મારફતે આપત્તિ પછી સુધારાને સમર્થન આપે છે.

E-mail: kkishore@ndma.gov.in

જૈવિક આપત્તિઓ

જૈવિક આપત્તિઓ: કારણો અને ભવિષ્ય

ડૉ. અર્ચના સૂદ



જૈવિક આફિતો એટલે ચોક્કસ પ્રકારના જીવનો ઉપદ્રવ, જેના કારણે સમાજમાં મોટા પાયે જાનમાલની હાનિ કરે છે. આ પ્રકારની આફિત રોગચાળા સ્વરૂપે હોય છે, જે વાઈરસ કે કોઈ વિધાકત જીવાણું દ્વારા ફેલાય છે. ક્યારેક આ આફિત કોઈ સમુદાય પૂરતી મયાર્દિત હોય છે, તો ક્યારેક સર્વબ્યાપી. કોલેરા અને ઇન્ફ્લુઅન્ઝા એચ્ 1 એન્ 1 (સ્વાઈન ફ્લુ) રોગચાળો જૈવિક આફિતોનાં ઉદાહરણો છે. રોગચાળાના સ્તરે જૈવિક આફિતો કોઈ સમુદાય કે વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકોને અસર કરે છે, ત્યારે સર્વબ્યાપી જૈવિક આફિતો મોટા વિસ્તારને અસર કરે છે, કેટલીક વખત આખા ખંડ કે વિશ્વને ભરડામાં લે છે. કોલેરા રોગચાળાના સ્તરે જૈવિક આફિત છે, જ્યારે સ્વાઈન ફ્લુ સર્વબ્યાપી રોગચાળો છે. અન્ય રોગચાળાઓનાં ઉદાહરણો ઇબોલા, ડેન્યુનો તાવ, મેલેરિયા અને ઓરી છે.



વિક આફિતો એટલે ચોક્કસ પ્રકારના જીવનો ઉપદ્રવ, જેના કારણે સમાજમાં મોટા પાયે જાનમાલની હાનિ કરે છે. આ પ્રકારની આફિત રોગચાળા સ્વરૂપે હોય છે, જે વાઈરસ કે કોઈ વિધાકત જીવાણું દ્વારા ફેલાય છે. ક્યારેક આ આફિત કોઈ સમુદાય પૂરતી મયાર્દિત હોય છે, તો ક્યારેક સર્વબ્યાપી. કોલેરા અને ઇન્ફ્લુઅન્ઝા એચ્ 1 એન્ 1 (સ્વાઈન ફ્લુ) રોગચાળો જૈવિક આફિતોનાં ઉદાહરણો છે. રોગચાળાના સ્તરે જૈવિક આફિતો કોઈ સમુદાય કે વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકોને અસર કરે છે, ત્યારે સર્વબ્યાપી જૈવિક આફિતો મોટા વિસ્તારને અસર કરે છે, કેટલીક વખત આખા ખંડ કે વિશ્વને ભરડામાં લે છે. કોલેરા રોગચાળાના સ્તરે જૈવિક આફિત છે, જ્યારે સ્વાઈન ફ્લુ સર્વબ્યાપી રોગચાળો છે. અન્ય રોગચાળાઓનાં ઉદાહરણો ઇબોલા, ડેન્યુનો તાવ, મેલેરિયા અને ઓરી છે.

જૈવિક આફિતોનો સંદર્ભ પરોપજીવીઓ, વાઈરસ, બોક્ટેરિયા, ફૂગ અને પ્રોટીન દ્વારા ઉત્પાદિત જૈવિક પદાર્થોને કાર્બનિક પદાર્થોને સાથે છે, જે જીવો, ખાસ કરીને મનુષ્યો માટે જોખમકારક છે, તેમાં તબીબી કચરો કે સૂક્ષ્મ જીવો, વાઈરસના નમૂના કે ટોકિસન (જૈવિક સ્ટોટોમાંથી)ના નમૂના છે, જે માનવીય સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેમાં અન્ય પ્રાણીઓને નુકસાનકારક પદાર્થોની પણ સામેલ હોઈ શકે છે. થાસોથ્રાવાસ દ્વારા, શરીરમાં ચેપી પ્રવાહીના સંપર્ક દ્વારા કે

પ્રદૂષિત ચીજવસ્તુઓ સાથે સંપર્ક દ્વારા આ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ જૈવિક જોખમો દ્વારા મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાનકારક અસર થવાનું ગણ પ્રકારે જોખમ છે : ચેપ, એલર્જી અને પોઈજનિંગ.

સામાન્ય રીતે જૈવિક જોખમો અને તેની સાથે સંબંધિત ચિહ્નોનો ઉપયોગ ચેતવણી સ્વરૂપે થાય છે. આ સંકેતો ૧૮૮૬માં ચાર્લ્સ બોલ્ડવિને વિકસાવ્યાં હતાં, જેઓ નિયંત્રણ સમાવેશક ઉત્પાદનો પર ડાઉ કેમિકલ કંપની માટે કામ કરતાં પર્યાવરણ-હેલ્થ એન્જિનિયર હતા. તેનો ઉપયોગ જૈવિક સામગ્રીના લેબલિંગ માટે થાય છે, જે સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમ ધરાવે છે, જેમાં વાઈરલ નમૂના અને સોયની જરૂર સામેલ છે. યુનિકોડમાં જૈવજોખમનો સંકેત U+2623 છે.



જૈવિક આફિતો કુદરતી આપત્તિઓ કે જૈવિક યુદ્ધ હોઈ શકે છે.

કુદરતી જોખમો હવામાન અને

આબોહવામાં તીવ અને પ્રતિકૂળ ફેરફાર સાથે સંબંધિત ઘટનાઓ હોય છે, જે દુનિયાના તમામ ભાગોમાં કુદરતી રીતે બને છે. જ્યારે લોકોનાં જીવન અને આજીવિકા નાશ પામે છે, ત્યારે કુદરતી જોખમો કુદરતી આફિતો બની જાય છે. સામાન્ય રીતે જ્યારે દૂષિત વાહકનાં કેટલાંક સ્વરૂપો (સામાન્ય રીતે બેક્ટેરિયા કે વાઈરસ) વસ્તિમાં પ્રવેશ કરે છે, ત્યારે જૈવિક આફિતો વિકસે છે. આ વાહકો તેમના સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણમાં રહે છે. જ્યારે રોગચાળો ફાટે છે અને આ રોગચાળો આપત્તિનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કોઈ ચોક્કસ સર્વસંમતિ પ્રવર્તતી નથી.

રોગચાળો, નિર્ણય લેવાની પ્રક્રિયા, સલાહકાર સંસ્થા અને કટોકટી, તબીબી રાહત પ્રદાન માટેની જવાબદારી સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની છે. બંધારણ મુજબ, સ્વાસ્થ્ય રાજ્ય સરકારનો વિષય છે, એટલે જૈવિક આપત્તિ સમયે કામ કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે રાજ્ય સરકારની છે. નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ કમ્પ્યુનિકેન્ચ ડિસ્ટ્રિક્શન (એનાઇસીડી) રોગચાળાની તપાસ કરવા માટે નોડલ એજન્સી છે. એનાઇસીડી/ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) શિક્ષણ/તાલીમ, સંશોધન અને પ્રયોગશાળા સર્વ્યકારી પ્રદાન કરે છે.

જૈવિક યુદ્ધ (બીડિબલ્યુ) — જે જીવાણુ યુદ્ધ તરીકે પણ જાણીતું છે — બેક્ટેરિયા, વાઈરસ અને ફૂંગ જેવા જૈવિક વિષાક્ત કે ચેપી વાહકોનો ઉપયોગ મનુષ્ય, પ્રાણીઓની કટ્લેઆમ કરવાના કે ગ્રહ પર ઉત્પાત મચાવવાના આશય સાથે કરવામાં આવે છે. જૈવિક શસ્ત્રો (ધણી વખત ‘જૈવશસ્ત્રો’, ‘જૈવજોખમ એજન્ટો’ કે ‘બાયો-એજન્ટ’ તરીકે ઓળખાય છે) જીવ છે કે રેલિકા છે, જેનું પુનઃઉત્પાદન યજ્માન જીવની અંદર થાય છે.

જીવાણુ યુદ્ધ પણ એક પ્રકારનું જૈવિક શસ્ત્ર ગણાય છે. એનબીસી પરમાણુ, જૈવિક

અને રાસાયણિક શસ્ત્રોનું ટૂંકું નામ છે, જેનો ઉપયોગ સામ્યુહિક વિનાશ માટે થાય છે. જૈવિક શસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રો વચ્ચે બેળસેળ થાય છે, કારણ કે જીવો દ્વારા જે વિષાક્ત પદાર્થો પેદા થાય છે, તેને જૈવઆતંક પણ ગણી શકાય છે.

ગૃહસંબંધિત મંત્રાલય (એમએચેમે) જૈવશસ્ત્રો માટે મુખ્ય મંત્રાલય છે અને તેના મેનેજમેન્ટ માટે સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલય સાથે ભાગીદારી કરે છે. એમએચેમે જોખમની ધારણાઓનું મૂલ્યાંકન કરવા, પ્રતિરોધ વ્યવસ્થા સ્થાપિત કરવા અને આંતરિક ઉપયોગી જાણકારી પ્રદાન કરવા માટે જવાબદાર છે.

વિશ્વ આરોગ્યસંસ્થા રોગચાળાની ચેતવણી આપવા અને તેને પ્રતિસાદ આપવા વૈશ્વિક સ્વાસ્થ્યસુરક્ષામાં પ્રદાન આ રીતે કરે છે : (૧) પ્રયોગશાળાનાં ઉપકરણો અને રોગચાળાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય નિરીક્ષણ કાર્યક્રમો મજબૂત કરવા; (૨) રોગના પ્રસાર પર અધિકત માહિતીના પ્રસાર અને પ્રતિસાદ માટે ટેક્નિકલ ટેકો પ્રદાન કરવો અને (૩) વૈશ્વિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રોગચાળા માટે જવાબદાર સંભવિત કારણો પર માહિતી એકત્ર કરવી, તેનું વિશ્લેષણ કરવું અને તેની વહેચણી કરવી.

અમેરિકાનું સેન્ટર ફોર ડિસ્ટ્રિક્શન કન્ટ્રોલ (સીરીસી) જૈવજોખમને વર્ગીકૃત કરે છે, જે ચાર જૈવસુરક્ષાના સ્તર કે બીએસએલ ૧-૪માં જૈવિક આપત્તિનું કારણ બની શકે છે.

● **બીએસએલ ૧ - બેક્ટેરિયા** અને વાઈરસ જેમાં બેસિલિસ સબટિલિસ, કેનાઈન ડેપિટાઈટીસ, શીતળા, ઓરી સામેલ છે, કેટલાક કોષસંવર્ધક અને બિનચેપી બેક્ટેરિયા પણ સામેલ છે. આ સ્તરે સાવચેતી ઓછામાં ઓછા હોય છે, વધુમાં વધુ મોજાં ધારણ કરવામાં આવે છે અને ચહેરાને ઢાંકવામાં આવે છે.

● **બીએસએલ ૨ - મનુષ્યને થતાં હળવા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા અને વાઈરસ, અથવા પ્રયોગશાળામાં એરોસોલ મારફતે ફેલાતા, જેમ કે હિપેપાઈટીસ એ, બી અને સી, ઇન્ફ્લુઅન્જા એ, લાઈમ રોગ, સાલ્મોનેલા, ટેન્યુ, એચઆઈવી. બીએસએલ ૨ સલામતીના દેતુસર કેટલાંક આત્યંતિક પગલાં દે છે, જેમાં શુદ્ધીકરણ અને જૈવિક સલામતી ડેવિનેટ માટે ઓટોકલેસનો ઉપયોગ સામેલ છે.**

● **બીએસએલ ૩ - એન્ટ્રેક્સ, વેસ્ટ નાઈલ વાઈરસ, વેનેજુઅલિયન ઈક્વાઈન એન્સેફલાઈટ્સ, સાર્ક વાઈરસ, મર્સ કોરોના વાઈરસ, હેન્ટાવાઈરસ, ટીબી, ટાઈફસ, રિફ્ક્ર વેલીફ્લિંગર, રોકી માઉન્ટેઈન ફિલ્ફર, કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગ માટે જવાબદાર બેક્ટેરિયા અને વાઈરસ છે. મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોલિયમ ફાલ્સપારમ અને ટ્રાઈપેનોસોમિઅસિસ માટે ટ્રાઈપેનોસોમા કૂઝી જેવા પરોપણીઓ આ સ્તર અંતર્ગત આવે છે. તે માટે સલામતીનાં વધારે કડક ધારાધોરણોની જરૂર છે, જેમાં હવામાંથી ચેપ અટકાવવા, જૈવિક જોખમો અટકાવવા રેસ્પિરેટસનો ઉપયોગ સામેલ છે.**

● **બીએસએલ ૪ - જે રોગની સારવાર કે રસી જાણીતી નથી તેવા વાઈરસ, જેમ કે મારબર્ગ વાઈરસ, ઈબોલા વાઈરસ, લાસ્સા ફીવર વાઈરસ, કિમિયન-કોગો હેમરેજિક ફીવર અને અન્ય હેમરેજિક રોગો. વેરિઓલા વાઈરસ (શીતળા) વાહક છે, જે રસી ઉપલબ્ધ હોવા છતાં બેએસએલ-૪ પર કામ કરે છે. નિવારણ માટેના પગલાંમાં પોઝિટિવ પ્રેસર પર્સનલ**

સ્યૂટનો ઉપયોગ સામેલ છે, જેમાં હવાનો પુરવઠો અલગ કરવામાં આવે છે. પ્રયોગશાળાના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગમાં એકથી વધારે શાવર્સ હોવાં જોઈએ, વેક્યુમરૂમ, અલ્ટ્રાવાયોલેટ રૂમ, સ્વાયત્ત નિદાનવ્યવસ્થા હોવી જોઈએ તથા જૈવિક જોખમોને તમામ સ્તરે નાભૂદ કરવા અન્ય સલામતીના પગલાં લેવા જોઈએ. એકથી વધારે એરલોક્સનો ઉપયોગ કરવો જોઈએ અને વીજપુરવઠાની દષ્ટિએ સુરક્ષિત હોવા જોઈએ. પ્રયોગશાળાને પ્રામ તમામ હવા અને જળસેવાઓ પ્રદૂષણમુક્ત પ્રક્રિયાઓમાંથી પસાર થવી જોઈએ. અત્યારે આ સ્તરે બેક્ટેરિયાનું વર્ગિકરણ થતું નથી.

કાયદા

દેશની આરોગ્યનીતિના નિયંત્રણ અને સંચાલન માટે ધ્યાં કાયદા છે. સરકાર વિવિધ રોગોને નિયંત્રણમાં લેવા આ કાયદા લાગુ કરી શકે છે:

1. જળ (પ્રદૂષણ-નિયંત્રણ અને નિવારણ) ધારો, ૧૯૭૪
2. હવા (પ્રદૂષણ-નિયંત્રણ અને નિવારણ) ધારો, ૧૯૮૧
3. પર્યાવરણ (સંરક્ષણ) ધારો, ૧૯૮૬ અને નિયમો (૧૯૮૬) આ કાયદો જૈવતબીબી કચરા (મેનેજમેન્ટ અને હંડલિંગ) નિયમો, ૧૯૮૮ માટે પણ લાગુ પડે છે, જેનો ઉદ્દેશ હોસ્પિટલ/ જૈવતબીબી કચરાનું નિયંત્રણ કરવાનો છે
4. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (ડીએમ ધારો), ૨૦૦૫ આપ્તિના અસરકારક નિવારણ માટે પ્રદાન કરવામાં આવ્યો છે. તે આપ્તિના નિવારણ, શમન, તૈયારી, પ્રતિસાદ,

યોજના જાન્યુઆરી-૨૦૧૭

સુધારો અને પુનર્ગઠન તથા જૈવિક આપ્તિઓ માટે તમામ સ્તરે સંસ્થાકીય અને કાર્યકારી માળખું પ્રદાન કરે છે, જે ખાનગી ક્ષેત્રની આરોગ્ય સુવિધા માટે કવાંરેન્ટાઇન પગલાં જરૂરી બનાવશે તેમજ દર્દીની વિસ્તૃત સારસંભાળ પણ સુનિશ્ચિત કરે છે.

વ્યાવસાયિક અને કાર્યસ્થળે લોકો જૈવિક જોખમોના સંપર્કમાં આવી શકે છે.

- તબીબી વ્યવસાયમાં તબીબી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પ્રયોગશાળાઓમાં ટેક્નિશિયન્સ;
- હેલ્પકેર સેવાઓ;
- સાફસફાઈ સેવાઓ અને સંપત્તિનું વ્યવસ્થાપન;
- પ્રવાહી કચરો અને કચરાનાં કલેક્શન અને નિકાલમાં પર્યાવરણીય સ્વચ્છતાની સેવામાં સંકળાયેલા કર્મચારીઓ;
- કૃષિ, મત્ત્ય, પશુસંવર્ધન સેવાઓ અને ઉત્પાદનઉદ્યોગો, જેમાં વનસ્પતિ કે ગ્રાણી આધારિત કાચા માલ, જેમકે કાગળ અને કાગળનાં ઉત્પાદનો, ટેક્સ્ટાઇલ, ચામણું અને ફર અને સંબંધિત ઉત્પાદનો;
- હોટેલ્સ અને રેસ્ટોરાં જેવી સેન્ટ્રલ એરકન્ડિશનિંગની આસપાસના વિસ્તારોમાં ઠંનોર કાર્યસ્થળો. કાર્પેટ અને વોલપેપર્સ જેવી ફિનિશિંગ સામગ્રીઓ, ભીનાં વાસણો, જેમાં સૂક્ષ્મ જીવોના સંવર્ધન માટે પાણી રહે છે.

કાર્યસ્થળે નિવારણ અને નિયંત્રણનાં પગલાં

જૈવિક જોખમોના નિવારણ અને નિયંત્રણમાં લેવાનો મૂળભૂત ઉપાય પ્રદૂષણના સ્ત્રોતો દૂર કરવાનો છે.

1. એન્જિનિયરિંગ નિયંત્રણો.

વેન્ટિલેશનમાં સુધારો, પ્રદૂષિત સ્ત્રોતોમાંથી આંશિક અલગાવ, નકારાત્મક દબાણ અને અલગ વેન્ટિલેશન તથા એરકન્ડિશનિંગ સિસ્ટમ સ્થાપિત કરવી (ઉદાહરણ તરીકે ચેપીરોગો માટેના મેડિકલ વોર્ડમાં) અને અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો ઉપયોગ પ્રસારને અટકાવવામાં મદદ મળી શકે છે.

2. વ્યક્તિગત સ્વચ્છતા જેમ કે કામ અગાઉ અને પછી હાથ ધોવા, સંરક્ષણાત્મક વસ્ત્ર ધારણ કર્યાંગાઉ અને પછી લિક્નિવડ સોપ સાથે હાથ ધોવા. આચેપ સામે રક્ષણ મેળવવાની સરળ અને સૌથી મૂળભૂત પદ્ધતિ છે.
3. વ્યક્તિગત સંરક્ષણ. કર્મચારીઓએ વ્યક્તિગત સંરક્ષણ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ અને વ્યક્તિગત સાફસફાઈના નિયમોનું પાલન કરવું જોઈએ. તેમાં માસ્ક, મોઝાં, સંરક્ષણાત્મક વસ્ત્રો, આંખનું કવચ, ચહેરા પરનું કવચ અને શૂકવર્સ સામેલ છે.

- a. સંરક્ષણાત્મક વસ્ત્રો : સંરક્ષણાત્મક વસ્ત્રોમાં હૂડ, ગાઉન, એપ્રો, માથા અને શૂના કવર્સ સામેલ છે; જે વોટરપ્રૂફ હોવાં જોઈએ કે લોહી, ટીપાં કે શરીરનાં અન્ય પ્રવાહીઓ પ્રવેશી ન શકે તેવાં હોવાં જોઈએ. તેના પગલે ખુલ્લા ધા કે કામદારોનાં પોતાનાં વસ્ત્રોને ચેપ લાગતો નથી અને વિષાક્ત જીવાણુઓનો પ્રસાર અટકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં સંરક્ષણાત્મક વસ્ત્રોને શુદ્ધ કર્યા પછી પુનઃઉપયોગ થઈ શકે. તેનો ઉપયોગ કરતાં અગાઉ ફરી ચકાસવા પડશે અને નુકસાન થયું હોય તો તેને બદલવાં પડશે.
- b. ગોગલ્સ/ચહેરા પરનું કવચ : સેફ્ટી ગોગલ્સ/ગલાસ અને ચહેરા પરના

- કવચથી વિષાકત લોહી, ટીપાં કે શરીરનાં અન્ય પ્રવાહીઓનું વહન કરતાં જીવાણું માંથી આંખોનું સંરક્ષણ કરી શકાય છે, જે કષ મારફતે શરીરમાં પ્રવેશ કરી શકે છે.
- c. મોજાં : મોજાં લોહી, ટીપાં, શરીરનાં પ્રવાહીઓ અને શરીરની અન્ય પેશીઓને ચેપ કે વિષાકત ચીજવસ્તુઓથી હાથનું રક્ષણ કરે છે તથા જ્યારે આંખ, મોંકે નાકને સ્પર્શ કરો, ત્યારે ચેપ લાગવાની સંભાવના ટાળી શકે છે. મોજાંથી ખુલ્ખાં ધાને જીવાણું સામે રક્ષણ મળે છે. મોટા ભાગનાં મોજાં ઉપયોગ કર્યા પછી ડિસ્પોઝેબલ હોય છે. મોજાં અને જોખમકારક પાદથોનું સંચાલન કરવા ધારણ કરી શકાશે.
- d. શૂનાં કવર્સ: શૂનાં કવર કાર્યસ્થળની બહાર જીવાણું ઓનો પ્રસાર અટકાવે છે. સામાન્ય રીતે આ કવર ડિસ્પોઝેબલ હોય છે. તે જળપ્રતિરોધક હોવાં જોઈએ અને લીસાં ન હોવા જોઈએ. સાઈઝ ફિટ હોવી જોઈએ, જેથી અવરજવરમાં અવરોધ ઊભો ન થાય અને પગમાં વિષાકત પદાર્થોનો પ્રવેશ પણ અટકાવી શકાય.
૪. શુદ્ધીકરણ અન્ય ગરમી કે દબાણ આપવાની પ્રક્રિયા છે, જેથી બેક્ટેરિયા દૂર થાય છે અથવા સૂક્ષ્મ જીવો દૂર કરવા બાયોસાઇંડનો ઉપયોગ કરવામાં આવે છે. સંપૂર્ણ શુદ્ધીકરણ પ્રક્રિયામાં પ્રદૂષણ-સંકુલોને જંતુમુક્ત કરવાનું અને કોઈ પણ વિષાકત પદાર્થો દૂર કરવામાં આવે છે, જેથી કર્મચારીઓને નુકસાન થતું નથી.
૫. શાસોઅધ્યવાસમાં સુરક્ષા. શાસોઅધ્યવાસ માટે યોગ્ય સંરક્ષણ-ઉપકરણનો ઉપયોગ કરવો જૈવિક જોખમોથી પર્યાપ્ત સંરક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ ઉપકરણ છે.
- સર્જિકલ માસ્ક - સામાન્ય રીતે તે વણાટ ન ધરાવતા રેખાના ત્રણ સ્તરો ધરાવે છે. તે મોટા રેસ્પિરેટરી ડ્રોપ્લેટ્સ સામે સંરક્ષણ પ્રદાન કરે છે:
 - N95 અથવા શાસોઅધ્યવાસનું ઊંચું સ્તર - આ પ્રકારના ફિલ્ટર અણુઓ અને પ્રવાહી ટીપાને અણુઓના નાના કદમાં વિભાજિત કરે છે, જેથી શાસોઅધ્યવાસમાં એરોસોલ અને સૂક્ષ્મ જીવો સામે સંરક્ષણ મળતું નથી.
 - પાવર્ડ એંડ ઘોરિઝાંગ રેસ્પિરેટર, પીએપીઆર. આ પ્રકારના રેસ્પિરેટરનો ઉપયોગ યુઝરને ફિલ્ટર મારફતે હવા પ્રદાન કરવા ઈલેક્ટ્રિક બ્લોઅર તરીકે થાય છે, જે ધારણ કરવા માટે અનુકૂળ છે.
 - હવાનો પુરવઠો પ્રદાન કરતાં રેસ્પિરેટર્સ. સ્વચ્છ હવા એરકોમ્પ્રેસર કે હોઝ મારફતે હાઈ-પ્રેસર સિલિન્ડર દ્વારા સપ્લાય થાય છે. જૈવજોખમનો પ્રકાર, કામનો પ્રકાર અને કાર્ય માટે વાતાવરણ શાસોઅધ્યવાસ માટે સુરક્ષા આપત્તા ઉપકરણની પસંદગી નક્કી કરશે.
૬. જૈવિક દ્રષ્ટિએ જોખમકારક બેગનો નિકાલ
- માસ્ક, મોજાં, જૈવિક પ્રદૂષિત સંરક્ષણાત્મક વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી તેનો નિકાલ કરવા તેને બેગમાં કે કાગળ સાથે વાંટીને મૂકી અલગ મૂકી ઢેવી જોઈએ. બેગને સીલ કરો અને તેને વિશેષ નિકાલ માટે નિયુક્ત સ્થળમાં મૂકો.
૭. તબીબી સારવાર : કોઈ પણ કટોકટીની સ્થિતિ માટે તબીબી સારવાર અને ચોક્કસ સારવાર
- નિયમિત પગલાં
- પોખક અને સંતુલિત ભોજન કરવું.
 - રસીકરણ સતત થવું જોઈએ.
 - ભીડમાં જવાનું ટાળો.
 - સારાં હવાઉઝસ.
 - ગરમ અને ઠંડા હવામાન સામે સંરક્ષણ.
- જૈવિક સંકટનું નિવારણ
- નિવારણ અને તૈયારી જૈવિક જોખમોની આકારણી, તબીબી અને જાહેર સ્વાસ્થ્યનાં પરિણામો, તબીબી પગલાં અને લાંબા ગાળાની વ્યુહરચનાઓ પર કેન્દ્રિત કરશે, જે આફત પછીનાં પરિણામોની અસર ઘટાડામાં ઉપયોગી છે. નિવારણ અને તૈયારીનાં મહત્વપૂર્ણ પાસામાં રોગચાળા સાથે સંબંધિત વ્યવસ્થા ઊભી કરવી અને આ માટે અગાઉથી રસીકરણ કરવાની પ્રક્રિયા સામેલ હશે, મજબૂત નિરીક્ષણ વ્યવસ્થા સામેલ હશે, જે અગાઉથી ચેતવણીની નિશાનીઓ આપી શકે છે. વળી, આ આંતરરાષ્ટ્રીય સતરનું સંકટ છે કે કેમ એ નક્કી કરવા રોગચાળાનો સંકેત મેળવવાની પ્રક્રિયા છે તથા પ્રયોગશાળાઓ અને છોસ્પિટલ માટે ક્રમતાનિર્મિશ્નાનું તંત્ર છે, જે નિદાન, તપાસ અને વ્યવસ્થાપનને ટેકો આપી શકે છે. જૈવિક સંકટોના નિવારણ માટે મહત્વપૂર્ણ માધ્યમોમાં નીચેના સામેલ છે:
- નિર્ભળતાનું વિશ્લેષણ અને જોખમની આકારણી
 - પર્યાવરણનું વ્યવસ્થાપન
 - i) પાણીનો સુરક્ષિત પુરવઠો અને સુઅેજ પાઈપલાઈનની ઉચ્ચિત જાળવણી, જે લાંબા ગાળે જૈવિક સંકટો અને કોલેરા, હિપેટાઈટીસ, ડાયરિયા અને મરડા જેવા પાણીજન્ય રોગચાળાના નિવારણમાં ઉપયોગી પુરવાર થશે.



- ii) વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે, જે માટે સુમદ્દાયમાં જગૃતિ લાવવી પડશે. આ માટે ધોવાની, સાફ્ટસફાઈની અને સ્નાન કરવાની સુવિધાઓની જોગવાઈ ઊભી કરવી પડશે તથા સ્લીપિંગ ક્વાર્ટ્સ વગેરેમાં ગીયતા ટાળવી પડશે.
- iii) રોગવાહકનું નિયંત્રણ: રોગવાહક નિયંત્રણ કાર્યક્રમોના મહત્વપૂર્ણ ઘટકો છે: એ. પર્યાવરણીય ઈજનેરી કાર્ય અને જેનેરિક સંકલિત વાહક નિયંત્રણ પગલાં. બી. પાણીના વ્યવસ્થાપન દ્વારા ઉપદ્રવ નાબૂદી, સી. સ્થિર પુલની સફાઈ અને પાણી જમા ન થવા દેવું. ડી. જંતુનાશકોનો નિયમિત છંટકાવ કરીને રોગવાહકનું નિયંત્રણ. ઈ. ઉંદરની વસતિ પર નજર રાખવી.
- iv) મૃતદેહોને દફન કરવા/તેનો નિકાલ કરવો
૩. આફત પછી રોગચાળાનું નિવારણ: કુદરતી કે માનવસર્જિત એમ કોઈ પણ પ્રકારની આફત પછી રોગચાળો ફેલાવાનું જોખમ વધારે હોય છે. આ પ્રકારની આફતોનો સામનો કરવા નિવારણાત્મક પગલાં લેવામાં આવશે.
૪. સંકલિત રોગનિરીક્ષણ વ્યવસ્થા: નિરીક્ષણ ટીમ સંભવિત સ્ટોરો, પ્રસારની પદ્ધતિઓ પર નજર રાખશે
- પ. અને રોગચાળાની તપાસ કરશે.
૫. રોગચાળાનું નિદાન અને નિયંત્રણ ચાર મૂળભૂત પગલાં ધરાવશે :
- પ્રાથમિક હેલ્પકોર તબીબો દ્વારા નિદાન અને ઓળખ
 - જાહેર આરોગ્ય સત્તામંડળને માહિતીની દેખરેખનો સંચાર
 - દેખરેખ માટેના આંકડાના રોગચાળાનું વિશ્લેષણ
 - ઉચિત તબીબી સારવાર અને જાહેર સ્વાસ્થ્યના પગલાંની ડિલિવરી
 - ફાર્માસ્યુટિકલ દરમિયાનગીરી: ડિમોગ્રાફિક્સેન્સ, રસીકરણ અને અન્ય નિવારણાત્મક પગલાં
 - જૈવસલામતી અને જૈવસુરક્ષા બેકટેરિયા, વાઈરસ કે ટોકિસન સાથે પ્રયોગશાળામાં નવીન નિયંત્રણ માટે વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે, જે જૈવિક આપત્તિ માટે સંભવિત સ્ત્રોત બની શકે છે.
 - જૈવિક વાહકો સામે મહત્વપૂર્ણ બિલ્ડિંગ્સનું નિર્માણ અને ઓફિસનું સંરક્ષણ, જ્યાં જરૂર પડે, ત્યારે અધિકૃત અધિકારીને યોગ્ય ચકાસણી દ્વારા પ્રવેશ નિયંત્રિત થઈ શકશે. એર કન્ડિશનિંગ સુવિધાઓના વેન્ટિલેશનમાં એચીપીએ ફિલ્ટર્સ સ્થાપિત કરવાથી ચેપી સુક્ષ્મ જીવોને મહત્વપૂર્ણ બિલ્ડિંગ્સની અંદર હવાનું

પરિભ્રમણ અટકાવી શકાશે. ત્યાર બાદ અસરકારક પ્રદૂષણમુક્તિ અને સલામતીની પ્રક્રિયા સામેલ હશે.

૬. વ્યક્તિગત અને જાહેર આરોગ્ય શિક્ષણની તાલીમ.

ઉપસંહાર

જૈવિક જોખમને દૂર કરી શકાય છે. અથવા તેઓ સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે અને કર્મચારીઓની કામગીરીને પ્રતિકૂળ અસર થાય છે. આપણે આસપાસ સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા જૈવિક જોખમોનું નિયંત્રણ કરવું જોઈએ.



- Step 1: Wash palms and fingers.
 Step 2: Wash back of hands.
 Step 3: Wash fingers and knuckles.
 Step 4: Wash thumbs.
 Step 5: Wash fingertip.
 Step 6 : Wash wrists.

લેખક રોહિણી, દિલ્હીના ઈએસઆઈસી ટેન્ટલ કોલેજ અન્ડ હોસ્પિટલ બાયોકેમિસ્ટ્રીના હેડ છે તથા ૨૦ વર્ષથી વધારે શિક્ષણ અને નૈદાનિક પ્રયોગશાળામાં અનુભવ ધરાવે છે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના એનઅબીએલ દ્વારા નિયુક્ત ટેક્નિકલ એસેસર છે, જેઓ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ વિવિધ નૈદાનિક પ્રયોગશાળાઓની માન્યતા માટે જવાબદાર છે.

E-mail: archanasood65@yahoo.com

આપત્તિ વ્યવસ્થાપનમાં અસરકારક કોમ્પ્યુનિકેશનની ભૂમિકા અને મહત્વ

સી. કે. નાયક



કોમ્પ્યુનિકેશન ટેકનોલોજીનું અમલીકરણ ઉપશમન, તૈયારી, પ્રતિભાવ અને પુનર્વસન તરીકે ઓળખાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ ચાર અલગ તબક્કામાં ભૂમિકા ધરાવે છે. પરંતુ મોટા ભાગે તેનો પરંપરાગત રીતે પ્રતિભાવ અને ઉપશમન તબક્કામાં અમલ કરાય છે. છેલ્લાં બે

દાયકાઓ દરમિયાન ઉદ્ભબવેલી નવી કોમ્પ્યુનિકેશન અને ઇન્જિનીયરિંગ ટેકનોલોજીને જુદ્દી-જુદ્દી કોમ્પ્યુનિકેશન વ્યવસ્થાઓના સંકલનની વ્યાપક સંભાવનાઓ પેદા કરી છે. ઇન્ટરનેટ, મોબાઇલ-ફોન, ફેક્સ, ઈમેલ, રેડિયો અને ટેલિવિજન સહિત વિવિધ કોમ્પ્યુનિકેશન વ્યવસ્થાઓની આંતરકિયાશીલતા ઉત્તરોત્તર કાર્યશીલ બની રહી છે. તેના પરિણામે ડિઝાસ્ટરનાં ઉપશમન અને નિવારણમાં કોમ્પ્યુનિકેશન ટેકનોલોજીના અમલીકરણની સંભાવનાઓ પણ વધી રહી છે. કટોકટીના પ્રસંગો અને આપાતકાલીન પરિસ્થિતિ જેમાં મોટા ભાગે અભ્યવસ્થા હોય છે, કોમ્પ્યુનિકેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ તબક્કાઓ દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સમૃદ્ધાયો અને વાતાવરણ સામે જોખમો નિયાતિત કરવા કટોકટી દરમિયાન કોમ્પ્યુનિકેશનમાં પગલાંઓની વાપક શ્રેષ્ઠીનો ઉપયોગ થાય છે. આપત્તિ ત્રાટે તે પહેલાં ટેલિકોમ્પ્યુનિકેશનનો ઉપયોગ તોળાઈ રહેલા જોખમ અંગે માહિતીનું પ્રસારણ કરવા કરી શક્ય છે.



જવાયુમાં જરૂરી પરિવર્તન અને સમગ્ર વૈશ્વિક સમાજમાં વધી રહેલા સંઘર્ષોના કારણે તાજેતરનાં વર્ષોમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. અને તેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મહત્વ પણ ખૂબ જ વધી ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કિસ્સાઓમાં વધારાની સાથે સાથે પ્રત્યાયન (કોમ્પ્યુનિકેશન)ની ભૂમિકા અને મહત્વ પણ વધ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ અને હેડલાઈન બનાવવાના દિવસોમાં આ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિઓમાં પત્રકારો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અસરગ્રસ્ત લોકોને જેમ બને તેમ જલદી મદદ કરવાનો હેતુ હોવા છતાં તેઓ અવાર-નવાર ડિઝાસ્ટર કાર્મચારીની સંભાળી રહેલા કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઊતરે છે. જો યોગ્ય સંકલન ન હોય તો તેના પરિણામે તમામ ત્રણોય હિત ધારકો - ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓ, પીડિતો અને પત્રકારો પ્રભાવિત થાય છે.

પીડિતોને તાલીમ આપવા માટે સામાન્ય રીતે સામૂહિક રીતે અગાઉથી જાગૃત કરવા સિવાય કોઈ વ્યવસ્થા નથી. આ જ બાબત ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓને લાગુ પડે છે, કારણ કે તેઓ પહેલેથી તાલીમબદ્ધ હોય છે. પરંતુ ડિઝાસ્ટર કવરેજ કરી રહેલા પત્રકારોને ઘટનાસ્થળે કેવી રીતે પહોંચવાથી મારીને શું સાવધાનીઓ તેમને રાખવી જોઈએ ત્યાં સુધી તાલીમબદ્ધ કરવાની જરૂર છે. આથી પત્રકારોને ડિઝાસ્ટર

દરમિયાન સરળતાથી કવરેજ કરવા માટે તૈયાર કરવાની જરૂર છે. આ પ્રક્રિયા અન્ય બે પક્ષકારો - પીડિતો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીને અવરોધરૂપ બનાવાને બદલે મદદરૂપ સાબિત થશે. આપાતકાલીન પરિસ્થિતિ દરમિયાન અને ત્યાર બાદ તરત જ માહિતીસંચાર પ્રતિભાવ અને રિકવરીનો મહત્વપૂર્ણ ઘટક છે. કારણ કે તે અસરગ્રસ્ત લોકો, પરિવારો અને સમૃદ્ધાયોને પ્રથમ પ્રતિભાવકો, સહાયવ્યવસ્થા અને અન્ય પરિવારના સભ્યોને એક-બીજા સાથે જોડે છે. વિશ્વસનીય અને પ્રાય સંચાર અને માહિતી-વ્યવસ્થા પણ સમૃદ્ધાયોની સ્થિતિસ્થાપકતા માટે મહત્વપૂર્ણ છે.

માનવજીવનના દરેક ક્ષેત્રમાં 'પ્રત્યાયન (કોમ્પ્યુનિકેશન)' શબ્દ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. વ્યક્તિ સમાજ, રાષ્ટ્ર અને વિશ્બનો એક ઘટક છે અને તે પોતાની રીતે એકલો જીવન જીવી શકે નહીં. તેણે અથવા તેણીએ સામાન્ય સંજોગોમાં અને આપત્તિ દરમિયાન તેથી પણ વધારે પ્રમાણમાં તેમના સાથી માનવો સાથે વાતચીત કરવી પડે છે.

કોમ્પ્યુનિકેશન બે જુદ્દા-જુદ્દા પાસાં ધરાવે છે. પ્રથમ ભૌતિક છે, જેમાં આપણે પ્રગતિશીલ ટેકનોલોજીના ઉપયોગ થકી વિવિધ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આધુનિક ટેકનોલોજીની અને ઉપગ્રહોના ઉપયોગ દ્વારા આપણે સમગ્ર વિશ્બમાં ટેલિવિજન કાર્યક્રમોનું પ્રસારણ કરીએ છીએ. સેટેલાઈટ ફોન અને ઇન્ટરનેટે વૈશ્વિક અને લગભગ ત્વરીત કોમ્પ્યુનિકેશનમાં નવાં પરિમાણો ઉમેરી દીધા છે. આ રીતે કોમ્પ્યુનિકેશનના માધ્યમ

તરીકે કોઈ પ્રકારની હાઈ-ટેકનોલોજીની અધત નથી. માધ્યમો (પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક) કોમ્યુનિકેશનના વિશ્વસનીય અને પ્રમાણાળી ઘટકો તરીકે સેવા આપી રહ્યા છે.

અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ પાસું જ્યાલાત્મક છે. તેની ખાતરી કરવી આવશ્યક છે કે કોમ્યુનિકેશનનો પ્રામાર્કર્ટ પ્રસારિત કરાયેલા સંદેશના ઘટકોને સમજે અને તેનો તે ઈચ્છિત પદ્ધતિમાં પ્રતિભાવ પૂરો પાડે. સમગ્ર જ્ઞાન, સ્પષ્ટતા અને સચોટાતાના આ વિશાળકાય પ્રયત્નો પાછળ દેખીતી રીતે આ સરળ જરૂરિયાત રહેલી છે. સંદેશના ઉદ્ભવકર્તાને પ્રામાર્કર્ટના સંદેશ પારખવાની અને સાચી રીતે તેની પ્રતિક્રિયા આપવાની શક્તિ અને ક્ષમતાનો જ્યાલ હોવો જોઈએ. આથી વિષયવસ્તુ અને સ્પષ્ટતા પ્રસારિત કરાઈ રહેલા સંદેશની આવશ્યક વિશેષતા બની રહેવી જોઈએ. વિષયવસ્તુ ચોક્કસ, મુદ્દાસર, ટૂંકું અને સરળ અને સમજીય તેવી સ્પષ્ટ ભાષામાં વણેલું હોવું જોઈએ, જે કોઈ સંદર્ભથતા ધરાવતું ન હોય. ‘કોમ્યુનિકેશન’નો આધુનિક જ્યાલ સંદેશના પ્રસારણ જેટલા તેના પરંપરાગત અર્થ પૂરતો સીમિત નથી પરંતુ તેમાં સંદેશની ગુણવત્તાનો પણ સમાવેશ થાય છે, ખાસ કરીને વિષયવસ્તુ, સચોટાતા અને ટૂંક્કસાર.

કોમ્યુનિકેશન ટેકનોલોજીનું અમલીકરણ ઉપશમન, તૈયારી, પ્રતિભાવ અને પુનર્વસન તરીકે ઓળખાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ ચાર અલગ તબક્કામાં ભૂમિકા ધરાવે છે. પરંતુ મોટા ભાગ તેનો પરંપરાગત રીતે પ્રતિભાવ અને ઉપશમન તબક્કામાં અમલ કરાય છે. છેલ્લાં બે દાયકાઓ દરમિયાન ઉદ્ભવેલી નવી કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીએ જુદી-જુદી કોમ્યુનિકેશન વ્યવસ્થાઓના સંકલનની વ્યાપક સંભાવનાઓ પેદા કરી છે. ઈન્ટરનેટ, મોબાઇલ-ફોન, ફેક્સ, ઈમેલ, રેડિયો અને ટેલિવિજન સહિત વિવિધ કોમ્યુનિકેશન વ્યવસ્થાઓની આંતરકિયાશીલતા ઉત્તરોત્તર કાર્યશીલ બની રહી છે. તેના પરિણામે ડિઝાસ્ટરનાં ઉપશમન

અને નિવારણમાં કોમ્યુનિકેશન ટેકનોલોજીના અમલીકરણની સંભાવનાઓ પણ વધી રહી છે. કટોકટીના પ્રસંગો અને આપાતકાલીન પરિસ્થિતિ જેમાં મોટા ભાગે અવ્યવસ્થા હોય છે, કોમ્યુનિકેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ તબક્કાઓ દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સમુદ્ધાયો અને વાતાવરણ સામે જોખમો નિયંત્રિત કરવા કટોકટી દરમિયાન કોમ્યુનિકેશનમાં પગલાં ઓની વ્યાપક શ્રેષ્ઠીનો ઉપયોગ થાય છે. આપત્તિ ગ્રાટેક તે પહેલાં ટેલિકોમ્યુનિકેશનનો ઉપયોગ તોળાઈ રહેલા જોખમ અંગે માહિતીનું પ્રસારણ કરવા કરી શકાય છે. આ રીતે આ જોખમોનો પ્રતિકાર કરવા લોકો આવશ્યક સાવધાની રાખી શકે છે. રિમોટ સેન્સિંગ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સહિત અન્ય ટેલિકોમ્યુનિકેશન એપ્લિકેશન આવી રહેલા જોખમોનું ટ્રેકિંગ કરવામાં, સત્તાવાળાઓને સાવચેત કરવામાં અને ચેતવણી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પત્રકારો ડિઝાસ્ટરનું કંવરેજ કરી રહ્યા હોય તેમને આવા પ્રકારનાં આધુનિક સાધનોના ઉપયોગ અંગે ફરજિયાત તાલીમ આપવી જોઈએ.

આવી આપત્તિ દરમિયાન દુર્ઘટનાને કવર કરવા અને પોસ્ટમોર્ટમ કરવા ઘટના સ્થળે પહોંચી રહેલા પત્રકારો કે જેઓ સંદેશ વાહક તરીકે કાર્ય કરે છે, તેમની વચ્ચે ખૂબ જ નજીકથી સંકલન હોવું જોઈએ. આ જ સમયે તેમને જોખમોની પણ જાણકારી હોવી જોઈએ. આ મૂળભૂત રીતે એક લક્ષ્યશરેખા છે કે જ્યાં સુધી તે જરૂર શકે અને તેનાથી આગળ વધી શકે નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી ધરાશાયી મકાનમાં પ્રવેશી શકે છે, કારણ કે જોણે છે કે પોતાનો બચાવ કરીને તેણે ફસાયેલા પીડિત વ્યક્તિને કેવી રીતે બચાવવાની છે. જ્યારે રિપોર્ટર અથવા કેમેરામેને તેમની પાછળ જવું જોઈએ નહીં, કારણ કે જો તરત જ વધુ દુર્ઘટના સર્જિય તો તે પોતાનો જીવ બચાવી શકે નહીં. પત્રકારો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓએ જોખમી જગ્યાઓ ઓળખવી જોઈએ અને તે અનુસાર તેને અંકિત કરવા જોઈએ. પત્રકારોએ તેમના મોબાઇલ ફોન અને

ક્રમ્યૂટર જેવાં સંદેશાવ્યવહારનાં સાધનોનું પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે ખૂબ જ મોટાપ્રમાણમાં માહિતી સંગ્રહ ધરાવતાં હોય છે. જો માહિતી ગૂમ થાય તો સ્ટોરી બગડી શકે છે અથવા પોતાને જોખમમાં મૂકી શકે છે.

કઈ માહિતી મહત્વપૂર્ણ, સંવેદનશીલ છે અને તેને કેવી રીતે સુરક્ષિત રાખશો તે વિચારો. ઓફિસ અથવા હોટલરૂમમાંથી બહાર જાઓ ત્યારે ક્રમ્યૂટર બંધ કરો. તમારે હિસ્ટ્રી, રિ-સાઈકલાબિન અને પાસવર્ડ સાફ્ટ કરી દેવાં જોઈએ અને વાયરલેસ નેટવર્ક સુરક્ષિત અને પાસવર્ડ સંરક્ષિત હોય તેની ખાતરી કરવી જોઈએ. સેટેલાઈટ ફોન, મોબાઇલ ફોન અને રેડિયો જ્યારે બંધ હોય ત્યારે પણ ટ્રેક કરી શકાય છે. આથી દુશ્મનના વિસ્તારોમાં તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને જ્યારે વપરાશ ન હોય, ત્યારે તેની બેટરી દૂર કરી દો. મોબાઇલ ફોન પાસવર્ટથી સંરક્ષિત હોય અને ઓટોલોક સંક્રિય હોય તેની ખાતરી કરો. હેકર્સને તમારા ફોનમાં પ્રવેશતા રોકવા માટે જ્યારે ઉપયોગ ન હોય ત્યારે બ્લ્યુટ્થ બંધ કરી દો.

સુપર સાઈકલોન અને ઓરિસ્સામાં પૂર દરમિયાન કોમ્યુનિકેશનની ભૂમિકાનો શ્રેષ્ઠ અનુભવ થયો હતો. જ્યારે તમામ ટેલિફોન લાઈન બંધ હતી અને મોબાઇલ ટાવર જમીનદોસ્ત હતાં ત્યારે અંગ્રેમદેશ સરકાર આધુનિક ટેકનોલોજીના ફોન લેવા દોડી હતી જે ખૂબ જ કામમાં આવ્યા હતા. પહેલેથી ચેતવણી સાધનો ગોઠવેલા હોવાથી ઓરિસ્સામાં ફાલિન ચકવાત ગ્રાટક્યુનું તે પહેલાં હજારો લોકોની બચાવ-કામગીરી વખતે પણ આધુનિક કોમ્યુનિકેશન ખૂબ જ ઉપયોગી નીવડ્યું હતું.

લેખક સમાચાર સંસ્થાઓ, અંગ્રેજ ફેનિકો, સામયિકો અને અન્ય મીડિયામાં ત૦ વર્ષના અનુભવ સાથે સીનિયર જર્નલિઝમ અને ડિઝાસ્ટર રિપોર્ટિંગ પર લેક્ચર્સ પ્રદાન કરે છે તથા ૧૦૦થી વધારે લેખો પ્રકાશિત થયા છે.
E-mail: cknayak@gmail.com

માનસિક પ્રાથમિક ઉપયાર: હતાશામાંથી હળવા થવાનો માર્ગ

ડૉ. હરિહરન અને અંબરીન ખાન



આધાતજનક ઘટનાથી અસર પામેલા લોકો એક અલગ પ્રકારની હતાશા અનુભવે છે. જે વ્યક્તિએ પરિવારના લોકોનો જીવ, મિલકત અને આજીવિકા ગુમાવી હોય તથા ઈજા કે સમગ્ર સમુદ્દરને નુકસાન થયું હોય, તેવી સ્થિતિમાં યોગ્ય અને સમયસરની કાળજ અને સહયોગના અભાવે તેમને બેઠાં કરવાનું મુશ્કેલ બને છે. કોઈ વ્યક્તિ માટે પરિવારના સર્બનો જીવ જીવ કે ઘરવિહોણો બની જીવ ત્યારે તેના જીવન અને ભવિષ્ય અંગે નિરાશાજનક સ્થિતિમાં મુકાઈ જીવ છે. રોજગારી ગુમાવવાના કારણે તથા ઉપર દર્શાવેલી તમામ બાબતોને કારણે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવે છે અને આવી સ્થિતિમાંથી તેને બેઠો કરવા માટે તાત્કાલિક દરમિયાનગીરી મુશ્કેલ બને છે. ખાસ કરીને જે લોકો આવી આફતોને પગલે ખૂબ ખરાબ રીતે અસર પામ્યા હોય તેમને બેઠાં કરવાનું મુશ્કેલ બને છે.



રત પૂરથી માંગીને દુઃખાળ, વાવાજોડાં, ભૂંકુંપ, સુનામી અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓને કારણે અવાર-નવાર દ્યાજનક સ્થિતિમાં મુકાઈ જતો હોય છે. આવી સ્થિતિ કેટલાક પ્રદેશોમાં વારંવાર ઊભી થતી હોય છે અને તમામ વ્ય, જીતિ, જ્ઞાતિ અને સમુદ્દરાયના લોકો વ્યક્તિગત રીતે તેનો ભોગ બનતા હોય છે. દેશમાં કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં બાળકો હિંસાનો અનુભવ લઈને મોટાં થયા છે અને આતંકી જૂથોને કારણે જીવ ગુમાવ્યા હોય અને સમગ્ર સમુદ્દર અપક્રિયા (કશું નહીં કરી શકવાની સ્થિતિ) નો ભોગ બન્યો હોય તેવું બનતું રહે છે. આવી સ્થિતિમાં માનસિક આરોગ્યને માપી શકાય નહીં, તેવી અસર થાય છે અને આ કારણે લોકોના આરોગ્યને માઠી અસર થાય છે અને સમગ્ર સમાજ લક્વાગ્રસ્ત બની જીવ છે. આવી વિપરીત પરિસ્થિતિમાંથી બેઠા થવું અને ડિઝાસ્ટર માટેની સજજતા કેળવવી, તે આ દેશના નીતિના માળખામાં ખૂબ જ મહત્વનું છે, કારણ કે વંચિત સમુદ્દરને આવી કુદરતી આફતો/હુર્ઘટનાઓની માઠી અસર થતી હોય છે. ભારત સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ભારે પરિવર્તન આવ્યું છે. આમ ઇતાં, માનસિક આરોગ્યનું

પાસું અને આધાતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો વ્યક્તિ સામનો કરી શકે તેવી સજજતા હાંસલ કરવાની બાબત અંગે ખાસ ધ્યાન અપાયું નથી. કુદરતી રીતે વ્યક્તિ બેઠો થાય અને આધાત થયો હોય તેવી ઘટનાઓમાંથી બહાર આવે અને તે માટે યોગ્ય અને સમયસરની દરમિયાનગીરી આવશ્યક બની રહે છે.

આધાતજનક ઘટનાથી અસર પામેલા લોકો એક અલગ પ્રકારની હતાશા અનુભવે છે. જે વ્યક્તિએ પરિવારના લોકોનો જીવ, મિલકત અને આજીવિકા ગુમાવી હોય તથા ઈજા કે સમગ્ર સમુદ્દરને નુકસાન થયું હોય, તેવી સ્થિતિમાં યોગ્ય અને સમયસરની કાળજ અને સહયોગના અભાવે તેમને બેઠાં કરવાનું મુશ્કેલ બને છે. કોઈ વ્યક્તિ માટે પરિવારના સર્બનો જીવ જીવ કે ઘરવિહોણો બની જીવ ત્યારે તેના જીવન અને ભવિષ્ય અંગે નિરાશાજનક સ્થિતિમાં મુકાઈ જીવ છે. રોજગારી ગુમાવવાના કારણે તથા ઉપર દર્શાવેલી તમામ બાબતોને કારણે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવે છે અને આવી સ્થિતિમાંથી તેને બેઠો કરવા માટે તાત્કાલિક દરમિયાનગીરી મુશ્કેલ બને છે. ખાસ કરીને જે લોકો આવી આફતોને પગલે ખૂબ ખરાબ રીતે અસર પામ્યા હોય તેમને બેઠાં કરવાનું મુશ્કેલ બને છે. આમ ઇતાં, માનસિક આરોગ્યનું

ખરાબ રીતે અસર પામ્યા હોય તેમને બેઠાં કરવાનું મુશ્કેલ બને છે.

કટોકટીની પરિસ્થિતિ પછી લોકો ઘણીવાર સમાજનાં ધોરણો, નેટવર્ક અને વિશ્વાસ કે જેનાથી તેમની સુરક્ષા થઈ શકે તેમ હોય તેમાં પોતાની શ્રદ્ધા ગુમાવે છે. આથી ડિઝાસ્ટર પછીનાં પગલાંઓનો પ્રથમ ઉદ્દેશ બચી ગયેલી વ્યક્તિની પ્રેક્ટિકલ જરૂરિયાતો તાત્કાલિક પૂરી થાય તે બાબતે ધ્યાન આપવું જોઈએ. આમાં લોકોને કામચલાઉ આવાસની સુવિધા પૂરી પાડીને, પોતાનાં સ્વજનોને શોધવામાં સહાય કરવા માટે રિસેપ્શન સેન્ટર ઊભાં કરીને તથા અન્ય લોકો સાથે સાંકળીને માત્ર તે લોકો જ તકલીફનો ભોગ બન્યા નથી, તેવું ભાન કરવી ભૌતિક રીતે સલામતી અનુભવે તે માટે સહાય કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ લોકો શાંત અને આશાવાદી બને, ભૌતિક, લાગણીલક્ષી અને સામાજિક સહયોગ મેળવે અને પોતાની જીતે સહાયરૂપ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો સમાવેશ થાય છે.

એ બાબત સ્વાભાવિક છે કે આધાતજનક કે ડિઝાસ્ટરની ઘટનાનો ભોગ બનેલા લોકો તેમની પાયાની તબીબી અને ભૌતિક જરૂરિયાતો મેળવી શકે અને તાત્કાલિક સંભાળ લેવાય તે પણ આવશ્યક છે. વધુમાં, બચી ગયેલા લોકોની કામ કરવાની શક્તિનો અંદાજ મેળવી તેમને સહાય કરવાનો પણ સમાવેશ થાય છે.

એક વખત કટોકટીમાં મુકાયેલી વ્યક્તિની પાયાની પ્રાથમિક ભૌતિક જરૂરિયાતો સંતોષાય, તે પછી ઘણીવાર વ્યક્તિ પરિવારમાંથી પ્રેમ અને સ્વીકૃતિ બાબતે પરસ્પરનો, સમુદ્દરયનો અને કાળજી

રાખનાર વર્ગનો પરસ્પર સહયોગ મેળવે તો સામાન્ય જીવન તરફ પરત ફરવામાં સહાય થતી હોય છે. માણસની પ્રેક્ટિકલ જરૂરિયાતોને આધારે કરાતી દરમિયાનગીરી મહદ અંશે તેની હતાશાની વ્યક્તિગત વિશિષ્ટતાને આધારે નક્કી થતી હોય છે. હતાશાના પ્રમાણ અંગેનું આકલન ભૌતિક અને માનસિક સ્થિતિને આધારે થતી હોય છે. આવી જ્ઞાનગીરી વ્યક્તિને પોતાના શબ્દોમાં સાંભળીને અથવા તો વાતચીત દ્વારા મેળવી શકાય. ગ્રાણ જૂથ ઓળખવામાં આવ્યાં છે, જે માં-કામોતેજના, હતાશા અને કામ નહીં કરી શકવાની સ્થિતિનો અનુભવ કરનારા લોકોનો સમાવેશ થાય છે. આ લોકો અલગ અલગ પ્રમાણમાં અસહાયતા અનુભવતા હોય છે અને જેમને સૌથી વધુ કાળજીની જરૂર હોય તેને આધારે તેમની મૂળ સ્થિતિમાં પાછા આવવાની પ્રક્રિયા ઉદ્ભબતી હોય છે. આવા લોકોને ઓળખીને તેમની જરૂરિયાત મુજબ અગ્રતા આપી શકાય.

પ્રથમ જૂથની વ્યક્તિઓ એટલે કે કામોતેજનામાં તકલીફ ભોગવતા લોકો વિપરીત પરિસ્થિતિને કારણે દુઃખી હોય છે, પરંતુ તે હરવાફરવામાં સક્ષમ હોય છે અને પોતાની દૈનિક જરૂરિયાતોની માંગ પૂરી કરી શકે છે. આવા જૂથ માટે કોઈ ચોક્કસ દરમિયાનગીરીની જરૂર નથી, પરંતુ તેમની પ્રગતિ મોનિટર કરવા માટે સતત અવલોકન જરૂરી છે. આ ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે સમયસર સહયોગ મળી રહે અને આવા જૂથને તબીબી, આશ્રય અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં સહયોગ મળી રહે તે આવશ્યક છે.

બીજી જૂથના મહત્તમ લોકો હતાશા ધરાવતા હોય છે. તે કોઈ તબીબી, આહારની કે આશ્રયની સીધી સહાય વગર હરીફરી શકે છે. આવા લોકો સામાન્ય રીતે

સારી સ્થિતિમાં હોવાનું જણાતું નથી, પરંતુ તે જે માનસિક હતાશાનો ભોગ બન્યા હોય તેમાં ઘટાડો કરવાની જરૂર છે. આવું કરવા ઉપરાંત તેમની પ્રગતિનું સતત મોનિટરિંગ અને અવલોકન કરવું જોઈએ. આથી વિરુદ્ધ એક એવો વર્ગ છે કે જે સમૂહમાં હતાશા અનુભવતો હોય. આ વર્ગ તેમની રોજબરોજના જીવનની કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવે છે. આના કારણે તે ઘણીવાર ત્રીજા જૂથમાં સરી જાય છે. આ જૂથ કાર્ય નહીં કરી શકતા લોકોનું જૂથ છે. જે લોકો હતાશા અનુભવી રહ્યાં હોય, તેવી વ્યક્તિઓ ઘણીવાર ગુંચવાયેલી હોય છે. તેમની સમસ્યા હલ કરવાની ક્ષમતા ધરી હોય છે અને તે કોઈ કામમાં ધ્યાન ડેન્દ્રિત કરી શકતી નથી. આવા લોકો ભ્રમિત અવસ્થામાં હોય છે અને તેમને દુઃખમો આવતાં હોય છે. આધાતજનક ઘટના પછી તે દુઃખી, બેચેન, ગુર્સા અને હતાશાનો ભોગ બન્યા હોય છે. તેમની વર્તણુંકમાં જે અન્ય ફેરફારો થયા હોય છે, તેમાં ઊંઘમાં ખલેલ પડવી, ખાવા-પીવાની વ્યવસ્થા ખોરવાઈ જવી, લોકોને મળવાનું ટાળવું, અન્ય સ્થળે જવાનું ટાળવું, અતાર્કિક ભયને આધારે કામ કરવું તથા ગુર્સે થઈ જવું તેમજ આહાર, પાણી અને કપડાં જેવી ચીજોનો સંગ્રહ કરવાની તથા હરવા-ફરવાની ઈચ્છા ન હોય તેવી સ્થિતિનો સમાવેશ થાય છે.

કામ નહીં કરી શકતી આવી વ્યક્તિઓ ત્રીજા જૂથમાં સમાવેશ પામે છે. તેમની ક્ષમતાઓમાં ભારે અસમાનતા જોવા મળે છે અને તે જીવનનાં તમામ ક્ષેત્રોમાં ચંચુપાત કરતા થઈ જાય છે. ઘણીવાર તે ગુંચવાયેલા, વિચારશક્તિ ગુમાવેલા, આશા પણ ગુમાવી ચૂકેલા તથા આપધાતનો વિચાર આવતો હોય અને

ଓંધમાં પડછાયા દેખાતા હોય, તેવા લોકોનો સમાવેશ થાય છે. આવા લોકો પેનિક એટેક, પીટીએફી, હતાશા વગેરેનો ભોગ બનતા હોય છે. તેમની વર્તણુંકમાં લોકોને સતત અવગણવાનો સમાવેશ થાય છે. આવા લોકો હિસ્ક વર્તણુંક કરે છે, ભાવનાશીલ બને છે, જાતે દવા લેતા હોય છે અને પ્રિસ્ક્રિપ્શનમાં દર્શાવાયેલી દવા લેવાનું ટાળે છે તથા દારુ પીતાં થઈ જાય છે. અન્ય જોખમી વર્તણુંકમાં આવું કામ નહીં કરતું ગ્રૂપ અન્ય લોકો સાથે ભારે અસમાનતાનો અનુભવ કરતું હોવાથી આવા લોકોને પસંદ કરીને તેમની જરૂરિયાતોનો તાગ મેળવીને તેમને સહાયરૂપ થવું જોઈએ અને આવા લોકોને પાયાની જરૂરી ચીજોની સહાય કરવી જોઈએ. આવા જૂથને પાયાની મૂળભૂત જરૂરિયાતોની સાથે-સાથે ખૂબ જ સહયોગ અને સહાયની જરૂર હોવાથી તેમના સંપર્કમાં રહી સહયોગ અને કાળજી લેવાની બાબત ખૂબ જ મહત્વની બની રહેછે. આમ છતાં બચી ગયેલા એવા પણ લોકો હોય છે કે જે પોતાની જાતે સુધારો કરવા સક્ષમ હોય છે. આવી સિથિતમાં દરમિયાનગીરી કરવાથી તેમની ટકી રહેવાની કુદરતી ક્ષમતામાં દખલ કરી હોય તેવો ભાવ ઊભો થાય છે. આથી આવી વ્યક્તિઓની ક્ષમતા સુધારવા પ્રયાસ કરવો જોઈએ. આવાં અવલોકનો એવા સમય સુધી કરતાં રહેવાં જોઈએ કે જ્યાં સુધી લોકો બહારની સહાય પોતાની જાતે માંગતા થાય.

માનસિક સહાય સૌથી પહેલાંનો અભિગમ અપનાવીને જે લોકો ડિઝાસ્ટર પછી સહન કરી રહ્યાં હોય તેમને તાકાલિક સહયોગ પૂરો પાડવો જોઈએ. આમ છતાં આધાતજનક ઘટના અને ડિઝાસ્ટરની માનસિક અને સામાજિક અસરો ગ્રાથમિક

યોજના જાન્યુઆરી-૨૦૧૭

તબક્કામાં અમયાર્દિટ સ્વરૂપે જોવા મળે છે. આવા અનુભવને કારણે અસર પામેલા લોકોને લાંબા ગાળાની માનસિક આરોગ્ય તથા તેમના શરીર સૌધી અંગે ધ્યાન આપવાને ઓછું મહત્વ મળે છે. માનસિક આરોગ્યને સુરક્ષા મળી રહેતે આવશ્યક છે. આ માટે સરકારી અને બિનસરકારી એજન્સીઓએ લોકો માનસિક રીતે સજજ બને ત્યાં સુધી સુસંકલિત કામગીરી કરવી જોઈએ. આવી કામગીરીમાં શરૂઆતના સમાહોમાં બાળકો અને પરિવારની સહાયલક્ષી જરૂરિયાતો, લાગણીલક્ષી સહયોગ, સામાજિક સહયોગ, પ્રોક્ટિકલ સહાય અને માહિતી એક્ટી કરવાની તથા વિવિધ ચીજો પૂરી પાડવા માટે સહયોગી વ્યવસ્થા ગોઠવવાનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્યસંસ્થા (WHO) એક્ષનના ગ્રાસ સિદ્ધાંતોને આધારે કામ કરવાનું સૂચ્યવે છે, જેમાં ભૌતિક પ્રાથમિક ઉપયાર કે જેમાં તાકીદની પરિસ્થિતિમાં સલામતીપૂર્વક કઈ રીતે પ્રવેશ કરવો અને સિથિત હાથ ધરવી (WHO), અસર પામેલા લોકોને સાંભળવા અને સાંભળેલી માહિતીને આધારે (LISTEN) પ્રોક્ટિકલ સહયોગ પૂરાં પાડવાનો સમાવેશ થાય છે. (LINK)

આથી પ્રથમ પ્રતિભાવ આપનારા,

પ્રાથમિક સંભાળ લેનારા અને ડિઝાસ્ટરમાં રાહત-કામગીરી કરનારા લોકોમાં પાયાનું લઘુતમ કૌશલ્ય હોવું જોઈએ, જેથી પુખ્ત વયના, ડિશોર વયના અને બાળકો સહિત દરેક વ્યક્તિને માનસિક પ્રાથમિક સારવાર આપવામાં માનસિક ધોરણે કાળજી લઈ શકાય. પ્રથમ પ્રતિભાવ આપનાર વર્ગે જાતે અસર પામેલા લોકોની લાગણીલક્ષી, પ્રોક્ટિકલ અને ચિંતાજનક બાબતો ધ્યાનમાં લેવા ઉપરાંત તે વહેલી તકે કામ કરતા થાય અને પોતાની જાતને તથા અન્યને સહાયરૂપ થાય તેવી સિથિત સ્થપાવી જોઈએ.

ડૉ. હરિહરન છેલ્લાં ઉપ વર્ષથી તબીબી વ્યવસાય તરીકે કાર્યરત છે અને કન્સલ્ટન્ટ તરીકે જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રદાન પણ કરે છે. તેઓ ઈન્ડિયન આલ્કોહોલ પોલિસી એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ પણ હતા, જે બ્રિટનની ગ્લોબલ આલ્કોહોલ પોલિસી એલાયન્સ (જીએપીએ) અને ફોરટ નોર્નેની માન્યતા ધરાવે છે.
E-mail:hariharandr56@gmail.com

અંબરીન ખાન અત્યારે સોસાયરી ફોર પ્રમોશન ઓફ યુથ એન્ડ માસીસ (એસપીવાયએમ) ખાતે પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે કાર્યરત છે.

અગાત્યની સૂચના

યોજનાના લેખકો / વાચકો નોંધ લે.

યોજના ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી તેમજ કુરુક્ષેત્ર અંગ્રેજી,

હિન્દીનું લવાજમ હવે ઓનલાઈન ભરી શકાશે.

આ માટેની વિગતો નીચેની વેબસાઈટ પરથી મળી રહેશે.

www.yojana.gov.in

આપદા વ્યવસ્થાપન : હકીકત અને આયોજન

ડૉ. તુષાર હાથી



પરંપરાગત સમાજમાં ‘પાણી પહેલાં પાળ બાંધવી’ એને આજની ભાષામાં ‘પ્રિવેન્શન’ કહે છે. આપદાના જોખમોને હળવાં કરવા માટે પણ ‘પ્રિવેન્શન બેટર્યેન ક્રોર’નો મંત્ર લાગુ પડે છે. તૈયારી કેવી રીતે થાય? તેમાં શું કરવું ધટે. તૈયારી ‘પંચતત્ત્વ’નું પરિણામ છે. આપદાથી બચવા, આપદા સામે સુરક્ષિતપણું વધારવા માટે જે તૈયારી કરવાની થાય છે, તેમાં સહુમથમ ‘તાલીમ’ બાદ ‘સભાનતા’ ‘સાવધાની’- ટેક્નિકલ સર્વેક્ષણ અને સંસ્થાકીય વાતાવરણ નિર્માણ કરવાની વાત છે. તંત્ર આ બધાં જ કામોની જવાબદારી લેશે તો પણ તેમાં કારગત થઈ શકાય નિહિ. જ્યાં સુધી સમાજ સભાનતાપૂર્વક પ્રતિસાદ ન આપે, લોકશાહી રાજ્યતંત્રમાં આવા કોઈ પણ નીતિવિષયક કાર્યક્રમોની સફળતાનો આધાર ‘જનજાગૃતિ’ છે. લોડ બ્રાઇસે કહું છે તે મેં એટરનલ વિજિલન્સ ઈજ ધ પ્રાઇસ ઓફ ટેમોકેસી.

તંત્ર દ્વારા નિર્ણયીકરણની ક્ષમતામાં સુધારો થાય તે આવશ્યક છે. છેલ્લા એક દાયકામાં આ સંદર્ભમાં વિધાયક પરિણામો દેખાઈ રહ્યા છે. આપદાઓની આગાહીના પરિયેક્ષમાં બચાવતંત્રને સાબદું કરવા માટેના સર્વ પ્રયત્નોના પરિણામો હળવે-હળવે જોવા મળી રહ્યા છે, અલભત ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં આ ‘પાશેરાની પહેલી પૂઢી’ સમાન છે. માણખાકીય સ્થિતિમાં જેમજેમ સુધારો થતો જાય છે, ખાસ કરીને ગ્રાત્યાયન સંદેશાયવહારની શીધતાએ તત્કાલીન ભયાનકતા ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

મા

નવજાતની ઉત્કંતિનો ઇતિહાસ અને કવિધ આપદાઓથી જોડાયેલો છે.

જેમજેમ માનવજાત પ્રગતિ કરે છે તે મતેમ આપદાઓનાં પ્રમાણ અને સ્વરૂપમાં ફેરફારો જોવા મળેલા છે. જૈતિકવિજ્ઞાન-તબીબી વિજ્ઞાન સાથે ટેક્નાલોજીના સંચાલનના સુમેળી આપદાઓની ધાતકતા અલભત ઓછી જોવા મળી છે. બેલિજીયમ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સોસાયટી અંતર્ગત ‘સેન્ટર ફોર રિસર્ચ ઓન ઇપિડિયોલોજી ડિઝાસ્ટર્સ’ - કેડ કાર્યરત છે. આ સેન્ટર દ્વારા યુએસએસાઈડીના સહયોગથી ‘EMDAT’ આપદાને લગતો વૈશ્વિક ટેટાબેઈજ તૈયાર કરવામાં આવેલ છે. આ એવો વિરાટ ટેટાબેઈજ છે, જેમાં ઈ.સ. ૧૮૦૦થી શરૂ કરીને આજ દિવસ સુધી વિશ્વના વિવિધ દેશોમાં જે વિવિધ પ્રકારની નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, તેની દેશવાર વિભાગવાર વિગતોનો સમાવેશ છે.

કેડ દ્વારા વૈજ્ઞાનિક રીતે આપદાઓની સમજૂતી આપતાં સ્પષ્ટ કરવામાં આવેલ છે કે વિશ્વના કોઈ પણ ભૂણામાં બનતી એવી પ્રાકૃતિક કે ટેક્નાલોજીકલ દુર્ઘટના બનાવ કે જેનાથી સ્થાનિક પ્રતિકારશક્તિ લગભગ નહિવતું થઈ જાય અને સ્થાનિક લોકોને રાષ્ટ્રના બીજા લોકોની, વિદેશના લોકોની સંસ્થાઓની તકીદ સહાય માગવી પડે - આ એવી દુર્ઘટના હોય છે, જેમાં પારાવાર નુકસાની-વિનાશ જાનહાનિ થતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના આકસ્મિક

રીતે થતી હોય છે. કેડના ટેટાબેઈજ અલભત સામાન્ય રીતે (૧) ૧૦ થી વધુ લોકાનું મૃત્યુ (૨) ૧૦૦ કે તેથી વધુ લોકોને જીજાની અસર (૩) શાસન દ્વારા ‘કટોકટી’ની જહેરાત કે (૪) આંતરરાષ્ટ્રીય સહાય માટેની અપીલ - આ ચાર પૈકી એક શરતની પૂર્તિ થતી હોય તેનો જ સમાવેશ થાય છે.

સધન અભ્યાસો અને વિવિધ પ્રકારની આપદાઓને મુખ્યત્વે નીચેના વિભાગમાં વહેંચવામાં આવે છે (૧) ભૂભૌતિક - ધરતીકંપ, જવાણમુખી ફાટવો વગેરે (૨) જલક્ષિયાન્વિત - ભારે પૂર, ભેખડ ધસી પડવી વગેરે, (૩) હવામાનજન્ય - ભારે તાપમાન, ભારે ધૂમ્મસ (૪) આબોહવા - હુક્કાળ, હિમવર્ષા, વન્ય દાવાનળ વગેરે, (૫) જૈવિક-રોગચાળો, પશુમૃત્યુ વગેરે, (૬) અવકાશ કે હવામાન ઉપરની અસરો.

કેડ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી EMDAT વિકસાવેલ છે જેમાં જાનહાની, આર્થિક પાયમાલી, વિગેરેની ગણત્રી માટે વૈજ્ઞાનિક જીણવટભરી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દુર્ઘટના આંક સાથે તેની વાર્ષિક સરેરાશ તારીજ પણ કાઢવામાં આવે છે. EMDAT પ્રમાણે સંક્ષિમભાં તપાસવામાં આવે, તો વર્ષ ૨૦૧૫માં કુલ ૩૭૬ જેટલી પ્રાકૃતિક દુર્ઘટના નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૪માં ૩૩૦ની સરખામણીમાં થોડી વધારે પણ ઈ.સ. ૨૦૦૧થી ૧૫ના સમયગાળામાં ૨૦૧૪ને બાદ કરતાં સહુથી ઓછા પ્રમાણમાં નોંધાઈ હતી. ઈ.સ. ૨૦૦૫ થી ૨૦૧૪ના

દાયકાની વાર્ષિક સરેરાશ ૩૮૦ કરતા આ પ્રમાણ ઓછું હતું. વર્ષ ૨૦૦૫ના છેલ્લા અહેવાલમાં ૨૨૭૬૫ મૃત્યુઆંક આખા વિશ્વ માટે નોંધાયેલ અને ૧૧૦.૩ બિલિયન લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. દાયકા દરમિયાન સરેરાશ ૪૧૫૦.૩ બિલિયન ડોલરની નુકસાની થયેલ, જ્યારે ૨૦૧૫ના વર્ષમાં આ પ્રમાણ ૪૭૦.૩ બિલિયન નોંધાયેલ હતું. વર્ષ ૨૦૧૫માં સમગ્ર વિશ્વમાં જે કુલ દુર્ઘટનાઓ નોંધાઈ તે પૈકી સહુથી વધુ હવામાનજન્ય દુર્ઘટનાઓ નોંધાયેલ હતી. જ્યારે ભૂભૌતિક જિયોફિઝિકલ અને જલક્રિયાન્વિત (હાઇડ્રોલોજિકલ) દુર્ઘટનાઓનું પ્રમાણ ઘટેલું જોવા મળેલ છે.

સમગ્ર વિશ્વનું ચિત્ર તપાસવામાં આવે છે, ત્યારે ઇ.સ. ૨૦૧૫માં નોંધાયેલી કુલ દુર્ઘટનાઓ પૈકી મહત્તમ પ્રમાણમાં ચીન, અમેરિકા, ભારત, ફિલિપાઈન્સ તથા ઇન્ડોનેશિયા - આ પાંચ દેશોમાં નોંધાયેલ છે. અતે એ ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાપ્રસ્ત આ પાંચ રાષ્ટ્રો પૈકી - ચીન, ભારત તથા અમેરિકા ત્રણ વિશ્વના મહત્તમ જનસંખ્યા ધરાવતા દેશો છે.

ઇ.સ. ૨૦૧૫ના છેલ્લા ચિત્રને તપાસવામાં આવે, તો પ્રાઇટિક આપદાથી વિવિધ પ્રકારની અસર પામેલાં ટોચના (મહત્તમ) ૧૦ રાષ્ટ્રોની વિગત નીચે પ્રમાણે છે.

દેશનું નામ	દુર્ઘટના-પ્રકાર	મૃત્યુ
નેપાળ	ભૂકૂપ-એપ્રિલ	૮૮૩૧
ફાંસ	તાપમાન-જૂન	૩૨૭૫
ભારત	તાપમાન-જૂન	૨૨૪૮
પાકિસ્તાન	ભેખડ ધસવી - જૂન	૧૨૨૮
બેલ્જિયમ	પૂર તાપમાન-જૂન	૪૧૦
ગવાટેમાલા	ભેખડ ધસવી - ઓક્ટોબર	૩૫૦
ભારત	પૂર-નવેમ્બર	૩૨૫
ભારત	પૂર-જુલાઈ	૨૯૩
પાકિસ્તાન	ભૂકૂપ-ઓક્ટોબર	૨૮૦
માલાવી	પૂર-જાન્યુઆરી	૨૭૮

યોજના જાન્યુઆરી-૨૦૧૭

કોષ્ટક તાપસતા સ્પષ્ટ થાય છે કે નેપાળમાં ભૂકૂપે મહત્તમ જાનહાનિ સર્જી હતી જ્યારે ભારતમાં અલગ-અલગ સ્થળોએ પૂર અને પ્રચંડ તાપ જેવી દુર્ઘટના નોંધાઈ હતી. કુલ ૧૦ દેશો પૈકી સત્ત એશિયાઈ રાખ્યો છે જે પૈકી તે દક્ષિણ એશિયાનાં, ૨ દક્ષિણપૂર્વ એશિયા અને ૨ પૂર્વ એશિયાનાં હતાં. જ્યારે તે આફિકાના દેશો હતાં.

દેશનું નામ	દુર્ઘટના-પ્રકાર	મૃત્યુ
કોરિયા	દુષ્કાળ જૂન-જુલાઈ	૧૮ બિલિયન
ભારત	પૂર જુલાઈ-ઓગસ્ટ	૧૩.૭૧ બિલિયન
ઇથોપિયા	દુષ્કાળ સપેંચરથી દિસેમ્બર	૧૦.૨૦ બિલિયન
ખાંમાર	નદી પૂર જુલાઈ-ઓગસ્ટ	૬.૦૦ બિલિયન
નેપાળ	ભૂકૂપ એપ્રિલ	૫.૬૫ બિલિયન
ફિલીપાઈન્સ	ટાયફુન વાવાઝોંગુ	૨.૬૦ બિલિયન
સોમાલિયા	દુષ્કાળ ઓગસ્ટ- દિસેમ્બર	૪.૭૦ બિલિયન
માલાવી	દુષ્કાળ ઓક્ટોબર- દિસેમ્બર	૨.૮૦ બિલિયન
દ.આફિકા	દુષ્કાળ જાન્યુઆરી	૨.૭૦ બિલિયન
બાંગલાદેશ	વાવાઝોંગુ - જુલાઈ	૨.૧૦ બિલિયન

ઇ.સ. ૨૦૧૫માં સમગ્ર વિશ્વમાં દુર્ઘટનાઓથી કાચી ગૃહપેદાશને જે નુકસાન થયું છે. તેમાં મહત્તમ હિસ્સો ચીન તથા અમેરિકાનો નોંધાયો છે. આ બસે રાષ્ટ્રોની કુલ જનસંખ્યા વિશ્વની ઉઠ ટકા જેવી થવા જાય છે. (૨૪ ટકા ચીન અને ૧૧ ટકા અમેરિકા) તે પૈકી ચીન અને અમેરિકા મોખરે છે. વિશ્વની કુલ આર્થિક સંપત્તિમાં અમેરિકાનો હિસ્સો ૨૪.૪ ટકા છે તથા ચીનનો હિસ્સો ૧૪.૮ ટકા છે. જ્યારે નુકસાનીમાં અમેરિકાનો હિસ્સો ૩૦.૩ ટકા તથા ચીનનો ૨૬.૬ ટકા નોંધાયો હતો. આર્થિક નુકસાની ભોગવનાર મુખ્ય દેશો પૈકી તુ દેશો એવા હતા, જેની કાચી ગૃહપેદાશ ૧૦૦ બિલિયનથી ૧૦૦૦ બિલિયન ડોલર વચ્ચે હતી. જ્યારે આ રાખ્યોને આર્થિક નુકસાની ૮.૮ ટકા જેટલી હતી. અમેરિકા તથા ચીનમાં દુર્ઘટનાઓથી જે કુલ આર્થિક નુકસાન

નોંધાયેલ છે, તે પૈકી બસે દેશોમાં માત્ર એક જે દુર્ઘટનાથી નુકસાનીનું પ્રમાણ તે રાખ્યો હુલ નુકસાનીમાં અનુદાન ૧૪ ટકા તથા ૨૩ ટકા નોંધાયેલ હતું. ઉપબંદીય અવલોકન-સમગ્ર વિશ્વમાં ઇ.સ. ૨૦૧૫માં જે દુર્ઘટનાઓ નોંધાઈ હતી, તેના પ્રમાણ સ્વરૂપના સંદર્ભમાં મિટિરિયોલોજિકલ, જિયોફિઝિકલ, હાઇડ્રોલોજિકલ, કલાઈપેટોલોજિકલમાં વહેંચવામાં આવે તો વિશ્વના જુદા-જુદા ઉપબંદોમાં તેના પ્રમાણમાં તેના શિકાર (અસર) અને તેનાથી થયેલ નુકસાનીનું ચિત્ર ‘આપદાન વિષયક’ની પ્રતીતિ કરાવે છે.

વિશ્વમાં ૨૦૧૫માં મિટિરિયોલોજિકલ દુર્ઘટનાઓ નોંધાઈ, તે પૈકી મહત્તમ એશિયામાં ૪૮.૮ ટકા, અમેરિકામાં ૨૬ ટકા, આફિકામાં ૧૦.૨ ટકા, ઓશોનિયામાં ૮.૫ ટકા તથા યુરોપમાં ૫.૫ ટકા નોંધાયેલ. કુલ નોંધાયેલ મિટિરિયોલોજિકલ દુર્ઘટનાનો મહત્તમ ભોગ પ્રમાણ એશિયા (૮૮.૮ ટકા) હતું. જ્યારે બાકીના ચાર ઉપબંદોમાં આ કુલ પ્રમાણ ૭ ટકા જેટલું હતું. જ્યારે આર્થિક નુકસાનીમાં એશિયા (૪૭.૮ ટકા), અમેરિકા (૩૮ ટકા), ઓસ્ટ્રેલિયા (૭.૪ ટકા), યુરોપને ૬.૫ ટકા તથા આફિકામાં ૦.૫ ટકા હતું. કલાઈપેટોલોજિકલ (આબોડવાજન્ય) દુર્ઘટનાઓ વિશ્વમાં ૩૩ ટકા નોંધાયેલ. ઓસ્ટ્રેલિયામાં ૧૭.૮, એશિયામાં ૧૩.૩ તથા યુરોપમાં ૨.૨ ટકા નોંધાયેલ છે. આ દુર્ઘટનાઓના ભોગનું પ્રમાણ આફિકામાં ૫૧.૫ ટકા, એશિયામાં ૩૭.૪ ટકા નોંધાયેલ હતું, જ્યારે અમેરિકામાં ૩૩ ટકા દુર્ઘટનાઓના પ્રમાણમાં આપદાન ભોગનું પ્રમાણ ૭.૨ ટકા નોંધાયું હતું. આ પ્રકારની દુર્ઘટનાઓના કરણો આર્થિક નુકસાની મહત્તમ પ્રમાણમાં એશિયા (૪૩.૨ ટકા), અમેરિકા (૩૮ ટકા), આફિકા (૧૧.૮) અને ઓસ્ટ્રેલિયામાં ૪.૭ ટકા નોંધાયેલ હતું.

ભૂભૈતિક (જિયોફિઝિકલ) દુર્ઘટનાઓ વિશ્વમાં જે નોંધાઈ, તે પૈકી મહત્તમ એશિયા દુર્ઘટનાની હિસ્સે ૬૮ ટકા તથા અમેરિકામાં ૨૭.૬ ટકા નોંધાયેલ. આફિકામાં ૩.૫ ટકા નોંધાયેલ—જિયોફિઝિકલ દુર્ઘટનાનો ભોગ બનેલ તેનું ટકાવારી મહત્તમ પ્રમાણ એશિયા ૭૮.૫ ટકા

તथा અમેરિકા ૨૦.૨ ટકા નોંધાયેલ હતું. તેવી જ રીતે આર્થિક નુકસાનીમાં ૭૮.૮ ટકા તથા અમેરિકા ૨૧.૧ ટકા નોંધાયેલ હતું.

સમગ્ર વિશ્વમાં હાઈડ્રોલોજિકલ દુર્ઘટનાઓ જે ૨૦૧૫માં નોંધાઈ છે, તે પૈકી એશિયા મહત્તમ ૪૫.૧ ટકા, અમેરિકા ૨૩.૬ ટકા, આફ્રિકા ૧૮.૮ ટકા, યુરોપ ૧૦.૬ ટકા તથા ઓસ્ટ્રેલિયામાં ૨.૩ ટકા નોંધાયેલ છે. આ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનેલ કુલ લોકોમાં મહત્તમ એશિયા ૮૬.૬ ટકા હતું એટલે કે બાકીના ચાર ઉપભંડો આફ્રિકા, અમેરિકા તથા એશિયામાં આ પ્રમાણ કુલ ૧૩.૧ ટકા નોંધાયું હતું. આર્થિક નુકસાનીમાં એશિયા ૫૮.૫ ટકા, અમેરિકા ૨૬.૩ ટકા, યુરોપ ૧૧.૮ ટકા જ્યારે બાકીના બે ઉપભંડોમાં કુલ ૨.૪ ટકા હતું.

સમગ્ર વિશ્વમાં આમ એકંદરે એશિયા દુર્ઘટનાચ્ચસ્ત મહત્તમ રહે છે. આફ્રિકા-અમેરિકા પદ્ધતિના કમે છે. અતે એ ઉદ્દેખનીય છે કે (૧) વિશ્વની કુલ જનસંખ્યામાં મહત્તમ ગ્રામીણ જનસંખ્યા એશિયામાં છે, (૨) ટેક્નાલોજીનો મહત્તમ વ્યાપ અમેરિકા-યુરોપમાં છે, જ્યારે શૈક્ષણિક સામાજિક સ્તરે પદ્ધતપણું મહત્તમ એશિયા તથા આફ્રિકામાં જોવા મળે છે.

આપદા અને વિવિધ પરિબળો

સમગ્ર વિશ્વમાં આપણે જોયું તેમ એશિયાખંડ વિશેષ કરીને ભારતમાં પ્રાકૃતિક અને અથવા માનવજન્ય આપદાઓનું અતિકમણ નિરંતર જોવા મળે છે. આ માટે વિવિધ અભ્યાસોનો સારભાગ જો ધ્યાનમાં લેવામાં આવે, તો (૧) જનસંખ્યાવૃધ્ય (૨) આણઘડ શહેરીકરણ (૩) ઋતુચકની અનિયમિતતા (૪) સામાજિક સંસ્થાકીય ચિત્ર અને (૫) વ્યવસાયિક સંચાલનનો અભાવ મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં ભારત જેવા દેશનો જનસંખ્યા વૃદ્ધિદર મહત્તમ છે. ૧૯૮૧ની તુલનામાં તેમાં અવશ્ય વિધાયક ફેરફારો જોવા મળેલા છે, પરંતુ વર્તમાન વૃદ્ધિદર ચિંતાજનક ગણવી શકાય. રાષ્ટ્રની કુલ જનસંખ્યાના સંદર્ભમાં વૃદ્ધિદર ઊંચો હોવાના કારણે ‘ગરીબી’ના વિષયકમાંથી મુક્તિ કપરી

બનેલ છે.

ગરીબી-નિરક્ષારતા-બેરોજગારી સ્વભાવિક રીતે જ ‘પ્રતિકાર શક્તિ’ ઓછી કરે છે, એટલે કોઈ પણ આપદા સાથે સુરક્ષાનો અભાવ હોય, તેવા લોકોનું પ્રમાણ વધારે હોય છે. જનસ્માનો મોટો ભાગ સંકાળિકાળમાં છે, એટલે કે વિજ્ઞાન ટેક્નાલોજીના સહારે રોગચાળાથી રક્ષણ માટે ઈંજીનીય છે પ્રયત્નશીલ છે, પરંતુ જન્મદર-નિયંત્રણના સંદર્ભમાં ‘કુદરત’ પ્રારબ્ધને આધીન વધુ રહે છે. વસ્તિ સ્વયં ‘જવાબદારી’ સમજવાને બદલે અસ્કામત સમજનારો વર્ગ આજે પણ છે. વધતી જતી જનસંખ્યાને લીધે કુલ માંગમાં જે ઝડપથી જેટલી માત્રામાં વધારો થાય છે, તેની તુલનામાં પુરવઠો વધી શકતો નથી. પુરવઠો વધારવા માટેના પ્રયત્નોની નકારાત્મક બાધ્યતાના જોખમો વધતાં જાય છે. આ સમગ્ર પ્રક્રિયાના કારણે ગામડાં ખાલી થતાં જાય છે. શહેરીકરણની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક દસ્તિ, યોજનાકીય કૌશલ્યનો સ્પષ્ટ અભાવ વર્તાય છે, જેથી આપદાઓના પ્રતિરોધનું તંત્ર ગોઠવાતું નથી.


આપદા-સંચાલન સ્વયં જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મેન-મટીરિયલ અને મેનેજમેન્ટની આવશ્યકતા છે. જનજીવનની સામાજિકતા સાંસ્કૃતિક પરિપક્વતા આપદા સંદર્ભમાં જે ‘પરિવર્તન’ અપેક્ષિત છે. તેનો અભાવ જોવા મળે છે. આપદા-સંચાલન કેવળ ‘ધન’ નો પ્રશ્ન નથી. ‘ધન’ તો જોઈશે જ પરંતુ ‘માનસિકતાના બદલાવ’ વગર બંડોળની

ફાળવણીથી અપેક્ષિત પરિણામ મેળવી શકાય નહિ.

રાષ્ટ્રીય વ્યૂહ-પરંપરાગત સ્વરૂપે આપદાને સંકટ સમજવામાં આવે છે અને આવનારા સંકટ અથવા આવેલા સંકટના સંદર્ભમાં ‘કટોકટી’ એક અલગ વિભાગ ચલાવી તેના દ્વારા તત્કાલ કઈ રીતે કામ લઈ શકાય, જેમાં મુખ્યત્વે બચાવ અને રાહતનો સમાવેશ થાય છે. હવે બદલતા સમયમાં નવા જ અભિગમની આવશ્યકતા ઊભી થઈ છે. આપદા-સંચાલનની વ્યૂહરચનામાં લોકશાહી પ્રક્રિયામાં ઊભા થયેલાં નવા પરિણામો, વૈશ્વિક સ્તરે આકાર પામતા નવા વિકલ્પો, ટેક્નોલોજી અને વિજ્ઞાનના વધતા જતાં વ્યાપને ધ્યાનમાં લઈને નવા જ સ્વરૂપે બહુપાંખી વ્યૂહરચનાને અમલમાં મૂકવા માટે સમગ્ર તંત્ર પ્રયત્નશીલ છે.

નવા અભિગમમાં ‘અસુરક્ષિતપણા’ને સંકટ તરીકે નિહાળવાની વાત છે, એટલે કે ‘આપદા’ સંદર્ભમાં પ્રતિરોધક વ્યૂહરચના ઉપર ભાર મૂકવામાં આવે છે. વર્તમાનમાં સમાજવિજ્ઞાન, રાજનીતિ, ટેક્નોલોજીના સુમેળભરી વ્યૂહરચના માટેનું વલણ વધુ જોવા મળે છે.

સમગ્રલક્ષી ગણતા આ અભિગમમાં અસુરક્ષિત અથવા તો સંભવિત અસુરક્ષિત વર્ગની સુરક્ષા અર્થે ક્ષમતાવૃદ્ધિને માધ્યાન્ય આપવામાં આવ્યું છે. આપદાના ‘જોખમો’ સામાન્ય જનતા માટે તેમજ સૂત્રધારો માટે - સર્વેને માટે પડકારણ છે. ‘જોખમો’ તરફનો અભિગમ આપદા-સંચાલનનું મહત્વનું પાસું છે.




ઉપરના ચક્થી સ્પષ્ટ થાય છે કે સમાજને એકંદરે આપદાત્રત ઓછો કરવા માટે સંચાલનની કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. પર્યાવરણીય ટકાઉક્ષમતા એ આયોજિત વ્યૂહરચનાનું જ પરિણામ હોય છે. છેલ્લાં ૫૦ વર્ષમાં થયેલા અભ્યાસોના તારણમાં પણ એ સ્પષ્ટ થયું છે કે વિજ્ઞાન અને ટેક્નાલોજીના મનવડંત અનિકમણ, અવિવેકપણુંના ઉપયોગના કારણે આપદાઓનું પ્રમાણ વધતું રહ્યું છે. આ સંદર્ભમાં સમાજને સાવધ કરવાનો પડકાર મોટો છે. માનવીય પ્રકૃતિ ટૂંકાગાળામાં મહત્વમાં લાભ લેવાનો હોય છે. જેના પરિણામે લાંબા ગાળો જોખમો નિર્માણ થાય છે. અને આ જોખમો એટલાં હળવે-હળવે નિર્માણ થાય છે કે જ્યારે વિકાળરૂપ ધારણ કરે છે, ત્યારે જ સમાજને તેની ભયાનકતાનો ઘ્યાલ આવે છે. પરંપરાગત સમાજમાં ‘પાણી પહેલાં પાળ બાંધવી’ અને આજની ભાષામાં ‘પ્રિવેન્શન’ કહે છે. આપદાના જોખમોને હળવાં કરવા માટે પણ ‘પ્રિવેન્શન બેટરેન કયોર’નો મંત્ર લાગુ પડે છે. તૈયારી કેવી રીતે થાય? તેમાં શું કરવું ઘટે. તૈયારી ‘પંચતત્ત્વ’નું પરિણામ છે. આપદાથી બચવા, આપદા સામે સુરક્ષિતપણું વધારવા માટે જે તૈયારી કરવાની થાય છે, તેમાં સહુગ્રથમ ‘તાલીમ’ બાદ ‘સભાનતા’ ‘સાવધાની’- ટેક્નિકલ સર્વેક્ષણ અને સંસ્થાકીય વાતાવરણ નિર્માણ કરવાની વાત છે. તંત્ર આ બધાં જ કામોની જવાબદારી લેશે તોપણ તેમાં કારગત થઈ શકાય નહિ. જ્યાં સુધી સમાજ સભાનતાપૂર્વક પ્રતિસાદ ન આપે, લોકશાહી રાજ્યતંત્રમાં આવા કોઈ પણ નીતિવિષયક કાર્યક્રમોની સફળતાનો આધાર ‘જનજીગૃતિ’. લોર્ડ બ્રાઇસે કહ્યું છે તેમ એટરનલ વિજિલન્સ ઈઝ ધ પ્રાઈસ ઓફ ટેમોકેસી.

તંત્ર દ્વારા નિર્ણયીકરણની ક્ષમતામાં સુધારો થાય તે આવશ્યક છે. છેલ્લા એક દાયકામાં આ સંદર્ભમાં વિધાયક પરિણામો

દેખાઈ રહ્યાં છે. આપદાઓની આગાહીના પરિપ્રેક્ષમાં બચાવતંત્રને સાબદું કરવા માટેના સર્વ પ્રયત્નોના પરિણામો હળવે-હળવે જોવા મળી રહ્યાં છે, અલબાત ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં આ ‘પાશેરાની પહેલી પૂણી’ સમાન છે. માળખાકીય સ્થિતિમાં જેમજેમ સુધારો થતો જાય છે, ખાસ કરીને પ્રત્યાયન સંદેશાવ્યવહારની શીધતાએ તત્કાલીન ભયાનકતા ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

બીજી તરફ નવા આકાર પામતાં સર્વ પ્રકારનાં બાંધકામો આપદામુક્ત બની રહે તે માટે ઈજનેરી સંશોધનોને બાંધકામ નિયમો સાથે જોડવાની પદ્ધતિ અમલમાં હોવાથી હળવે હળવે નુકસાનીનું પ્રમાણ ઘટતું રહ્યું છે.

વિશ્વનાં બધા જ વિકાસશીલ રાષ્ટ્રોમાં હળવે-હળવે ‘આપદા-સંચાલન પદ્ધતિ’ કાયમી સ્વરૂપે આકાર પામી રહી છે. ભારતમાં પણ આ પદ્ધતિ આકાર પામી રહી છે. આ પદ્ધતિ અતિ આધુનિક ઉપકરણોથી સજજ છે. આપદા દેશમાં ‘ઈન્ડિયાડિઝાસ્ટ્રેસ રિસોર્સ નેટવર્ક’ www.idrn.gov.in કાર્યરત છે, જે છેક તણિયે – જિલ્લા મથકથી લઈને રાષ્ટ્રીય વડામથક સુધી સંલગ્ન અને સુસજજ છે. ૨૦૦૫થી આ સંદર્ભમાં વાપક કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના પરિણામે લગભગ ૧૦૦ ટકા વિશ્વસનીય તંત્રક્ષમતા નિર્માણ થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત સમગ્ર માળખાકીય રચનાને સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય.



ડૉ. તુખાર હાથી નિવૃત પ્રિન્સીપલ અને પૂર્વ વાઈસ ચાન્સેલર છે.

ગુજરાતમાં 'આપત્તિ વ્યવસ્થાપન'

ડૉ. લીલાબેન સ્વામી



રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એંથોરિટી દ્વારા બે બાબતોનું ધ્યાન રાખ્યું છે. વળી, ગુજરાતમાં આવા ડેફ્ઝોવાળી સૈચેચ્ક સંસ્થાઓ પણ કાર્યરત છે. રાજ્યમાં સ્થપાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એંથોરિટીનું વ્યવસ્થાતંત્ર આપત્તિ કે આપત્તિ પદ્ધીની એકદરે પ્રશંસનીય કામગીરી બજાવે છે, પરંતુ રાજ્યમાં આપત્તિ આયોજનનું જિલ્લા કક્ષાએ મહેસૂલ વિભાગમાં કલેક્ટરના નિયંત્રણમાં આ કામગીરી કરવામાં આવે છે. જિલ્લા કક્ષાના આપત્તિ તકેદારી કાર્યક્રમમાં ઘણે અંશે વિવિધ સરકારી અને અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારીઓ કામગીરી બજાવે છે. આપત્તિ-આયોજનને વધુ અસરકારક બનાવવા માટે કાયમી અને અલાયદા પૂરતા સ્ટાફ સાથેના વ્યવસ્થાતંત્રની આવક્ષતા છે. આ ઉપરાંત એન.સી.સી., એન.એસ.એસ., સ્થાનિક સંગઠનો, યુવક મંડળો વગેરેને અસરકારક તાલીમ આપીને સજજ કરવાનું જરૂરી છે. સિવિલ ડિફેન્સ સોસાયટી જેવી સંસ્થાઓ દરેક નગરમાં રચાય અને તેના દ્વારા વધુ લોકોને તાલીમબદ્ધ કરવામાં આવે તે પણ જરૂરી છે. આમ રાજ્યના આપત્તિ-આયોજનની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.

'નોંધ'

પદ્ધતિને અવસરમાં પલટીએ'

- શ્રી નરેન્દ્ર મોદી

સને ૨૦૦૧માં (૨૬મી

જાન્યુઆરી) ગુજરાતમાં આવેલ મહાવિનાશક ભૂકુંપથી હેબતાઈ ગયેલ ગુજરાતને બેનું કરવા તથા વિનાશ અને હતાશામાંથી પ્રજાને બહાર લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેરક સૂત્ર આપ્યું - "આવો આપણો આપત્તિને અવસરમાં પલટીએ." લોકોમાં ઉત્સાહ જગાવવા માટે 'ધરતીની આરતી' નો રાજ્યવ્યાપી કાર્યક્રમ આપ્યો અને રાજ્યમાં આવતી હોનારતોને પહોંચી વળવા માટે 'આપત્તિ-આયોજન' ના વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી.

ભારતનો સૌથી મોટો ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતો પ્રદેશ ગુજરાત છે. આવો વિશાળ દરિયાકાંઠો હોવાના કારણે વારંવાર દરિયાઈ મોંઝાંઓ અને દરિયાઈ વાવાળોડાં આવતાં હોય છે, જેને કારણે ઘણી જાનહાનિ અને માલહાનિ થતી હોય છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં રણ છે. રણને કારણે ગરમ અને તેજ પવનો ઝૂંકાય અને વંટોળ સાથે આંધી ગમે ત્યારે આવીને અનેક હોનારતો સર્જે છે. અતિ વરસાદ, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, નદીઓનાં પૂર તેમજ ગ્રામીણ અને શહેરી

વિસ્તારમાં પાઇના પૂરતાં નિકાલની વ્યવસ્થાનો અંતરાલ થોડા સમય માટે જાનમાલની હાનિ સંભવે છે. આમ, ગુજરાતની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અનુસાર અવારનવાર જુદા-જુદા પ્રકારની કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, દરિયાઈ વાવાળોડાં, આંધી અને કયારેક ભૂકુંપ આવે છે. વિવિધ ઋતુઓમાં વાયરલ આધ્યારિત કે અન્ય સ્વરૂપે રોગચાળા જેવા કે કોલેરા, ડેન્યુ, સ્વાઈનફ્લુ વગેરે ફેલાય છે. વળી આધુનિક યંત્રવૈજ્ઞાનિક સમય સંદર્ભે માનવસર્જિત તે આકસ્મિક આપત્તિઓ, અક્રમાતો સર્જાય છે. આ બધી કુદરતી અને માનવસર્જિત તેમજ આકસ્મિક આપત્તિઓ નાનામોટા પ્રમાણમાં જાનહાનિ, માલહાનિ તથા વિનાશ સર્જે છે. આના પરિણામે માનવમૂડી ઉપરાંત અર્થતંત્રને પણ ઘણી વિપરીત અસરો થાય છે. સામાન્ય રીતે મહેસૂલી વિભાગ, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ આપત્તિઓ પ્રસંગે પ્રવૃત્ત થાય છે.

૨૧મી સદીના પ્રારંભે ગુજરાતમાં (૨૬ જાન્યુઆરી, ૨૦૦૧માં) આવેલ રાજ્ય વ્યાપી મહા ધરતીકુંપની કલ્પનાતીતી વિનાશક અસરો પછી રાજ્ય સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અર્થાત આપત્તિ આયોજન વિભાગની રચના કરી. રાજ્યમાં આ વિભાગની જવાબદારી જિલ્લા સ્તરે મહેસૂલી વિભાગને એટલે કે કલેક્ટરને

આધીન છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની કામગીરી આ વ્યવસ્થાને પરિણામે સંકલિત રીતે થાય છે.

આપત્તિઓ અર્થ

ભગવદ્ગોમંડળ શબ્દકોશ અનુસાર, ‘કોઈ પણ પ્રકારની સજ્જવસૃષ્ટિ, જાનહાનિ, માલમિલ્કતની હાનિની ગંભીર કે વ્યાપક અસરને આપત્તિ, અનિષ્ટ પ્રસંગ, વિપત્તિ, સંકટ, આપદા, મુશ્કેલી, હોનારત વગેરેને આપત્તિ કહેવાય છે.’

આપત્તિ એટલે મુશ્કેલી, મુશ્કેલ સ્થિતિ, તકલીફ, વ્યક્તિગત સંદર્ભમાં ‘આપત્તિ’નો સામાન્ય રીતે પ્રયોગ થાય છે. આર્થિક, શારીરિક, સામાજિક એમ જુદા-જુદા સ્વરૂપે વ્યક્તિગત રીતે આપત્તિ આવતી હોય છે. સંકટ કે મુશ્કેલી કે વિપત્તિ જેવા શબ્દો આપત્તિના પર્યાયમાં વપરાતા હોય છે. દુઃખદાયક-પીડાકારક સ્થિતિ એટલે વિપત્તિ. વિપત્તિ એટલે વિપરીત સ્થિતિ. આપત્તિ એટલે હાનિકારક સ્થિતિ. જ્યારે કોઈ સ્થળ, ગામ, શહેર, પ્રદેશ, દેશ કે પૃથ્વીના કેટલાંક ભૂભાગમાં વિપરીત ઘટના સર્જય અને તેની પ્રતિકૂળ કે હાનિકારક અસરો થોડા કે વધુ માનવસમૂહ ઉપર થાય, ત્યારે તેને આપત્તિ Disaster કહે છે. ડિઝાસ્ટર એટલે એવી હોનારત-ઘટના કે આકસ્મિક આવે અને જેની ગાઢ-ધેરી અસરો માનવસમૂહ ઉપર થવા પામે.

ડિઝાસ્ટર એ એવી સ્થિતિ છે કે જેમાં કુદરતી કે માનવસર્જિત ઘટના આકસ્મિક ઘટે છે અને કોઈ સીમિત કે મોટા વિસ્તારમાં લોકો ઉપર વિવિધ રીતે ગાઢ પ્રતિકૂળ અસરો સર્જ છે. આવી ઘટનાઓથી પશુ હાનિ, જાનહાનિ, માલમિલ્કતની હાનિ થવા પામે છે. કુદરતી આફિત, વિનાશક

ઘટના, રેલ સંકટ, મહાવિનાશક ભૂકુંપ, વિનાશક વાવાઝોડું જેવા શબ્દપ્રયોગો વપરાય છે.

આપત્તિઓના પ્રકારો:-

શ્રી કટારસિંહ અને શ્રી વિશ્વ વલ્લભને ટાંકીને શ્રી સુદર્શન આયંગરે ઉદ્ભૂત ગુજરાત અર્થશાખ પરિષદમાં ‘કુદરતી હોનારતોની આર્થિક અસરો’ : ગુજરાત નામના પેપરમાં નોંધેલ વિવિધ હોનારતોનું વર્ગીકરણ થોડા સુધારા સાથે આ પ્રમાણે દર્શાવી શકાય:

- (૧) પાણી અને હવામાન સંબંધી હોનારતો: અતિવૃષ્ટિ, આંધી, ટોનરિડો, હરિકેન, ટાયફુન, સાયક્લોન, સ્નો-ફોલ, વાદળ ફાટવાં, શીત અને ઉષ્ણ લહેરો, હિમ શિલાનું સ્ખલન, દુષ્કાળ, સમુદ્રનો ધરારો, વીજ પડવી વગેરે.
- (૨) ભૂસ્તરજ્યન્ય હોનારતો: ભૂસ્ખલન, ભૂકુંપ, સુનામી, બંધ ફાટવા કે તૂટવા, ખાણમાં લાગતી આગ.
- (૩) આણિવક અને રાસાયણિક હોનારતો: ઔદ્યોગિક-રસાયણ હોનારત, ઔદ્યોગિક રસાયણ અને આણુશક્તિ સંબંધી.
- (૪) આકસ્મિક હોનારતો: દાવાનળ, શહેરોમાં ફાટી નીકળતી આગ, ખાણમાં પૂર, સમુદ્રમાં ખનિજતેલનું ફોળાવું, ઈમારતો ધંસ થવી, શૂંખલા બાંંખ વિસ્કોટ, ઉત્સવો કે મેળાવડામાં થતી હોનારતો કે ભીડને લીધે થતી નાસભાગમાં અક્સમાતો, હવાઈ, રેલવે તથા રસ્તાના અક્સમાતો, યુદ્ધ, હુલ્લડ-તોફાન-દંગાફસાદ, બળવો, શૂંખલા બોંખ-વિસ્કોટ, દૂષિત ખાદ્યજ્યન્ય રોગચાળો, તીડાનાં આકમણો, પશુઓના રોગચાળા, પ્લોગ, ચીકનગુનિયા, સ્વાઈનફ્લુ જેવા રોગચાળા પણ ભયંકર હોનારતો સર્જરીને માનવજીવન અને જાનમાલને નુકસાન પહોંચાડે છે.

હોનારતો, યુદ્ધ, હુલ્લડ-તોફાન-દંગાફસાદ, બળવો વગેરે.

- (૫) જૈવિક હોનારતો: જૈવિક હોનારતો અને રોગચાળો, ક્રીટ-હુમલાઓ-પાકના રોગો, અલનીનો, પશુઓનો રોગચાળો, દૂષિત ખાદ્યજ્યન્ય રોગચાળો, તીડાનાં આકમણો.

ગુજરાતમાં આ પૈકી ઘણી હોનારતો જેવી કે અતિવૃષ્ટિ, આંધી, સમુદ્રના વાવાઝોડાં, ભૂકુંપ, બંધ તૂટવા, ઔદ્યોગિક-રસાયણ હોનારત, શહેરોમાં ફાટી નીકળતી આગ, ઉત્સવો કે મેળાવડામાં થતી હોનારતો કે ભીડને લીધે થતી નાસભાગમાં અક્સમાતો, હવાઈ, રેલવે તથા રસ્તાના અક્સમાતો, યુદ્ધ, હુલ્લડ-તોફાન-દંગાફસાદ, બળવો, શૂંખલા બોંખ-વિસ્કોટ, દૂષિત ખાદ્યજ્યન્ય રોગચાળો, તીડાનાં આકમણો, પશુઓના રોગચાળા, પ્લોગ, ચીકનગુનિયા, સ્વાઈનફ્લુ જેવા રોગચાળા પણ ભયંકર હોનારતો સર્જરીને માનવજીવન અને જાનમાલને નુકસાન પહોંચાડે છે.

આપત્તિઓની અસરો :

કુદરતી અને માનવસર્જિત હોનારતોની ઘણી માઠી અસરો વ્યક્તિગત અને સામૂહિક થાય છે. આ અસરો માનવ જીવન ઉપર તાત્કાલિક અને કેટલીક ટૂંક ગાળાની તો કેટલીક અસરો લાંબા ગાળાની દૂરોગામી હોય છે. આ અસરોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

૧. આર્થિક અને બિનઆર્થિક અસરો.

(અ) આર્થિક અસરો:

૧. કુદરતી હોનારતો કે આપત્તિઓને કારણે માનવીઓને શારીરિક ઈજાઓ પહોંચવાથી તેમજ જાનહાનિ થવાથી માનવ-મૂરીરોકાળમાં ઘટાડો થાય છે. દુશનો કેળવાયેલો અને ઉત્પાદક શ્રમ

- મૃત્યુ પામે કે ઈજાગ્રસ્ત બને, પરિણામે તેની ઉત્પાદકતા અને કાર્યક્રમતા તે ગુમાવે છે. માનવ-સંસાધનનો દુર્વ્યથ થતાં કામના કલાકોનો દુર્વ્યથ થાય છે, તેથી માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રને ખૂબ મોહૂં નુકસાન થાય છે.**
- ૨. રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ જેવી કે રસ્તા, રેલવે, પુલ, હોસ્પિટ્લો, શાળા કોલેજો, સરકારી અને બિનસરકારી કચેરીઓ, મકાનો, ફુકાનો, કારખાનાં, યંત્રસામગ્રી જેવી ભૌતિકસંપત્તિનો નાશ થાય છે અથવા ક્ષતિગ્રસ્ત થાય છે. પરિણામે ઈન્ફાસ્ટ્રક્ચર અને ભૌતિક-સંપત્તિનું ભારે નુકસાન થતાં ઉત્પાદન અવરોધાય છે, તેથી ગરીબી વધે છે અને લોકોનું જીવનધોરણ કથળે છે, જેથી રાષ્ટ્ર ઉપર બોજો વધે છે અને આખરે એ બોજો રાષ્ટ્રના નાગરિકોએ ઉઠાવવો પડે છે.**
- ૩. પશુધન નાશ પામે છે, પાક નિષ્ફળ જાય છે, કૃષિઉપજ ઘટે છે અને જમીનની ફણદુપતા ઘટે છે. આના પરિણામે કૃષિ અને પ્રાથમિક ક્ષેત્રે ઘણું આર્થિક નુકસાન થાય છે.**
- ૪. રાજ્યે લોકોના પુનર્વસન માટે, બાંધકામ અને મરામત માટે, રાહતકાર્યો માટે તથા આરોગ્ય જીળવણી માટે પુષ્ટ ખર્ચ કરવો પડે છે, જેનો ભારે બોજ સરકારી તિઝોરી ઉપર આવે છે અને આફિતોને કારણે રાજ્યને ખર્ચ થવાથી વિકાસ અને કલ્યાણકારી કાર્યો પાછળ થતાં ખર્ચ ઉપર કાપ આવે છે.**
- (બ) બિનઆર્થિક અસરો:**
૧. હોનારતોમાં થતી જાનહાનિને પરિણામે અનાથ બાળકો, અપંગો, વિધવાઓ, નિરાધાર વડીલોના પુનર્વસનના પ્રશ્નો ઉદ્ભવે છે. કુટુંબથી વિખૂટા પડેલાં તેમજ અનાથ, અપંગ અને નિરાધાર થયેલા લોકો માટે સામાજિક અલગાવની સમસ્યા સર્જાય છે. આવા લોકો જીવનમાં આર્થિક અને સામાજિક અસલામતીનો ભોગ બને છે. તેમને ભવિષ્યની ચિંતા સત્તાવે છે.
 ૨. કુદરતી હોનારતો તેની ભયાનક અસરો વડે માનસિક આધાત, તનાવ, હતાશા અને માનસિક બીમારીની સ્થિતી સર્જે છે. વળી, હોનારતોની ભયાનકતા લોકોમાં ડર અને અસલામતીની ભાવના વધારે છે.
- ઉપાયો:**
- 'Prevention is better than cure' એ કહેવત સંદર્ભે આપત્તિનું વ્યવસ્થાપન જરૂરી ગણાય. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઈ.સ. ૧૭૮૬માં પૂર, હોનારતો ઉપર કાબુ મેળવવા માટે સિંચાઈ, વ્યવસ્થાપન તેમજ ૧૮૨૭માં દુષ્કાળોની સ્થિતિ હળવી કરવા માટે દુષ્કાળપંચ રચવામાં આવ્યું હતું. ભારત સરકારે ૧૮૫૪માં રાષ્ટ્રીય પૂરનિયંત્રણ નીતિ જાહેર કરી હતી. ગુજરાતમાં ઈ.સ. ૧૮૧૮માં વિનાશક ભૂકુપ આવ્યો હતો. વિકભસંવત ૧૮૫૬માં ગુજરાતમાં આવેલ 'છઘનિયો દુકાળ'માં ભારે માનવ તેમજ પશુધનની જાનહાનિ થઈ હતી. ઈ.સ. ૧૮૭૮ના વર્ષે મોરબી પાસે મદ્દુરેમ તૂટવાથી મોટી પૂર, હોનારત સર્જાઈ હતી. ગુજરાતના દરિયાકિનારે અવારનવાર વિનાશક
- વાવાજોડાં આવ્યાં છે, પરંતુ ઈ.સ. ૨૦૦૧માં થયેલ રાજ્યવ્યાપી મહાવિનાશક ભૂકુપ પછી દેશમાં સૌપ્રથમ વાર ગુજરાત રાજ્યે આપત્તિ, વ્યવસ્થાપન ની જોગવાઈ કરી હતી. એપ્રિલ ૨૦૦૩માં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી અને આ ઓથોરિટીના અલાયદા કમિશનરની દેખરેખ હેઠળ રાજ્યના બધા જિલ્લાઓમાં આપત્તિનું વ્યવસ્થાતાં ગોઠવવામાં આવ્યું.
- આપત્તિ-વ્યવસ્થાપન બે પ્રકારનાં હોય છે.
- અ. આપત્તિપૂર્વનું વ્યવસ્થાપન**
- બ. આપત્તિ દરમિયાન અને આપત્તિ પછીનું વ્યવસ્થાપન**
- અ આપત્તિપૂર્વનું આયોજન:**
- ૧. વ્યવસ્થાપન અને કાનૂની આધાર:**
- રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચનાએ આપત્તિઓ સામેના પૂર્વાયોજનનું અત્યંત મહત્વનું પગલું છે. આ ઓથોરિટીના સ્વતંત્ર કમિશનરની દેખરેખ હેઠળ દરેક જિલ્લાવાર આપત્તિ-વ્યવસ્થાપન વિભાગ કલેક્ટરના તાબામાં ગોઠવવામાં આવ્યું છે. આ ઓથોરિટી અંતર્ગત સંભવિત આપત્તિઓને ધ્યાનમાં રાખી ને તેને અસરકારક રીતે પહોંચી વળવા માટે આપત્તિ સમયે જાહેરાતમાં કલેક્ટરને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. કોઈ પણ સરકારી તેમજ ખાનગી મકાનો, જગ્યાઓ, વાહનો અને સાધનો સરકાર આપત્તિ પ્રસંગે હસ્તગત કરી ઉપયોગમાં લઈ શકે છે. આવા

પ્રસંગોએ ખાનગી મિલકતોમાં પ્રવેશવા, ખોલવા કે તોડવાની સત્તા કલેક્ટરને આધીન કરવામાં આવી છે.

૨. માહિતી- એકત્રિકિકરણ:

સંભવિત હોનારતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે જરૂરી માહિતીઓ જિલ્લા કક્ષાએ એકત્ર કરવામાં આવે છે, જે-તે જિલ્લામાં ભૂતકાળમાં થયેલી મોટી હોનારતો તથા તેને આધારે સંભવિત હોનારતોની યાદી તૈયાર કરવામાં આવે છે. વિવિધ હોનારતોને કારણે થનાર વિવિધ પ્રકારનાં સંભવિત નુકસાનની માહિતી એકત્ર કરવામાં આવે છે. તથા ભાવિ બચાવ કામગીરી અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. બચાવ માટે જરૂરી વિવિધ સાધનોની ઉપલબ્ધ વિશે માહિતી તૈયાર કરવામાં આવે છે. જેમકે મકાનો, વાહનો, ટ્રકો, જ્યો, ટ્રેક્ટર, ટ્રોલી, ટેન્કર, જે. સી. બી. વગેરે. આ ઉપરાંત જે-તે જિલ્લામાં કાર્યરત સૈચિદ્ધ સંસ્થાઓ, સ્થાનિક સંગઠનો, એન.એસ.એસ., એન.સી.સી. વગેરે તથા તેના સંચાલકો, હોદ્દારોનાં નામ, સરનામા અને સંપર્ક નંબર વગેરેની માહિતી એકત્ર કરવામાં આવે છે.

૩. પૂર્વચેતવણીની વ્યવસ્થા :

હવામાનખાતા તથા સેટેલાઈટ જેવાં સાધનોના ઉપયોગ વડે પૂર, અતિવૃષ્ટિ, વાવાજોડાં, વંટોળ જેવી આપત્તિઓ અંગે ચેતવણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વિકસિત દેશોના સહયોગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

૪. બાંધકામમાં આધુનિક ટેક્નોલોજી:

ભૂકૂપ સમયે મકાનો અને રહેઠાળોને

ન્યૂનતમ નુકસાન થાય તે માટેની ભૂકૂપ પૂરુષ બાંધકામ પદ્ધતિ વિકસાવવામાં આવી છે તથા નવાં બિંડિંગ્ઝ માટે ભૂકૂપ-પૂરુષ ટેક્નોલોજીના ઉપયોગ સંબંધે પ્રમાણપત્ર લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ડિઝાસ્ટર પ્રિપેર્નેશ સૈચિદ્ધ સંસ્થા દ્વારા ભચાઉ પાસે ટેક્નોલોજીપાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સલામત બાંધકામ અંગેની તાલીમ અને માહિતી આપવામાં આવે છે.

૫. તાલીમશિબિરો યોજવી:

ભૂકૂપ તેમજ અન્ય આપત્તિઓ સમયે બચાવ કામગીરી તથા પ્રાથમિક સારવાર અંગેની તાલીમ યુવાનોને આપવામાં આવે છે.

૬. આપત્તિની સંભવિતતા વેળાએ લોકોમાં જાગૃતિ કેળવવા તથા સ્વભચાવ કરવા અંગેની માહિતીઓ તૈયાર કરવામાં આવે છે.

આવી આપત્તિઓ વારંવાર ઉદ્ભવતી હોવાથી આપત્તિ પહેલાં કે આપત્તિ દરમિયાન વ્યવસ્થાપન સ્થાપિત કરવું અતિ આવશ્યક છે. આપણે ત્યાં પૂર્ણી શક્યતાઓ વધુ હોવાથી બચાવ કામગીરીના ભાગ રૂપે તરવૈયાઓ અને હોડીઓ તૈયાર રાખવી તેમજ આગ લાગવાના સમયે અભિનશામક સાધનો, અભિન શામકમાં કામ કરતાં લોકોના એસેટેસનાં(Asbestos) કપડાં, બચાવ કામગીરીનાં સાધનો અને તેનું તંત્ર સજજ રાખવું પડે. આપત્તિ એટલે કે તરત કામ કરવું.

તાલીમ પામેલા માણસો તૈયાર કરવા, તેની આખી વ્યવસ્થાનું ઓર્ગેનાઈઝેશન ગામડાં સુધી તૈયાર

કરવું. માહિતી-સૂચના પહોંચાડવી, માણસોને બચાવ-કામગીરી માટે મોકલવા, હેલિકોપ્ટર, વાહનો, હોસ્પિટલોમાં સ્ટાફ રાખવો, દીજાગ્રસ્ત લોકોને વાગવાથી લોહીની જરૂરિયાત સમયે બ્લડબેકમાં લોહીની બોટલોની સજજતા અને આયોજનનું માળખું તૈયાર કરવું અત્યંત આવશ્યક છે.

૭. આપત્તિ દરમિયાન અને તે પછીની કામગીરી:

આપત્તિનું પૂર્વાયોજન એક ડિઝાસ્ટર પ્રિપેર્નેશ છે. જ્યારે આપત્તિ દરમિયાન અને તે પછીની કામગીરી એ ડિઝાસ્ટર મિટીગેશન છે. આપત્તિની ઘટના વખતે અને ત્યાર પછીની કામગીરી અત્યંત મહત્વની હોય છે. આ કામગીરી અને સંભવિત ઉપાયો નીચે પ્રમાણે આપત્તિની પૂર્ણ વિશેના પ્રાથમિક અંદાજો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને મોકલવામાં આવે છે અને જરૂરી નાણાકીય સહાયની માંગ કરવામાં આવે છે.

૧. પ્રાથમિક સજજતા:

કલેક્ટરના નિયંત્રણમાં મહેસૂલ, પૂરવઠા, પોલીસ અને આરોગ્યંત્ર જે પગે તૈયાર રહે છે. આપત્તિ વિશેના પ્રાથમિક અંદાજો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને મોકલવામાં આવે છે અને જરૂરી નાણાકીય સહાયની માંગ કરવામાં આવે છે.

૨. બચાવ-કામગીરી :

હોનારતોમાં ફસાયેલા તેમજ અસરગ્રસ્ત લોકોને બચાવવા અને સહાય પૂરી પાડવા માટે પોલીસ તેમજ જરૂર પડે લશ્કરની મદદ લેવાય છે. વળી, એન.એસ.એસ., એન.સી.સી. તેમજ સૈચિદ્ધ સંગઠનોની સહાય પણ લેવામાં આવે છે.

- ૩. અસરગ્રસ્તોને સહાય:**
- હોનારતમાં અસર પામેલાં લોકોનું હંગામી ધોરણે પુર્વસન કરવામાં આવે છે. જાહેર અને ખાનગી શાળા-કોલેજો તથા સંસ્થાઓ તથા સરકારી મકાનોમાં રહેઠાણની હંગામી વ્યવસ્થા કરવામાં આવે છે. અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, ખાદ્યસામગ્રી, કપડાં, ધાબળાં, સ્ટબ, કેરોસીન, ટોર્ચ, મીણબત્તી, માચીસ, દવાઓ, રોજગારી માટેનાં સાધનો વગેરે જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓનો આ કાર્યમાં સહયોગ લેવાય છે.
- ૪. તબીભી સારવાર:**
- આરોગ્ય વિભાગ તથા રેડકોર્સ સોસાયટી તેમજ ખાનગી હોસ્પિટલો અને ડૉક્ટરોના સહયોગથી ઈજા પામેલાં લોકોને પ્રાથમિક સારવાર તેમજ તબીભી સહાય આપવામાં આવે છે. બીમારી અને રોગચાળા સામે પણ તબીભી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- ૫. હંગામી રહેઠાણ-વ્યવસ્થા :**
- અસરગ્રસ્તોને તાત્કાલીક ધોરણે અસરગ્રસ્ત જગ્યાએથી ખસેડીને સલામત જગ્યાએ રહેવાની હંગામી સુવિધા કરવામાં આવે છે. આ બધા માટે શાળા, કોલેજો, સંસ્થાઓનાં મકાનો તેમજ બધા સરકારી મકાનોનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ જરૂર જગ્યાઓમાં તંબૂઓની વ્યવસ્થા કરવામાં આવે છે.
- ૬. હોનારતોને પરિણામે નુકસાન પામેલ રસ્તા, મકાનો, પુલ તેમજ વીજળી, પાણી, વાહન અને સંદેશાવ્યવહાર જેવી આવશ્યક સેવાઓ ફરીથી કાર્યરત થાય છે. તે માટે મરામત તેમજ જરૂરી કાર્યવાહી જે-તે વિભાગો દ્વારા કરવામાં આવે છે.**
- ૭. આપત્તિ વેળા અભ્યવસ્થા, અંધાધૂંધી, અફવાઓ, લુંટફાટ, ચોરી વગેરેની સમસ્યા સર્જવાની શક્યતા હોય છે. આથી બધી સમસ્યાઓ સામે લોકોને સલામતી પૂરી પાડવા માટે મુખ્યત્વે પોલીસ સક્રિય થાય છે તથા હોમગાર્ડ તેમજ સ્વયંસેવકોની મદદ લેવાય છે.**
- ૮. હોનારતો સમયે ભય, આધાત અને હતાશા લોકોના મનમાં વ્યાપે છે. આથી આવા લોકોને માનસિક સારવાર તથા સામાજિક ટેકો પૂરો પાડવામાં આવે છે. યોગ, ધ્યાન અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ કાર્ય મોટે ભાગે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કરવામાં આવતું હોય છે.**

સમીક્ષા:

આપત્તિ-આયોજનમાં પૂર્વિયારી તથા બચાવ અને સહાય-કામગીરી એટલે કે ડિઝાસ્ટર પ્રિપેર્નેશ અને ડિઝાસ્ટર મિટીગેશન બન્નેનું મહત્વ છે. રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ બન્ને બાબતોનું ધ્યાન રાખ્યું છે. વળી, ગુજરાતમાં આવા ઉદ્દેશોવાળી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કાર્યરત છે. રાજ્યમાં સ્થપાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું વ્યવસ્થાતંત્ર આપત્તિ કે આપત્તિ પછીની એકંદરે પ્રશંસનીય કામગીરી બજાવે છે,

પરંતુ રાજ્યમાં આપત્તિ આયોજનનું અલાયદુષ વ્યવસ્થાતંત્ર રચવાને બદલે જિલ્લા કક્ષાએ મહેસૂલ વિભાગમાં કલેક્ટરના નિયંત્રણમાં આ કામગીરી કરવામાં આવે છે. જિલ્લા કક્ષાના આપત્તિ તકેદારી કાર્યક્રમમાં ધરે અંશે વિવિધ સરકારી અને અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારીઓ કામગીરી બજાવે છે. આપત્તિ-આયોજનને વધુ અસરકારક બનાવવા માટે કાયમી અને અલાયદા પૂરતા સ્ટાફ સાથે ના વ્યવસ્થાતંત્રની આવશકતા હોય છે. આ ઉપરાંત એન.સી.સી., એન.એસ.એસ., સ્થાનિક સંગઠનો, યુવક મંડળો વગેરેને અસરકારક તાલીમ આપીને સજજ કરવાં જરૂરી છે. સિવિલ ડિફેન્સ સોસાયટી જેવી સંસ્થાઓ દરેક નગરમાં રચાય અને તેના દ્વારા વધુ લોકોને તાતીમબદ્ધ કરવામાં આવે તે પણ જરૂરી છે. આમ રાજ્યના આપત્તિ-આયોજનની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની ગુંજાઈશ છે.

ડૉ. લીલાબેન સ્વામી
જે. એમ. આર્ટિસ અને શ્રીમતી
એમ.એન. પટેલ મહિલા કોમર્સ
કોલેજ, ઊંઝામાં પ્રિન્સીપલ છે.

યોજના
વાંચો
યોજના
વંચાવો
યોજના
વસાવો

આપત્તિ-સંચાલન અને ૧ ઉમાં નાણાંપંચની ભલામણો

ડૉ. વંદના ત્રિવેદી



જિલ્લાસ્તરે શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આગ લાગવાના સમયે સુરક્ષા અંગેનું કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે તેરમા નાણાંપંચની ભલામણ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રૂ. ૮૭.૫૧૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ નાણાંનો ઉપયોગ તેઓએ પોતાના અધિકારકોત્તમાં આવતા વિસ્તારોમાં આગજન્ય આપત્તિ સામેની રક્ષણસેવાઓમાં વૃદ્ધિ કરવા માટે કરવાની છે. પહેલેથી ઉપરથી સેવા માળખામાં સુધારો કરવા માટે પણ આ નાણાંનો ઉપયોગ કરી શકાશે. ઉપરાંત આ નાણાંની ફાળવણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજ્યના સ્ટેટ ફાયર સર્વિસીઝ ડિપાર્ટમેન્ટને કરી શકે છે. જોકે, તે માટે એક શરત રાખવામાં આવેલી છે કે, સ્ટેટ ફાયર સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ દસ લાખથી વધારે વસ્તી ધરાવતાં શહેરોમાં (૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે) ફાયર હેઝાર રિસ્પોન્સ ઓન મિટીગેશન ખાન ફરજિયાત પણે અમલમાં મુકવાનો રહેશે. દેશનાં સાત રાજ્યોને આ માટે રૂ. ૪૭૨ કરોડનું ફંડ વિશેષ રૂપે ફાળવવામાં આવ્યું છે.

આપત્તિ

પત્તિ-સંચાલનની વ્યવસ્થાએ પ્રત્યેક દેશ માટે અગત્યની બાબત ગણાય છે. આર્થિક વિકાસના કોઈ પણ તબક્કામાં રહેલા દેશને આ જ્યાલ સ્પર્શે છે. આપત્તિને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે;

આપત્તિ (Diaster)

કુદરતી આપત્તિ	માનવસર્જિત આપત્તિ
દુષ્કાળ, પૂર્ણ, વાવાળોકું, જ્વાળામુખી	આગ, રાસાયનિક, જૈવિક, અણુશક્તિ સંબંધિત,
ફાટવા, ધરતીકંપ,	આતંકવાદી હુમલાઓ, કોમી વાદળ ફાટવાં
	રમખાણ

દેશમાં આપત્તિ-સંચાલન અંગેનું વ્યવસ્થાતંત્ર જો મજબૂત હોય તથા આપત્તિના સમયે પૂરેપૂરી ક્રમતાથી કાર્ય કરી શકે તેવું હોય તેમજ આપત્તિનાં દુષ્પરિણામોને ઓછામાં ઓછાં કરી શકે તે પ્રકારનું કાર્યક્રમ તથા સજજ હોય, તો દેશના આર્થિક વિકાસને માટે તે ફાયદાકરક નીવડે છે. આપત્તિ-સંચાલન ખૂબ જ આયોજન અને કુશળતા માંગી લેનારું કાર્ય છે. આપત્તિ-સંચાલનના મુખ્યત્વે બે ભાગ છે: પૂર્વાપત્તિ-સંચાલન અને પશ્ચાદ આપત્તિ-સંચાલન. મોટા ભાગે પશ્ચાદ આપત્તિ-સંચાલનને જ આપત્તિ-સંચાલન મહત્વનો ભાગ ગણવામાં આવે છે,

જેમાં આપત્તિની ઘટના ઘટી ગયા પછીની સારવાર તરીકે લેવાતાં પગલાઓનો સમાવેશ થાય છે દા.ત. ધરતીકંપ થયા પછી અસરગ્રસ્તોને તેમાંથી બહાર કાઢવા, તેમની સારવાર કરવી, તેમને સલામત સ્થળે ખેસેડવા તેમની દવા, ખોરાક અને રહેઠાણની વ્યવસ્થા કરવી વગેરે. આ ઉપરાંત આપત્તિની ખરાબ અસરોનો ફેલાવો જડપદ્ધી અટકાવી શકાય તેવાં પગલાઓ લેવાં વગેરે. આ પ્રકારના આપત્તિ-સંચાલનમાં ખૂબ જ નાણાં, વ્યવસ્થાપન અને કેળવાયેલા માનવસંસાધનની આવશ્યકતા રહેતી હોય છે. પરંતુ કેટલીક આપત્તિઓને બાદ કરતાં મોટા ભાગની આપત્તિઓ તે કુદરતી હોય કે માનવસર્જિત, તેનું પૂર્વાપત્તિ-સંચાલન થઈ શકતું હોય છે. એટલે કે આપત્તિ આવતા પૂર્વે જ તેને અટકાવવાના કે તેની અસરકારકતા ઘટાડવાના આયોજિત પ્રયાસો થઈ શકતા હોય છે, જેને પૂર્વાપત્તિ-સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. જો દેશમાં આ પ્રકારની વ્યવસ્થા મજબૂત હોય અને તેમાં સમયાનુસાર તેમજ આવશ્યકતા અનુસાર પરિવર્તનો કરવામાં આવતાં હોય, તો ઘણીખરી આપત્તિઓને આવતી અટકાવી શકાય તેમન જ હોય, તો તેની અસરકારકતા ને ઘણા અંશે હળવી કરી શકતી હોય છે, જેથી ઓછામાં ઓછા લોકો અને વિસ્તાર તેનાથી અસરગ્રસ્ત થાય. “Prevention is better than cure”. આ ઉકિત અનુસાર હુર્દટના ઘટતા પૂર્વે જો તેના ઉપાયો કરવામાં આવે, તો તે ફાયદાકરક બને છે.

જે કુશળ આપત્તિ-સંચાલનનો એક અગત્યનો ભાગ છે.

આપત્તિ-સંચાલનની સુચારુ વ્યવસ્થા માટે નાણાકીય અને ભૌતિક અમ બંને પ્રકારે સાધનોની આવશ્યકતા રહે છે. ભારતમાં આ અંગેની વ્યવસ્થાની ચર્ચા કરીએ તો, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નાણાકીય ફાળવણી કરે છે. આ ઉપરાંત ભારતમાં આપત્તિ સંચાલન માટે UNDP દ્વારા પણ કેટલીક આર્થિક સહાય પ્રાપ્ત થાય છે. ભારત સરકાર અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સંયુક્ત ઉપકર્મે ભારતમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સફળતા બાદ ૧૭ રાજ્યોના ૧૭૬ જેટલા ખાસ અસરગ્રસ્ત વિસ્તારો માટે ડિઝાસ્ટર રિસ્કરિડિક્ષન (DRR) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે માટે ૨૦ મિલિયન ડોલર ફાળવવામાં આવ્યા છે, જે લગભગ ભારતીય ચલણ મુજબ રૂ. ૧૦૦ કરોડ જેટલા થાય છે. આ પ્રકારે ભારતમાં આપત્તિ-સંચાલન માટે બાધ સહાય પ્રાપ્ત થાય છે.

આપત્તિ-સંચાલન અંગે આંતરિક નાણાકીય વ્યવસ્થા અને ફાળવણીનો વિચાર કરીએ, તો કેન્દ્ર સરકાર ખાલ અને નોન-ખાલ અમ બે હેડ ડેફા રાજ્ય સરકારને આ અંગેની નાણાકીય ફાળવણી કરે છે. ભારતમાં આપત્તિ-સંચાલન માટે ૨૦૦૫માં અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો. તેમાં સૂચવાયેલા નિર્દેશોને ધાને લઈને ૨૦૦૧માં નવો આપત્તિ-સંચાલન અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો છે. જે મુજબ ભારતમાં આપત્તિ-સંચાલન માટેનું સંસ્થાકીય અને વહિવટી માળખું ઘડવામાં આવ્યું છે.

આપત્તિ-સંચાલન અંગેનું સંસ્થાકીય માળખું

રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓક્ટ-૨૦૦૫ મુજબ જે સંસ્થાકીય માળખું ઘડવામાં આવ્યું છે, તેનાં મહત્વના અંગો આ મુજબ છે.

યોજના જાન્યુઆરી-૨૦૧૭

૧. રાષ્ટ્રીય આપત્તિ-સંચાલન સત્તા : (National Disaster Management Authority) :

રાષ્ટ્રીય સ્તરે આપત્તિ-સંચાલન અંગે યોજનાઓ ઘડવા, નિષ્ણયો કરવા, તેમજ માનવસંસાધન વ્યવસ્થા ઊભી કરીને ક્ષમતા પૂર્વક કાર્યને અમલી બનાવવા માટે ૨૦૦૫ ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓક્ટ ડેટન આ કમિટીની રચના કરવામાં આવી છે, જેના માટે સંસ્થા તાલીમ, સંશોધન, નીતિધાતર, દસ્તાવેજ આધારો વગેરે તૈયાર કરે છે. આ સંસ્થા ઉપર્યુક્ત કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે સંપર્કમાં રહે છે અને તેમની જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને માનવસંસાધન તૈયાર કરે છે.

૨. રાજ્ય સ્તરીય આપત્તિ-સંચાલન સત્તા : (State Disaster Management Authority) :

રાષ્ટ્રીય સ્તરેથી ઘડાતા આપત્તિ-સંચાલનના કાર્યક્રમો, આયોજન, નીતિ અને નિષ્ણયોને રાજ્યસ્તરે આ સત્તાએ અમલી કરવાના હોય છે. પોતાના રાજ્યની વિશેષતા અને જરૂરિયાત પ્રમાણે તેમણે આ કાર્ય કરવાનું હોય છે.

૩. જિલ્લાસ્તરીય આપત્તિ-સંચાલન સત્તા : (District Disaster Management Authority) :

રાજ્ય સ્તરે કાર્ય કરતી આપત્તિ-સંચાલન સત્તા દ્વારા જિલ્લાસ્તરે અમલમાં મૂકવાના કાર્યો, જિલ્લા સ્તરીય આપત્તિ-સંચાલન મૂકવાના કાર્યો, જિલ્લાસ્તરીય આપત્તિ-સંચાલન સત્તાને સોપવામાં આવે છે. પોતાના જિલ્લાની જરૂરિયાતા અને વિશેષતા મુજબ તેઓએ આ કાર્યોનું અમલી કરણ કરવાનું રહે છે.

૪. આપત્તિવ્યવસ્થાપન રાષ્ટ્રીય સંસ્થા : (National Institute of Disaster management) :

૧૯૮૫માં નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપના થઈ હતી.

દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી ગૃહભાતાને સોંપાયા બાદ આ સંસ્થાનું નવું નામ નેશનલ ઈન્સ્ટિટ્યુટન ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવું આપવામાં આવ્યું, જે ટૂંકમાં NIDM તરીકે ઓળખાય છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય આપત્તિ-સંચાલન માટે માનવસંસાધન ઊભી કરવાનું છે, જેના માટે સંસ્થા તાલીમ, સંશોધન, નીતિધાતર, દસ્તાવેજ આધારો વગેરે તૈયાર કરે છે. આ સંસ્થા ઉપર્યુક્ત કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DSDMA) સાથે સંપર્કમાં રહે છે અને તેમની જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને માનવસંસાધન તૈયાર કરે છે.

૫. રાષ્ટ્રીય આપત્તિ-સંચાલન સેના : (National Disaster response force)

કોઈ પણ સમયે તાત્કાલિક આવી પડતી કુદરતી કે માનવસર્જત આપત્તિનો સામનો કરવા સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી ચાર ટીમ ખાસ કરીને રેફિયોલોજિકલ, ન્યુક્લિયર અને જૈવિક આપત્તિઓ સામે લડવા માટે ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવેલ છે.

આપત્તિ-સંચાલન અંગેનું વહિવટી માળખું :-

આપત્તિ-સંચાલન માટે ભારત સરકાર દ્વારા જે વહિવટી માળખું અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત ઊભુ કરવામાં આવ્યું છે, તે આ મુજબ છે.

૧. રાષ્ટ્રીય અન્નસેવા કોલેજ (National Fire Service college (NFSC))

આગજન્ય બનાવોના સમયે પૂરતી ક્ષમતા અને વ્યવસ્થા સાથે તેનું વ્યવસ્થાપન થઈ શકે તે માટે નાગપુરમાં જૂન-૨૦૧૦ માં

આ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ફાયર એન્જિનિયરિંગનો વિષય શીખવવામાં આવે છે. આગના સમયે સારી રીતે કાર્ય કરી શકે તે અંગેની તાલીમ આપીને બ્રિગેડ તૈયાર કરવામાં આવે છે.

૨. રાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ કોલેજ

આ સંસ્થા નાગરુકમાં આવેલી છે.

કુદરતી આપત્તિ કે માનવસર્જિત આપત્તિના સમયે લોકોનું વર્તન, વ્યવહાર અને પ્રતિસાદ કેવા હોવાં જોઈએ, તે અંગે તાલીમ આપે છે અને લોકોને આ અંગે તૈયાર કરે છે. રેડિયોલોજિકલ, કેમિકલ, બાયોલોજિકલ, તેમજ ન્યૂક્લિઅર આપત્તિ-સંચાલન અને વ્યવસ્થાપનની તાલીમ માટેની આ મહત્વપૂર્ણ સંસ્થા અને નોડલ ઓફિસ છે, જેની કામગીરી શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અને ૨૦૦૮ અંતર્ગત ઉપર્યુક્ત સંસ્થાકીય અને વહીવટી માળખું દેશમાં ઊભુ કરવામાં આવ્યું છે, આ અંગે નાણાંકીય ખર્ચ પણ જંગી થાય તો સ્વાભાવિક છે. રાષ્ટ્રીય કક્ષાએથી અમલમાં મુકાતા કાર્યક્રમો રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ રીતે થઈ શકે તે માટે તેરમા નાણાંપંચે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે નાણાંકીય ફાળવણીની ભલામણો કરેલી છે.

તેરમા નાણાંપંચની ભલામણો :

તેરમા નાણાંપંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકારના નાણાંખાતાએ આપત્તિ-સંચાલનની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રાજ્યને નાણાંની ફાળવણી કરેલ છે. તેરમા નાણાંપંચે આપત્તિ-સંચાલન માટે રાજ્યસર્તરે જે ભલામણ કરેલી છે તે આ મુજબ છે :-

૧. રાજ્ય આપત્તિ-સંચાલન ફંડ (State disaster response fund)

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૪૬ (૧) અને કલમ ૪૮ (૧) મુજબ નોશનલ ડિઝાસ્ટર રિસ્ટોન્ડિઝ

(NDRF) રાષ્ટ્રીય સર્તરે અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ટોન્ડ ફંડ (SDRF) રાજ્યસર્તરે સ્થાપનાની ભલામણ કરવામાં આવેલી છે. આગના સમયે સારી રીતે કાર્ય કરી શકે તે અંગેની તાલીમ આપીને બ્રિગેડ તૈયાર કરવામાં આવે છે.

નાણાંકીય ફાળવણી કરવાની ભલામણ કરી છે, જે મુજબ રાજ્યો વચ્ચે નાણાંકીય ફાળવણી આ મુજબ કોષ્ટક ૧.૧માં જોઈ તેરમા નાણાંપંચે દરેક રાજ્યના SDRFને શકાય છે.

કોષ્ટક ૧.૧

રાજ્ય આપત્તિસંચાલન ફંડ અંતર્ગત દેશનાં વિવિધ રાજ્યો વચ્ચે નાણાંકીય ફાળવણી

કોષ્ટક ૧.૧ (રૂ. કરોડમાં)

ક્રમ	રાજ્ય	૨૦૧૦-૧૧	૨૦૧૧-૧૨	૨૦૧૨-૧૩	૨૦૧૩-૧૪	૨૦૧૪-૧૫	કુલ
૧	અંગ્રેન્ડેશ	૫૦૮.૮૪	૫૩૪.૨૮	૫૬૦.૮૮	૫૮૮.૦૪	૬૧૮.૪૮	૨૮૯૯.૬૪
૨	અસુધાયાન્ડ્રાન્ડેશ	૩૬.૭૪	૩૮.૭૪	૪૦.૫૧	૪૨.૪૪	૪૪.૬૭	૨૦૩.૦૪
૩	આસામ	૨૬૩.૦૭	૨૭૬.૮૬	૨૮૦.૮૧	૩૦૪.૩૪	૩૨૦.૬૨	૧૪૫૭.૫૧
૪	બિહાર	૩૩૪.૮૫	૩૪૧.૨૧	૩૬૨.૦૦	૩૮૦.૨૧	૪૦૬.૫૭	૧૮૮૮.૨૪
૫	છત્તીસગઢ	૧૫૧.૩૨	૧૫૮.૮૮	૧૬૬.૮૩	૧૭૬.૧૭	૧૮૩.૮૩	૮૩૬.૭૪
૬	ગોવા	૨.૬૬	૩.૧૧	૩.૨૭	૩.૪૩	૩.૬	૧૬.૩૭
૭	ગુજરાત	૫૦૨.૧૨	૫૨૭.૨૩	૫૪૩.૦૫	૫૮૧.૨૭	૬૧૦.૩૩	૨૭૭૪.૫૪
૮	હસ્તિયાણા	૧૧૮.૮	૨૦૨.૫૫	૨૧૨.૬૮	૨૨૩.૩૧	૨૩૪.૪૮	૧૦૬૫.૮૨
૯	હિમાયાન્ડ્રાન્ડેશ	૧૩૦.૭૬	૧૩૦.૩	૧૪૪.૭૭	૧૫૧.૩૮	૧૫૮.૮૫	૭૨૨.૫૬
૧૦	જમ્બુ અને કશ્મીર	૧૭૨.૪૬	૧૮૧.૦૮	૧૮૦.૧૩	૧૮૮.૬૪	૨૦૮.૬૨	૮૫૨.૮૩
૧૧	જાર્ખંડ	૨૫૮.૪૫	૨૭૨.૪૨	૨૮૬.૦૪	૩૦૦.૩૪	૩૧૫.૩૬	૧૪૩૩-૬૧
૧૨	કશ્મિટક	૧૬૦.૫૬	૧૬૮.૦૧	૧૭૭.૪૬	૧૮૬.૩૩	૧૮૫.૬૫	૮૮૮.૧૪૧
૧૩	કેરાલા	૧૩૧.૦૮	૧૩૭.૬૩	૧૪૪.૫૧	૧૪૭.૦૪	૧૪૮.૩૩	૭૨૪.૨૮
૧૪	મધ્યપ્રેદેશ	૩૮૨.૭૫	૪૧૨.૩૮	૪૩૩.૦૧	૪૪૪.૬૬	૪૭૭.૩૮	૨૧૦૦.૨
૧૫	મહારાષ્ટ્ર	૪૪૨.૬૬	૪૬૪.૮૨	૪૮૮.૦૮	૫૧૧.૪૬	૪૩૮.૦૮	૨૪૪૬.૭૧
૧૬	મણિપુર	૭.૨૨	૭.૫૮	૭.૮૮	૮.૩૬	૮.૭૮	૩૮.૮
૧૭	મેઘાલય	૧૪.૬૪	૧૫.૩૮	૧૬.૧૫	૧૬.૬૬	૧૭.૮૧	૮૦.૮૫
૧૮	મિઝ્રામ	૮.૪૫	૮.૮૮	૮.૪૩	૮.૮	૧૦.૪	૪૭.૨૬
૧૯	નાગાંડેન્ડ	૪.૮૭	૫.૨૨	૫.૪૮	૫.૭૪	૬.૦૪	૨૭.૪૬
૨૦	ઓરિસ્ટા	૩૬૧.૫૮	૪૧૧.૧૬	૪૩૧.૭૨	૪૪૩.૩૧	૪૭૫.૮૮	૨૧૬૩.૭૫
૨૧	પંજાબ	૨૨૨.૬૨	૨૩૪.૦૭	૨૪૪.૦૭	૨૫૮.૦૬	૨૭૦.૮૬	૧૨૩૧.૭૮
૨૨	રાજ્યાન	૬૦૦.૬૬	૬૩૦.૬૬	૬૨૨.૨૨	૬૪૫.૩૩	૭૩૦.૦૧	૩૩૧૬.૦૦
૨૩	સિક્કિમ	૨૨.૭૫	૨૩.૮૮	૨૪.૦૮	૨૬.૩૩	૨૭.૬૪	૧૨૫.૭
૨૪	તામિલનાડુ	૨૮૩.૫૨	૩૦૮.૨	૩૨૨.૬૧	૩૩૮.૭૮	૩૪૬.૭૮	૧૬૨૧.૮
૨૫	ત્રિપુરા	૧૮.૩૧	૨૦.૨૮	૨૧.૨૮	૨૨.૩૪	૨૩.૪૭	૧૦૬.૭
૨૬	ઉત્ત્રપ્રેદેશ	૩૮૪.૩૮	૪૦૪.૬૬	૪૨૪.૮૮	૪૪૬.૧૩	૪૬૮.૪૪	૨૧૨૮.૫૧
૨૭	ઉત્તરખંડ	૧૧૭.૬૬	૧૨૩.૪૪	૧૨૮.૭૨	૧૩૬.૨૧	૧૪૩.૦૨	૬૫૦.૧૪
૨૮	પાંચ્યંગાળ	૩૦૪.૮૩	૩૨૦.૦૭	૩૩૬.૦૦	૩૪૨.૮૭	૩૬૦.૫૧	૧૬૮૪.૩૪
	કુલ	૬૦૯૯.૩	૬૩૯૧.૧૮	૬૭૦૦.૨૨	૭૦૩૫.૨૨	૭૩૮૦.૦૧	૩૩૪૮૦.૮૩

સૌચ : Annex 11.1, Thirteenth Finance Commission Report, PP 450, Ministry of Finance, GOI

૨. આપત્તિ-સંચાલન માટે ક્ષમતાનિર્માણ (Capacity building for disaster response) :

રાજ્ય અને જિલ્લાસ્ટરે આપત્તિ-સંચાલનક્ષમતા વધે તે માટે તેરમા નાણાંપંચે નાણાંકીય ફાળવણીની ભલામણ કરેલ છે જે અનુસાર પરંપરા કરેણું હોય. નીચેની ફાળવણી દેશના વિવિધ રાજ્યો વચ્ચે કરવામાં આવી છે, જેના

દ્વારા રાજ્ય અને જિલ્લાસ્ટરે આપત્તિ-સંચાલન અંગેની વ્યવસ્થાને મજબૂત કરવાની છે. (ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ મૂજબ આપત્તિ-સંચાલન માટે મજબૂત સંસ્થાકીય અને વહીવટી માળખું બનાવવાનું રહેશે આ ઉપરાંત આપત્તિ-સંચાલન માટે તાલિમબદ્ધ માનવસંસાધન ઊભું કરવું. ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (EOCS)

ઉત્તમ કરવાની આપત્તિ આપત્તા પૂર્વે જ તેની ઓળખ કરીને તેનું નિવારણ કરવા અંગેની આપોજનબદ્ધ વ્યવસ્થા ઉત્ભી કરવી

વગેરે આ માટે ફાળવવામાં આવેલાં નાણાંની રાજ્યવાર વહેંચણી કોષ્ટક ૧.૨માં વિગતવાર જોઈ શકાય છે.

આપત્તિ-સંચાલન ક્ષમતા ઘડતર માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે ગ્રાંટની ફાળવવણી

કોષ્ટક ૧.૨ (રૂ. કરોડમાં)

ક્રમ	રાજ્ય	૨૦૧૦-૧૧	૨૦૧૧-૧૨	૨૦૧૨-૧૩	૨૦૧૩-૧૪	૨૦૧૪-૧૫	કુલ
૧	અંગ્રેન્ડેશ	૬	૬	૬	૬	૬	૩૦
૨	અગ્રાંધીયાચલ પ્રદેશ	૧	૧	૧	૧	૧	૫
૩	આસામ	૫	૫	૫	૫	૫	૨૫
૪	બિહાર	૫	૫	૫	૫	૫	૨૫
૫	છત્તીસગઢ	૪	૪	૪	૪	૪	૨૦
૬	ગોવા	૧	૧	૧	૧	૧	૫
૭	ગુજરાત	૬	૬	૬	૬	૬	૩૦
૮	હરિયાણા	૫	૫	૫	૫	૫	૨૫
૯	હિમાચલપ્રદેશ	૪	૪	૪	૪	૪	૨૦
૧૦	જમ્મુઅન્ન કશ્મીર	૪	૪	૪	૪	૪	૨૦
૧૧	ઝાર્ખણ્ડ	૫	૫	૫	૫	૫	૨૫
૧૨	કશ્મીરક	૪	૪	૪	૪	૪	૨૦
૧૩	કેરલા	૪	૪	૪	૪	૪	૨૦
૧૪	મધ્યપ્રદેશ	૫	૫	૫	૫	૫	૨૫
૧૫	મહારાષ્ટ્ર	૫	૫	૫	૫	૫	૨૫
૧૬	માણસુર	૧	૧	૧	૧	૧	૫
૧૭	મેધાવિય	૧	૧	૧	૧	૧	૫
૧૮	મિઓરમ	૧	૧	૧	૧	૧	૫
૧૯	નાગાર્જુન	૧	૧	૧	૧	૧	૫
૨૦	ઓરિસ્સા	૫	૫	૫	૫	૫	૨૫
૨૧	પંજાબ	૫	૫	૫	૫	૫	૨૫
૨૨	રાજ્યાન	૬	૬	૬	૬	૬	૩૦
૨૩	કિલ્કિન	૧	૧	૧	૧	૧	૫
૨૪	તામિલનાડુ	૫	૫	૫	૫	૫	૨૫
૨૫	ત્રિપુરા	૧	૧	૧	૧	૧	૫
૨૬	ઉત્તરપ્રદેશ	૫	૫	૫	૫	૫	૨૫
૨૭	ઉત્તરાંધ્ર	૪	૪	૪	૪	૪	૨૦
૨૮	પશ્ચિમબંગાળ	૫	૫	૫	૫	૫	૨૫
	કુલ	૧૦૪	૧૦૪	૧૦૪	૧૦૪	૧૦૪	૫૨૫

સોર્સ : Annex 11.3 of Thirteenth Finance Commission Report Vol. II, Ministry of Finance GOL

૩. આગજન્ય આપત્તિ સેવાઓમાં સુધારણા (Revamping of fireservices) :

જિલ્લાસ્તરે શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આગ લાગવાના સમયે સુરક્ષા અંગેનું કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે તેરમાં નાણાંપંચની ભલામણ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રૂ. ૮૭.૫૧૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ નાણાંનો ઉપયોગ તેઓએ પોતાના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં

આગજન્ય આપત્તિ સામેની રક્ષણસેવાઓમાં વૃદ્ધિ કરવા માટે કરવાની છે. પહેલેથી ઉપલબ્ધ સેવા માળખામાં સુધારો કરવા માટે પણ આ નાણાંનો ઉપયોગ કરી શકાશે. ઉપરાંત આ નાણાંની ફાળવવણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજ્યના સ્ટેટ ફાયર સર્વિસીઝ ડિપાર્ટમેન્ટને કરી શકે છે. જોકે, તે માટે એક શરત રાખવામાં આવેલી છે કે, સ્ટેટ ફાયર સર્વિસીઝ ડિપાર્ટમેન્ટે દસ લાખથી વધારે વસ્તી ધરાવતાં શહેરોમાં (૨૦૦૧ની

વસ્તી ગણતરી પ્રમાણે) ફાયર હેઝાડ રિસ્પોન્સ એન્ડ મિટીગેશન પ્લાન ફરજિયાત પણે અમલમાં મુકવાનો રહેશે.

દેશનાં સાત રાજ્યોને આ માટે રૂ. ૪૭૨ કરોડનું ફંડ વિશેષ રૂપે ફાળવવામાં આવ્યું છે, જે કોષ્ટક ૧.૩માં જોઈ શકાય છે.

આગરકા સેવાઓમાં સુધારણા માટે રાજ્યો વચ્ચે ફાળવવામાં આવેલ ફંડ (રૂ. કરોડમાં) **કોષ્ટક ૧.૩.**

ક્રમ	રાજ્ય	કુલીફાળવણી
૧	અંગ્રેન્ડેશ	૧૭
૨	હરિયાણા	૧૦૦
૩	મિઓરમ	૨૦
૪	ઓરિસ્સા	૧૫૦
૫	ત્રિપુરા	૧૫
૬	ઉત્તરપ્રદેશ	૨૦
૭	પશ્ચિમબંગાળ	૧૫૦
	કુલ	૪૭૨

સોર્સ : Thirteenth Finance Commission Report, Ministry of Finance GOI

તેરમાં નાણાંપંચે સૂચવેલ વિવિધ સેવાઓમાં વૃદ્ધિ દ્વારા આપત્તિ-સંચાલન અંગેના વ્યવસ્થાતંત્રને ભારતમાં મજબૂત બનાવી શકાય છે. મોટા ભાગે આપણે ત્યાં એવું બનતું રહ્યું છે કે કોઈ પણ આપત્તિ આવી ગયા પછી તેને પહોંચી વળવા માટે ઓચિત્તા જ દોડવામ કરી મૂકવામાં આવે છે. આમ થવાથી જાનમાલાની હાનિ ખૂબ જ વધારે થાય છે તથા તેની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો પણ વધારે થાય છે, તેથી તેરમાં નાણાંપંચે સંસ્થાઓ દ્વારા આપત્તિ-સંચાલન વ્યવસ્થાપન માટે ખર્ચને આપત્તિનાં દુષ્પરિણામોને શક્ય તેટલા હળવાં બનાવવાં જોઈએ.

ડૉ. વંદના ત્રિવેદી ગુજરાત કોંસેજ,
અમદાવાદમાં પ્રાધ્યાપક છે.

યુવાનો માટે મોબાઇલ અને ડિજિટલ બેંકિંગ ઇન્ડક્શન અભિયાન

ઓનલાઈન બેંકિંગના ફાયદા આગળ ધરાવવા અને કેશલેસ વ્યવહારોની પદ્ધતિ પર લોકોને તાલીમ આપીને કુશળ બનાવવા યુવા પેઢીને સાંકળવા યુવાન ભાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં તાજેતરમાં યુવાપેઢી માટે મોબાઇલ અને ડિજિટલ બેંકિંગ ઇન્ડક્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. Youth4 Digital Paisa નામની આ પહેલાનું નેતૃત્વ નેહરુ યુવાકેન્દ્ર સંગઠને કર્યું હતું.

દિલ્હીના વિવિધ વિસ્તારો અને તેની બહારના વિસ્તારોમાંથી ૬૦૦થી વધારે યુવાનો ઇન્ડક્શન કાર્યક્રમમાં જોડાયા હતા. એનવાયકેઅસ દ્વારા સ્થળ પર પરીક્ષા લેવા અને ઇન્ટરવ્યૂ લેવા એક ટીમ બનાવવામાં આવી હતી, જેણે હાજર થયેલા યુવાનોમાંથી શ્રેષ્ઠ ૧૦૦ યુવાનોની પસંદગી કરી હતી. આ પસંદ થયેલા યુવાન એક મહિના માટે મંત્રાલયના એનવાયકેઅસ સાથે જોડાશે અને તેમને ૧૦૦ કુટુંબોને કેશલેસ વ્યવહારો શીખવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેના બદલામાં દરેક યુવાનને દર મહિને માનદું રૂ. ૧૦,૦૦૦/- આપવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારમાં ‘તમામ માટે મકાન’

પ્રધાનમંત્રીને ઔદ્યોગિક રીતે ગ્રામીણ વિસ્તારોમાં તમામ માટે મકાનની પોજના શરૂ કરી હતી, જે અંતર્ગત સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ગ્રામીણ કુટુંબને સુરક્ષિત અને સલામત પાંકુ મકાન પ્રદાન કરવાનો ઈરાદો પરાવે છે. પ્રધાનમંત્રી આવાસ પોજના (ગ્રામીણ) તેના પ્રથમ તબક્કામાં માર્ય, ૨૦૧૮ સુધીમાં એક કરોડ મકાનોનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પરાવે છે. તેમાં દરેક મકાનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે દરેક કુટુંબને રૂ. ૧.૧.૫ લાખ સુધીની સહાય મળશે. તેમાં રૂ. ૩૦,૦૦૦/- સુધીની બંકલોનની જોગવાઈ પણ સામેલ છે, જે લાભાર્થી ઈચ્છે તો. લાભાર્થીની પસંદગી સંપૂર્ણપણે પારદર્શક પ્રક્રિયા મારફતે કરવામાં આવશે, જેમાં સામાજિક-આર્થિક વસ્તિગણતરી ૨૦૧૧ના આંકડાનો ઉપયોગ થશે અને ગ્રામસભા મારફતે તેની ખરાઈ કરવામાં આવશે.

પીએમએવાય-જી સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આઈટી કે ડીભીટી, આપાર ખેટકોર્મ અને પ્રધાનમંત્રી જનપન પોજના (પીએમજેડીવાય)નો સમન્વય કરવાનું મોટું અને મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમ વર્ષ ૨૦૧૮ સુધીમાં ૫ લાખ ગ્રામીણ કટિયાઓને કુશળતા પ્રદાન કરશે અને હાઉસિંગના પ્રકાર, પર્યાવરણ સંબંધિત જોખમો અને કોટુંબિક જરૂરિયાતોના વિસ્તૃત અભ્યાસને આપારે સમગ્ર દેશમાં ૨૦૦થી વધારે હાઉસિંગ ડિઝાઇનને મંજૂરી આપે છે. રસોંનું, વીજળીનો પુરવઠો, એલપીઝ, શીચાલય તથા લાભાર્થીની ઉચ્ચિત પસંદગી અને કામ કરવાની પ્રગતિની પુષ્ટિ કરવા આઈસીટી અને અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્વાનિક સામગ્રીનો મોટા પાયે ઉપયોગ કરવાની કલ્પના કરવામાં આવી છે. સંમતિ સાથે આપાર લિન્ક બંકખાતાઓ સાથે આઈટી કે ડીભીટી પદ્ધતિ મારફતે એમેન્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે સંપૂર્ણપણે પારદર્શકતા અને જવાબદારી લાવશે. ગ્રામીણ કટિયાઓને સ્થળ પર ૪૫ દિવસની સઘન તાલીમથી ગરીબ કુટુંબોની કુશળતા વધારવામાં મદદ મળશે.

પ્રકાશન તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૬
પોર્ટિંગ તા. ૧ જીન્યુઆરી, ૨૦૧૭

YOJANA (GUJARATI), January 2017

O.I.G.S.

પ્રતિશ્રી,

પ્રેષક :

તંત્રીશ્રી,

'યોજના' કાર્યાલય

પ્રકાશન વિભાગ, ભારત સરકાર

અંબિકા કોમ્પ્લેક્સ, પુ.કો. બેન્કની ઉપર, પાલડી,

અમદાવાદ-૩૮૦ ૦૦૭

નીચેના પુસ્તકો ૫૦ ટકા વળતર ઉપર ઉપલબ્ધ છે

બી.એમ. આઈ. સીરીઝ

૧	મૌલાના અબુલ કલામ આજાદ	૭૫.૦૦
૨	માદામ બિખાઈજ કામા	૬૦.૦૦
૩	સી. એફ. અન્નપુરુષ	૧૫૦.૦૦
૪	કાલિદાસની કહાની	૩૨.૦૦
૫	કાકા સાહેબ કાલેલકર	૨૧૦.૦૦
૬	સ્વામી દ્યાનંદ સરસ્વતી	૮૦.૦૦
૭	કાનુંબાપા	૮૦.૦૦
૮	આપણો રાષ્ટ્રધર્જ	૧૧૦.૦૦
૯	ભારતના ગૌરવ ગ્રંથ - ગુજરાતી	૭૦.૦૦
૧૦	ભારતીય જનજ્ઞાતિઓ અતીતના ઝરણેથી	૧૦૦.૦૦
૧૧	ભારતીય જનતાના ઈતિહાસની રૂપરેખા	૭૦.૦૦
૧૨	ગુજરાતમાં જાગૃતિની લહેરો	૭૨.૦૦
૧૩	ગુજરાતના આદિવાસી નૃત્યો	૭૦.૦૦

૧૪	દ્રાષ્ટાનો અને ચિત્તકો	૫૦.૦૦
૧૫	સંગીતશો	૪૫.૦૦
૧૬	કવિઓ, નાટ્યલેખકો અને આધ્યાત્મિકારો	૭૫.૦૦
૧૭	તત્ત્વજ્ઞાનના આધ્યાત્મિક	૩૮.૦૦
૧૮	સંતો અને ભક્તકવિઓ (ભાગ-૧)	૪૫.૦૦
૧૯	સંતો અને ભક્તકવિઓ (ભાગ-૨)	૫૬.૦૦
૨૦	દાર્શનિક અને ધાર્મિક અગ્રેસરો	૨૮.૦૦
૨૧	વૈશાનિકો	૪૫.૦૦
૨૨	સૌદર્ય મીમાંસકો	૫૦.૦૦
૨૩	વાત્મીકિ અને વ્યાસ	૨૨.૦૦
૨૪	રામાયણ, મહાભારત અને ભાગવતના લેખકો	૮૫.૦૦
૨૫	રાજકુમારી નિહાલદે	૧૨.૦૦
૨૬	સરકાર સર્પગૃહની વાર્તા	૪૮.૦૦
૨૭	અંગ્રેજભાગની માર્ગદર્શિકા	૧૧૫.૦૦
કુલ રૂ.		૧૮૯૩.૦૦